

# નરસુક્રવના સરળ જીવન



- ડૉ. પી. બી. પટેલ



“વિશની અતિ પ્રાચીન એકવીસ સંસ્કૃતિઓમાંથી ઓગફીસ સંસ્કૃતિઓના વિનાશનું કાંઈક છે – મધ્યપાન. વિશના વિનાશ માટે એકલો શરાબ જ પૂરતો છે.” – પ્રો. આનોદ ટોયન્બી

“બંદુકની તમામ ગોળીઓ, તમામ જંતુઓ અને વાપરસ કરતાં પણ ધૂમ્રપાન વધુ ખતરનાક છે.” – ડૉ. હોલિસ



:: સૌજન્ય ::

## ધી વિજય કો. એ. બેંક લિ.

રજી. અને મુખ્ય ઓર્ડિનેશન : ‘નોબલ્સ’, નહેરુશ્રીજ સામે, આશ્રમરોડ, અમદાવાદ-૮.

# વ्यसनमुक्तिना सरળ ઉપાયો

લેખક :

ડૉ. પી. બી. પટેલ (M.S.)

સર્જન-કેન્સર સ્પેશિયાલિસ્ટ

“કેદાર”

રાજ્યસ્થાન હોસ્પિટલ સામે,

શાહીબાગ, અમદાવાદ-૪

ફોન : (ઓ) ૭૭૬૪૮૮૦ (રહે.) ૭૮૬૫૮૮૮

(ઓ) ૩૭૮૫૩૮

## લવકુશ પ્રકાશન

શિવશ્રદ્ધા સર્જિકલ હોસ્પિટલ,  
મોહન સિનેમા સામે, અસારવા,  
અમદાવાદ-૩૬૦ ૦૧૬

## આ જ લોખનું અન્ય પુસ્તક વાંચો

કુન્ઝર એટલે કેસર એ માન્યતા દ્વારા કરી,  
કુન્ઝર તુપર વિજય માટેના રેસના બતાવતું અદ્ભુત પુસ્તક

# કુન્ઝર પાઠ્ય

(વાસ્તવદશી અને દરેક જીવ ઉપયોગમાં  
લાદ રહે તેવા સાચોટ હ્યાય)

: લેખક :

ડૉ. વી. વી. પટેલ (M. S.)

પ્રકાશક : નવનીત પરિકરણ (દ્વારા) લિમિટેડ, પ્રેમનગર, અમદાવાદ ૩૮૦ ૦૫૨

Wonderful, informative and encouraging.

Ahmedabad Medical Association

I strongly recommend compulsory reading of  
this very useful book..

Dr. S. G. Vaidya

Hon. Secretary, GOA Cancer Society

Only ignorance will keep a person away from  
His book.

Dr. O. P. Gupta  
Hon. Physician to Governor of Gujarat

Excellent presentation, gift to patients and relatives,  
worth keeping in waiting room.

Gujarat Medical Journal

લેખિકર અને સૌથી ભાયામાં, વૈજ્ઞાનિક દર્શિકાશી રાખી, ટીકા  
એને તરફથી સમજીતું આપવાને પ્રોત્સાહિય પ્રયત્ન. મુક્કરે પણ એ  
પુસ્તક વાળીને તેમના પ્રશ્નાદસ્તને અનેક સવાલોના સર્વોચ્ચ અને મહિંદુક  
જવાબ આપી શકે.

લિનિકર કુન્ઝર સંજીન - ટાઇ, જુલાઓક અને પાછાવટી લોન્ચિંગ, અને,

## અપ્પણ

શુવનની પળોપળ  
 ઘસાઈને  
 યંદન કેવી સુવાસ  
 અને  
 શોરડી કેવી મીઠાંશા  
 આપનાર  
**મીતા**  
 ને

ઘૃષ્ટં ઘૃષ્ટં પુનરથિ પુનશ્ચન્દનં ચારુગન્ધં ।  
 છિદ્રં છિદ્રં પુનરથિ પુનઃ ર્વાદુ ચૈવેકુદળ્ડમ् ॥

વારંવાર અનેઝ વખતે ભલે ઘસવામાં આવે, પરંતુ  
 ઉત્તમ ગંધવાળું યંદન એ દરેક વખતે એવું જ યંદન  
 રહે છે, તેવી જ રીતે વારંવાર અનેઝ વખત ભલે જાપો  
 કેટુંકા ઊરો, પણ શોરડીનો હુંકા દરેક વખતે એવો  
 ને એવો જ મીઠો રહે છે.

## ॐ શાંતિ

### પ્રિય વાચકો,

આજે આપણે જ્યારે શબ્દોના સૂત્રથી ભિલન મનાવી રહ્યા છીએ ત્યારે એક વાત કહેતાં ખૂબ ગૌરવ થાય છે કે આપણે આપણા જીવનમાં એવું કાંઈક કરવા માટે સર્જાયા છીએ કે હિતિહાસના પાને તે વાતો ચિરસ્મરણીય બની રહે.

વ્યક્તિમાં સમાયેલું દેવત્વ આજે લું થઈ ગયું છે, પરિણામે માનવજીવન પાંગળું, નિર્મિત્ય અને નૂરવિહીન અનુભવાઈ રહ્યું છે. આવા સમયે કોઈક આશાનું ડિરણ આપણા સહુનાં માટે છે કે જે અંધકારમાં પ્રકાશ પાથરે છે, તે છે ભારતનો પ્રાચીન રાજ્યોગ....

આ રાજ્યોગ એટલે એક ચોક્કસ પ્રકારનું વિજ્ઞાન,  
પૂર્ણ વ્યાવહારિક જ્ઞાન,  
સર્વાંગી વિકાસની પદ્ધતિ,  
આદર્શ જીવન જીવવાની કળા,  
દિવ્યતા તરફ જીવાની પ્રક્રિયા.

સહજ શબ્દોમાં એમ કહેવાય કે આત્માનો પ્રભુપિતા સાથેનો સમજપૂર્વકનો સ્લેહયુક્ત સંબંધ, પ્રભુપિતાની યાદ.

પરમાત્માની યાદમાં એટલી બધી શક્તિ છે, કે જેથી માનવ .

- હિન્દ્રિયો પર કાબુ મેળવી શકે છે.
  - માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરે છે.
  - સંકલ્પશક્તિમાં દૃઢતા લાવી શકે છે.
  - મન પર નિયંત્રણ કરી શકે છે.
  - આત્મિક શક્તિનો અનુભવ કરે છે.
  - પરિણામે વ્યક્તિ જે ધારે તે કરવા માટે શક્તિમાન બને છે. પ્રજ્ઞપિતા પ્રભુકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં એવા અગણિત ધખલા છે કે જેમના જીવનમાં યોગ દ્વારા અનેકવિધ પરિવર્તનો જોવા મળ્યા છે.
  - દા. ત., ધેરી નિરાશામાં દૂબેલાને જીવનની નવી દિશા મળી છે.
  - બીમારીથી ભાંગી પડેલું મન, માનસિક સ્વાસ્થ્ય દ્વારા શરીરને નવચેતન આપી શક્યું છે.
  - સ્વજ્ઞનોના મૃત્યુ જેવા પ્રસંગોએ, માનસિક સ્થિરતા રાખી શક્યા છે.
  - વ્યસનો અને વિકારોની માયાજીણથી સંપૂર્ણપણે મુક્ત થયા છે.
- ખરેખર વર્તમાન સમયે માણસનાં જો કોઈ દુષ્મન હોય તો તે વ્યસનો,

વિકારો, કુસંગ અને કેફી દ્રવ્યો છે. આ બધાની અસરો (હેઠળ) નીચે જીવતો માનવી સાચે જ ગુલામ બની ગયો છે. બંધનમાં બંધાઈ ગયો છે. આ જ્વાળામુખી ક્યારે, કઈ ઘડીએ અને કેવી રીતે સત્ત ચરિત્રની શક્તિનો નાશ કરશે તે તો કહી શકાય તેમજ નથી.

કારણ માત્ર એટલું જ કે, “દુર્ગુષો તરફ જતો રસ્તો એ માત્ર ચીકણો જ નથી હોતો, ઢાળવાળો પણ હોય છે. શરૂઆતમાં તો એકાદ જ દુર્ગુષ... સાવ નાનો દેખાતો દુર્ગુષ... જ્યારે જીવનમાં પ્રવેશે છે અને પછી બ્લોટિંગ પેપર પર પડતાં શાહીના ટપકાની જેમ એ દુર્ગુષ મોટો ને મોટો જ થતો જાય છે અને પોતાની સાથે બીજા અનેક દુર્ગુષોને પણ એ ખેંચી લાવતો હોય છે.

માટે જીવનની અતિગંભીર બાબત જાણી લઈએ કે આ બધી બાબતોમાં સમયને નાચ કરવા જેવો નથી; નહિતર સમય આપણાને નાચ કરી નાખશે.

જે દવા લઈ શકે છે, તે જ રોગમુક્ત થઈ શકે છે. માટે આ બધા દુર્ગુષોથી મુક્ત થવાનો સરળ ઉપાય રાજ્યોગની આધ્યાત્મિક દવા જ છે. રાજ્યોગનો આટલો બધો મહિમા સાંભળીને, એમ થાય કે ચાલો આપણે પણ એનો પ્રયોગ કરીએ. તો જેમ કોઈ પણ સારવાર માટે હોસ્પિટલ જોઈએ, તેમ બ્રહ્માકુમારી સંસ્થાના કોઈ પણ કેન્દ્ર ઉપર જઈ આનો નિયમિત અભ્યાસ આપ કરી શકો છો. સાત દિવસ, રોજ એક કલાક, નિયમિત રીતે તેનું પ્રાથમિક જ્ઞાન મેળવી, યોગ અભ્યાસને જીવનની ટેવ બનાવીએ, તો જેમ કહેવાયું છે કે, “Practice Makes A Man Perfect.” અભ્યાસ એ જ કેવળ અનુભવનો આધાર છે.

કારણ, રાજ્યોગ એ એક સ્થાને બેસીને, ફક્ત આસન કે પ્રાણાયામ કરવાની કિયા નથી પરંતુ એ એક શુદ્ધ, સકારાત્મક અને શ્રેષ્ઠ જીવન જીવવાની પદ્ધતિ છે. ચોક્કસ દિશા અને ઊંચા લક્ષ્ય સાથે, મજબૂત મનોબળથી જીવવાની રીત છે, તો આપ સહુને નિમંત્રણ છે.

ચાલો, યા હોમ તે કરીને પડો, ફટેહ છે આગે !

મિત્રો ! યાદ રહે !

**“કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો.  
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો !”**

બ્રહ્માકુમારીઝ, “સર્વલાઇટ” કેન્સરોડ, શાહીબાગ, અમદાવાદ - ૪

ટે. નં. ૦૮૯૫૭૩૨૩

દ્રોગ સમયમાં પ્રસિદ્ધ થાય છે

## સ્ટેનન

લેખક : ડૉ. પી. બી. પટેલ

- ગુજરાતની પ્રજાને ઊંસરની સારવાર માટે નવી રાહ ચિંધનાર  
“ઊંસર વિજય” ના લેખકની ઊસમે
- સ્તર વિષે આપે જાણવું જરૂરી છે એ બધું જ ઓમાં છે.
- નાજુક, નમાણું, વાસ્તવદર્શી છતાં અત્યંત ઉપયોગી
- વારંવાર વાંચવું ગમે તેવું
- ખૂબ જ સરલ રજૂઆત
- અલાણ પણ સમજુ શકે તેવી વિપુલ માત્રામાં ઝોટોગ્રાહ

ઝેના માટે	શા માટે
નવયૌવનાઓ માટે	કુમળીવયે પોતાના શરીરમાં થતા ફેરફાર સમજ્વા માટે
બઢેનપણીઓ માટે	પોતાની સર્પીને લગનમાં અમૂલ્ય અને યાદગાર ભેટ આપવા
માતાઓ માટે	પોતાની લાડલી પુત્રીને જીવનમાં યોગ્ય માર્ગદર્શન આપવા
પતિદેવો માટે	પોતાના જીવનસાથીના સાચા જીવનસાથી બનવાના પ્રયત્નિષ્પત્તે
શાળા, ડેંકેજો અને લાઈફ્રેશીઓ માટે	અનેક નવયુવતીઓને જિંદગીનો સાચો રસ્તો બતાવવા

આપની કોપી આજે જ એડવાન્સમાં નોંધાવી શે.

મળો કે મળો

ડૉ. પી. બી. પટેલ

શિવશ્રદ્ધા લોસ્ટિફલ,

મોહેન સિનેમા સામે, અસારવા, અમદાવાદ - ૧૬ ટે. નં. ૩૭૬૪૬૦

## આંબો વાવવાનું કામ

સેવા એજ સૌથી મોટો ધર્મ છે, એમ માની આપણા દેશના અનેક લોકો પોતાનાથી થાય એવું નાનું મોટું સેવાનું કામ કરે છે. વસ્ત્રદાન, અન્નદાન, સંમયદાન, પાણીની પરબ, સ્મરણગૃહ, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ એવાં અનેક સેવાનાં કાર્યો કરે છે.

થોડાક તો એવા પણ લોકો છે કે જે પોતાનું તન, મન, ધન, સમય અને શક્તિ એમ સર્વસ્વ સમાજ સેવામાં અર્પણ કરી દે છે.

મિત્રો દારા મશકરીઓ, સમયનો, પૈસાનો અને શક્તિનો અભાવ જેવી અનેક મુશ્કેલીઓ વચ્ચે સમાજસેવકો સેવા કરે છે. પોતાના ધ્યાનમાં હાડમારી પણ સહન કરી લે છે.

પણ જીવનને અંતે, અનેક સમાજસેવકોને પૂરો સંતોષ થતો નથી. કેઢલી શક્તિ રેઝી, કેટલો સમય વાપર્યો, કેટલા પૈસા ખર્ચ્યા ને અંતે આ પરિણામ ! છેવટે એમને એમ થાય છે કે જે મને ખબર હોત કે આવું ફળ આવશે તો આ કામ ન કરત !

સમાજસેવાનું કામ આંબો વાવવા જેવું હોવું જોઈએ. એક વખતનો પરિશ્રમ અને પછી જિંદગી સુધી અરે ! પેઢી દર પેઢી એનું ફળ ચાખ્યા કરે.

બસ, આવા જ આશયથી આ બીજ વાયું છે. એને પાળીપોધીને મોટું કરવામાં લાયન્સ ક્લબ ઓફ શાહીબાગ, લાયન આત્મારામભાઈ પટેલ, જમનાદાસ ગ્રાન્ટાન્ડ સંકુલ, લાયન રાશ્મિકાન્નભાઈ અને લાયન્સ ક્લબ શાહીબાગના સર્વ મેખર્સનો અમૂલ્ય ફાળો છે.

લાયન્સ ક્લબ ઓફ શાહીબાગે વ્યસનમુક્તિ પણ શરૂ કર્યો એની જવાબદારી મારા શિરે આવી. વર્ષોથી શાળાઓ, કોલેજો, પુનિવર્સિટી અને જાહેર સંસ્થાઓમાં મેં આપેલાં પ્રવચનોના આધારે વાસ્તવિક જીવનને અનુરૂપ અને સર્વલોકો ઉપયોગ કરી શકે એવી સરલ રીતે આ પુસ્તિકા રજૂ કરી છે.

આ પુસ્તિકાને લાયન રાશ્મિકાન્નભાઈએ એમના ઉમદાસ્વભાવ અને સતત સમાજરોવાની ભાવનાના લીધે દિવાળી બેટ પુસ્તક તરીકે રજૂ કર્યું છે. એમણે અંગત રસ લઈને નવોઢાની જેમ આ પુસ્તિકાને એવું સુંદર બનાવ્યું છે કે જેથી બધાને વારંવાર વાંચવાની હિચ્છા થાય. એમની જેમ આપણે બધા પણ પૈસાનો આવો સદ્ગુપ્ત્યોગ કરીએ તો કેવું સારું !

સી. જમનાદાસની કંપનીના વ્યવહાર કુશળ અને નમ સ્થાન તથા ચંદ્રિકા પ્રિન્ટરી અને અનેક મિત્રો જેમણે આમાં નાની મોટી મદદ કરી છે એ સર્વનો હું આભારી હું.

આ નાનકડો આંબાના છોડને આપણે બધાએ ઉછેરીને વિશાળ વૃક્ષ બનાવવાનું છે. એટલું જ નહીં અનેક વિશાળ આંબાવાડિયાં બનાવવાનાં છે. એવાં આંબાવાડિયાં કે જેની મહેક એટલી સરસ હોય કે જ્યાં કોઈને વ્યસન કરવાની કલ્યાન પણ ન આવે.

આપ જો આ પ્રવૃત્તિ ઉપાડી લેશો તો સૌથી મોટો શક્કા એ થશો કે તમારાં બાળકો, કુટુંબીજનો, પાડોશીઓ, સગાંસંબંધીઓ અને મિત્રો વ્યસનમુક્ત થશો અને વ્યસનથી મુક્ત વાતાવરણ વચ્ચે જીવવાનો કંઈક અનેરો આનંદ તમને આવશે. સાથે સાથે સેવા કરવાનો સંતોષ તો ખરો જ.

આંબાનો આ નાનકડો છોડ આજે તમને અર્પણ કરું હું. એનાં વિશાળ આંબાવાડિયાં બનાવવાનું કામ આપણા બધાનું છે. એ મહેકતા આંબાવાડિયામાં તમારો પણ એક સુંદર આંબો હશે. એનાં અમૃત ફળ તમે, તમારાં બાળકો, કુટુંબીજનો, પાડોશીઓ, મિત્રો અને સગાંસંબંધીઓ વર્ષો સુધી ખાદ્યા કરશો. તમને મળશે એમની તુમિનો આનંદ. એવું સુખ જે અન્ય કોઈ રીતે મળતું નથી. કોઈ આપી શકતું નથી. તમારે જાતે જ તમારા માટે પેઢા કરવાનું છે. આવો, સાથે મળીને આ સુખના સહભાગી થઈએ. - ડૉ. પી. બી. પટેલ

## અનુક્રમ

પ્રકરણ	વિગત	પા.ન.
૧. તમાકુ છોડો, અથવા રિબાઈ રિબાઈને મૃત્યુ પામો .....		૧
૨. તમાકુની ભેટ : ભલભલાનાં મોં બંધ કરી દેતો રોગ ઓરલ સબમ્યુક્સ ફાઇબ્રોસીસ .....		૨૧
૩. તમાકુની ભેટ : કેન્સરનો સગોભાઈ લ્યુકોપ્લેકીયા .....		૨૮
૪. દાહ (મધ્યપાન) કેન્સરનું પણ કારણ બની શકે છે ! .....		૩૦
૫. દ્રગથી બચીએ... .....		૩૭
૬. વ્યસનમુક્તિના આ રહ્યા સરળ રસ્તાઓ ! .....		૪૩
૭. સ્વયં વ્યસનમુક્તિના સરળ ઉપાય .....		૬૧
૮. માંસાહાર ને કેન્સર .....		૭૩
૯. ગલ્લા : ભારતના વિશિષ્ટ રોગ-ઉછેરકેન્દ્રો .....		૮૧

- વ્યસનમુક્તિના સરળ ઉપાયો : © ડૉ. પી. બી. પટેલ
- ધી વિજય કો.ઓ. બેંક તરફથી વિશિષ્ટ ભેટ પુસ્તિકા
- મૂલ્ય : વાંચો અને વંચાવો. વ્યસનમુક્તિ યજ્ઞમાં અમારી સાથે જોડા જાઓ.

દ્વિતીય આવૃત્તિ

- પ્રકાશન :

### લવકુશ પ્રકાશન

શિવશ્રદ્ધા સર્જકલ હોસ્પિટલ

મોહન સિનેમા સામે, અસારવા, અમદાવાદ - ૧૬

- મુદ્રક :

### ચિરાગ ગ્રાફિક્સ

પ્રિતમપુરા સો. નં.૧, શાહીબાગ, અમદાવાદ. ફોન : ૩૮૫૦૨૭

૧.

## તમાકુ છોડો, અથવા રિબાઈ રિબાઈને મૃત્યુ પામો

માણસ અને પશુ વચ્ચેના તફાવતમાં મહત્વનો મુદ્રો માણસની સંવેદનશીલતા અને વિચારવાની શક્તિને મુખ્ય ગણવામાં આવે છે. પરંતુ કેન્સરના દર્દીઓમાં ધૂમ્રપાન અને તમાકુના સેવનથી થતા કેન્સરનો ભોગ બનેલાનું ૩૦ ટકા જેવું પ્રમાણ જાહેરિને માણસની એ બંને શક્તિ વિષે શંકા જન્મે છે.

તમામ સિગારેટના પેક તેમજ તમાકુયુક્ત મસાલા ગુટકાના પાઉચ ઉપર એ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે એવું લખાયેલું હોવા છતાં કેટલી મોટી સંઘ્યામાં લોકો તમાકુનું સેવન મોજથી અને 'માણસ'ને ન છાજે એવી નફટાઈ સાથે કરે છે !

તમાકુથી આખા વિશ્વમાં દર વર્ષે એક કરોડ લોકો મૃત્યુ પામે છે, ભારતમાં દસ લાખ લોકો !

તમાકુ હાનિકારક છે એ વાત બધા સ્વીકારે છે પરંતુ એનાથી કેટલું મોટું નુકસાન થાપ છે એનો અંદાજ બહુ ઓછાને હોય છે ! આ લેખ વાંચ્યા પછી એનો પાક્કો અંદાજ આવી જશે અને પછી પણ તમાકુનું સેવન ચાલુ રાખનાર માણસની સંવેદનશીલતા વિષે શંકા ઊઠવી જોઈએ.

કેન્સર વિષે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે ભારે જહેમત લઈને, જીણામાં જીણી વિગતો સાથે તથ્યોને અહીં કાગળ ઉપર રજૂ કર્યા છે. આપે પણ આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને એમના પુણ્ય કાર્યમાં હાથ-સાથ આપવાનો છે.

\* બંદૂકની તમામ ગોળીઓ, તમામ જંતુઓ અને વાયરસ કરતાં પણ ધૂમ્રપાન વધુ ખતરનાક છે.

- ડૉ. હોલીસ (હેલ્પ કમિશનર, ન્યૂઝોઝ)

\* જીવન જીવવાની પદ્ધતિ અને રોગો (લાઈફ-સ્ટાઇલ ડિઝીગીસ) :

આગામી બે દાયકાઓમાં વિકસિત અને વિકસતા, બંને પ્રકારના દેશોમાં મૃત્યુનાં કારણો એકસરખાં હશે એવી આંતરરાષ્ટ્રીય તબીબી વર્તુણોએ આગાહી કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અહેવાલ અનુસાર આગામી દાયકાઓમાં લોકો હવે ચેપી રોગોથી મરવાને બદલે તેમની જીવન જીવવાની પદ્ધતિને કારણે વધુ મરશે. જીવન જીવવાની પદ્ધતિથી થનારાં મૃત્યુનાં આ કારણોમાં

બિનઆરોગ્યપ્રદ ખોરાક, માનસિક દબાજા, તમાકુનું સેવન, બેઠાં જીવન અને ક્ષરતનો અભાવ મૃત્યુ હશે.

આ અહેવાલ અનુસાર વિશ્વના વિવિધ દેશોમાં જડપી ઉદ્ઘોગીકરણ પામેલા દેશોમાં લોકોની બદલાયેલી લાઈફ-સ્ટાઇલને કારણે દર વર્ષે ૮૨ લાખ લોકો મૃત્યુ પામે છે. આ બધાંના મૃત્યુના કારણમાં હાઈ એટેક, સ્ટ્રોક (લકવો), કેન્સર અને શાસની બીમારીઓ વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજા વિશ્વના દેશોમાં આવાં કારણોસર થતાં મૃત્યુનો, આંકડો એક કરોડ દસ લાખનો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રવક્તાના જાળાવ્યા અનુસાર વાયરસ, પેરેસાઈટ્સ અથવા બેક્ટેરિયા કરતાં હવે ધૂમ્રપાન કરનારા લોકો વધુ જોખમી રોગોનો ભોગ બનવાની સંભાવના ધરાવે છે. ખાસ કરીને હાઈ એનિમલ ફિટ (ધી, માંસાધાર), મીહું, રિઝાઈન્ડ સુગર વગેરેના વધુ પડતા વપરાશથી મૃત્યુ તરફ ધર્સી જવાના વધુ ને વધુ જોખમો રહેલાં છે. શાકભાજનો વપરાશ જ્યાં ઓછો થાય છે ત્યાં વિટામિન 'એ' અને 'સી' ની ઊંઘાપથી લોકો પલ્બોનરી ડિઝીજ તથા બ્રોન્કાઈટીસ (ફેફસાંના રોગો)ના ભોગ બને છે. કેલ્વિયમની ઊંઘાપ યુવતીઓ અને પ્રસૂતાઓ માટે અનેક મુશ્કેલીઓ સર્જે છે.

અધ્યોગ્ય ખોરાક ગેસ્ટ્રોક અલ્સર જન્માવે છે. સંયમ વગરનું ડ્રિક્સ સિરોસિસ ઓફ લીવર, ફદયના રોગો અને મોંના કેન્સરને નિમન્ત્રે છે. તમાકુ હાઈ એટેક અને કેન્સર બંને માટે જવાબદાર છે. પ્રતિવર્ષ ૧ કરોડ ૨૦ લાખ લોકો ફદયના રોગોના કારણે મૃત્યુ પામે છે. લોકો જો તંદુરસ્ત લાઈફ-સ્ટાઇલથી જીવે તો દર વર્ષે ૬૦ લાખ લોકોને મોતથી બચાવી શકાય છે.

વિશ્વમાં પ્રતિ વર્ષ ૭૦ લાખ જેટલા કેન્સરના નવા કેસો નોંધાય છે. એ બધાંમાં ફેફસાંનું કેન્સર સહુથી વધુ છે. ઉદ્ઘોગીકરણ પામેલા દેશોમાં દર દસ મૃત્યુ પૈકી છથી સાત મૃત્યુ કેન્સરને લીધે થાય છે. પરંતુ વિકસતા દેશો કરતાં વિકસિત દેશોમાં કેન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.

વિશ્વમાં તમાકુના સેવનથી થતા રોગોને લીધે દર ત્રણ સેકડે એક મૃત્યુ થાય છે. તેમાંથી એક લાખ જેટલાં મૃત્યુ લેટિન અમેરિકામાં અને એટલાં જ મૃત્યુ એશિયામાં થાય છે. તમાકુથી થતા રોગને કારણે ચીનુમાં દર વર્ષે ત્રણ લાખ અને ભારતમાં દશ લાખ લોકો મૃત્યુ પામે છે. વિશ્વમાં ત્રીસ લાખનું મૃત્યુ થાય છે.

ધૂમ્રપાન હાનિકારક છે એ બધા જ સ્વીકારે છે - પીનાર અને ન પીનાર બને !  
પણ એનાથી કેટલું મોહું નુકસાન થાય છે એનો અંદાજ બહુ ઓછાને હોય છે !  
એટલે, છોડનાર અને છોડાવનાર બનેમાંથી કોઈ પૂરા પ્રયત્ન કરતા નથી !

પૂરા પ્રયત્નો કરનાર પણ મોટાભાગે નિષ્ફળ જાય છે, કેમ કે તે ખોટી પદ્ધતિથી પ્રયત્ન કરે છે. દા.ત. અધડો કરવો, રિસાઈ જવું, અભોલા લેવા, એક વખત કહીને બંધ થઈ જવું વગેરે.

આજે હું તમને એના નુકસાનની ગંભીરતા સમજાવવા માગું છું. સાથે એવા ઉપાયો પણ બતાવવા માગું છું કે જેથી મોટા ભાગના લોકો તમાકુ છોડી દે.

### \* તમાકુ (Tobacco)નો વિશ્વમાં પ્રસાર કેવી રીતે થયો ?

તમાકુને લાડમાં પણિમના દેશોમાં 'લેડી નિકોટીન' કહેવામાં આવે છે. આ નિકોટીન ક્યાંથી આપજા સુધી પહોંચ્યું છે તે વિશે એક રસિક દંતકથા છે. વર્લ્ડ હેલ્થ ઓરગેનાઇઝેશન તરફથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ૧૧મી મે (અથવા કેટલાક દેશોમાં પહેલી જૂને) No Tobacco Day (તમાકુવિહીન દિન) તરીકે ઉજવવામાં આવે છે. ગયા વર્ષ (૧૯૮૮૫) દુનિયામાં તમાકુના પ્રચારનાં ૫૦૦ વર્ષ પૂરાં થયાં. આ પાંચ સૈંકા દરમિયાન તમાકુનો ઉત્તરોત્તર પ્રચાર વધતો જ ચાલ્યો છે. આ વિષકન્યા જેવા ધાતક પદાર્થથી આ પાંચ સૈંકામાં પાંચ અબજથી વધુ માણસો અકાળે મૃત્યુ પામ્યા છે, છતાં આ 'Silent killer'નું આકર્ષણ જોઈએ તેટલું ઘટ્યું નથી.

વેદો, રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા, ભાગવત, કાલિદાસનાં નાટકો વગેરેમાં તમાકુનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. સવાલ એ છે કે તમાકુ આવી ક્યાંથી ? તેનો જવાબ છે દક્ષિણ અમેરિકામાંથી, કેરેબિયન સમુદ્રના ટાપુઓમાંથી દુનિયામાં ફેલાઈ છે.

ઈ.સ. ૧૮૪૨માં કોલંબસે અમેરિકાનો ખંડ શોધ્યો. તે વખતે કેરેબિયન સમુદ્રના હાઈટી, ક્યુબા વગેરે ટાપુ ઉપર ત્યાંના આદિવાસીઓને કેટલાક છોડનાં પાન ચાવતા, તેનો ભૂકો સૂંધતા કે તેની ભૂંગળી બનાવીને ધૂમાડો મોંમાંથી કાઢતા જોયા. એથી તેઓનો થાક ઉત્તરી જતો હતો. શરીરમાં ઝૂર્ણિ લાગતી હતી. મન તાજું થઈ જતું જણાતું. આથી કોલંબસને આવો સરસ છોડ યુરોપમાં લઈ આવવાનું મન થયું. બીજ્ઞવારની અમેરિકાની સફર દરમિયાન કોલંબસના સાથીદાર ફાયર રોમાનો પાનેએ છોડનાં બી સાચવીને સ્પેન લઈ આવવાની વ્યવસ્થા કરી. પછી તો સ્પેન, પોર્ટુગલના ખલાસીઓ તમાકુની સાથે કોકા (કોકેઇન) પણ યુરોપમાં લઈ આવ્યા. સોળમા સૈંકામાં તો સમગ્ર તમાકુનો નાદ લાગ્યો.

દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ તમાકુનો ઉપયોગ દવા તરીકે કરતા તથા નશો કરવાનો પોતાનો શોખ સંતોષવા માટે કરતા. એમના જીવનમાં તમાકુનું સ્થાન એક દેવી ઔષધ જેવું હતું. એટલે લગ્નપ્રસંગ કે અન્ય ધાર્મિક પ્રસંગોએ

તમાકુના મોટા પાનનો વિવિધ રીતે તેઓ ઉપયોગ કરતા. તેઓ તમાકુનો ધૂમાણો એક નળી વાટે નાક દ્વારા લેતા. એ નળીને તેઓ 'ટબાકો' કહેતા. તમાકુ માટે તેઓમાં બીજો કોઈ શબ્દ વપરાતો હતો. પણ સ્પેનિયાર્ડ લોકોને 'ટબાકો' શબ્દનાં ઉચ્ચાર ફાવી ગયો. એટલે તેઓ તમાકુને માટે 'ટોબેકો' (નળી) શબ્દ વાપરવા લાગ્યા.

સ્પેન અને પોર્ટુગલમાં તમાકુનો પ્રચાર વધતો ગયો. એટલે આવી નવી અક્સીર વસ્તુ માટેની ઉત્સુકતા યુરોપના બીજા દેશોને વધી ગઈ. સ્પેનનો ફાન્સિસ્કો તોલેજો નામનો વેપારી યુરોપના બીજા દેશોમાં તમાકુ લઈ ગયો અને ઘણું સારું ધન કમાયો. કેટલાક વખત પછી સર વોલ્ટર રેલિંગે કાગળની ભૂગળીવાળી સિગારેટની શોધ કરી.

યુરોપમાં સોળમા સૈકામાં તો તમાકુને માટે 'માય લેડી નિકોટીન' જેવું હુલામણું નામ પ્રચલિત બની ગયું. એની કથા એવી છે કે.... સોળમા સૈકામાં પોર્ટુગલનું પાટનગર દિસ્થન તમાકુના વેપારનું મોટું કેન્દ્ર બની ગયું હતું. તે વખત પોર્ટુગલમાં ફાન્સના એલચી તરીકે લોડ જિયા નિકોટની નિમણૂક થઈ.

પોર્ટુગલમાં આવ્યા પછી તમાકુની માદકતા એને એટલી આકર્ષવા લાગી કે જાણો એ એની વહાલી લેડી ન હોય. પોતાની લેડી વગર થોડા દિવસ કદાચ ચાલે, પણ તમાકુ વગર એને એક દિવસ પણ ચાલતું નહિ, એ તમાકુને My Lady Nicotin કહેતો. એટલે લોકોએ મજાકમાં તમાકુનું નામ લેડી નિકોટીન પાડી દીધું. તમાકુની બનાવેલી સિગારેટ, ચિરૂટ, સિગાર વગેરે પણ નારીવાયક શબ્દો હોવાથી અને હોઠ સાથે એનો સંબંધ હોવાથી એને માટે 'લેડી નિકોટીન' જેવો લાડકો શબ્દપ્રયોગ રૂઢ થઈ ગયો.

લોડ નિકોટ તમાકુને ફાન્સમાં લઈ આવ્યો. નિકોટ ઉપરથી હવે તમાકુ માટે નિકોટીન શબ્દ એટલો બધો પ્રચલિત થઈ ગયો કે વખત જતાં તમાકુના મુખ્ય રસાયણિક પદાર્થને વેજાનિકોએ નિકોટીન નામ આપ્યું. અને સમય જતાં તે આપણા સુધી પણ પહોંચ્યું.

### \* તમાકુનાં સ્વરૂપો :

સિગારેટ	બીજી	પાન
તમાકુ	છીકણી	ધૂક્કો
ચુંગી	મસાલા	ટૂથપેસ્ટ
યુટખા	કીમામ	ફિલ્ટરવાળી સિગારેટ
વિવિધ તૈયાર સ્વરૂપો		ઓછા ટાર અને નિકોટીનવાળી સિગારેટ

તમાકુથી ઓછું નુકસાન થાય એટલા માટે, પહેલાં ફિલ્ટરવાળી અને તાજેતરમાં ઓછા ટાર અને નિકોટીનવાળી સિગારેટ શોધાઈ. પણ સંશોધનો બતાવે છે કે એ પણ એટલું જ નુકસાન કરે છે. ખોટા ખ્યાલોના લીધે વધુ લેવામાં આવે તો નુકસાનની માત્રા વધી જાય છે ! તાજેતરમાં તમાકુ વગરની નિર્દોષ સિગારેટો પ્રચારમાં આવી છે, પણ એ નામ પ્રમાણે નિર્દોષ હોતી નથી. તે પણ નુકસાન તો કરે જ છે.

### \* નિયમિત સિગારેટ પીનારની સંખ્યા

	પુરુષ	સ્ત્રી	પ્રતિ વર્ષ સિગારેટની સંખ્યા	માહિતીથી કેરફાર
વિકસિત દેશો	૪૧ %	૨૧ %	૨૮૦૦	૪૦૦ નો ઘટાડો
વિકસતા દેશો	૫૦ %	૮ %	૧૧૫૦	૨૫૦ નો વધારો

પરદેશની અંદર સિગારેટ પીનારની સંખ્યા વધુ છે પરંતુ સાચી માહિતીને લીધે હતાં ત્યાં ધૂમપાન કરનારની સંખ્યા અને માત્રા બન્ને ઘટી રહ્યાં છે.

જ્યારે ભારતમાં ધૂમપાન (સિગારેટ) પીનારની માત્રામાં અને સંખ્યામાં બન્નેમાં વધારો થઈ રહ્યો છે. વળી બીડી, ચુંગી, હુક્કો, છીકણી, મસાલા, પાન, તમાકુ, ટૂથપેસ્ટ જર્દી વગેરે સ્વરૂપે ભારતમાં પુષ્ટ તમાકુ વપરાય છે જે પરદેશમાં લગભગ નહિવતું છે. જો ધ્યાન નહીં આપીએ તો આપણી શી દશા થશે ?

### \* કોને કોને નુકસાન કરે છે ?

1. પીનારને
2. જોડે બેસનારને
3. જોડે રહેનારને
  - બાળકોને
  - પત્નીને
  - ગર્ભમાં રહેલા શિશુને

જેમ ઉમર નાની એમ નુકસાન વધુ થાય છે. એટલે સૌથી વધુ નુકસાન ગર્ભમાં રહેલા શિશુને અને પોતાનાં જ નિર્દોષ બાળકોને અજાણતાં જ થઈ જાય છે.

### \* તમાકુમાં શું હોય છે ?

પહેલી દિનિએ સામાન્ય લાગતી તમાકુમાંથી વૈજ્ઞાનિકો આજ સુધી ૪,૦૦૦

જુદાં જુદાં નુકસાનકારક તત્વો શોધી ચૂક્યા છે, જેમાંથી નીચે મુજબ મુખ્ય હું :

૧. ટાર
૨. નિકોટીન
૩. કાર્બન મોનોક્સાઇડ
૪. સોજો પેદા કરે તેવાં તત્વો (Irritants)
૫. કોષ ઉપર આવેલા સૂક્ષ્મ તંતુઓને નુકસાન કરનાર તત્વો (Ciliotoxic Agents)

૬. અન્ય : પાયરીડીન, મીથાઈલ આલ્કોહોલ, એમોનિયા ફરફચુરલ, ફોર્માલીહાઇડ, બેન્જોકો પાયરીન, ફિનોલ્સ, એસીટોન, ફોર્મિક એસિડ, ઓકગાળિન એસિડ, સાયટ્રીક એસિડ, એસીટીક એસિડ, કોફિક, હાયડ્રો સાયેનિક તેજબો, ગ્લીસરોલ્સ, આલીહાઇડજા, કીટોન્સ, એલિફેન્ટિક હાઇડ્રોકાર્બન્સ, એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ, પોટાશ, ગંધક, આર્સનિક, સીસું, અપાયકારક વાયુઓ જેવા કે પ્રોપેન, બ્યૂટેન, મીથેન, હાઇડ્રોજન સાઈનાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વગેરે.

તમાકુના એક ઘૂંટમાં ૧૫૦ કરોડ જેટલા અણુઓ હોય છે. એમાં ઉપરોક્ત તત્વો હોય છે.

**નિકોટીન :** એની અસર ખૂબ જ જરૂરી થાય છે. સિગારેટ કે તમાકુના સેવન પછી માત્ર સાત જ સેકન્ડમાં મગજ ઉપર અસર કરે છે. બાબ્ય મગજને ઉત્તેજિત કરે છે. જ્યારે અંદરનાં અગત્યનાં કેન્દ્રોને મંદ પાડે છે. નિકોટીન જેટલું જરૂરી છે એટલું જ ભયાનક પણ છે. ૫૦૦ મિ.ગ્રા. નિકોટીનનું જો ઈન્જેક્શન નસમાં આપવામાં આવે તો માણસનું તરત જ મૃત્યુ થાય છે. એક સિગારેટમાં લગભગ ૧૦૦ મિ.ગ્રા. નિકોટીન હોય છે.

**ટાર :** નિકોટીનની જેમ ટાર પણ અત્યંત ભયાનક રસાયણ છે. જો તેને નિયમિત રૂપે ચામડી ઉપર લગાવવામાં આવે તો ચામડીનું કેન્સર થાય છે. એક સિગારેટમાં ૩૦ થી ૪૦ મિ.ગ્રા. ટાર હોય છે અને આ જ રસાયણ ફેફસામાં જાય ત્યારે ચામડી કરતાં અત્યંત નાજુક ફેફસાનું કેન્સર ન થાય તો નવાઈ જ કહેવાય.

સિગારેટના બળતા ભાગનું ઉષ્ણતામાન ૫૦૦ અંશથી ૮૦૦ અંશ સેન્ટિગ્રેડ જેટલું ઊંચું હોય છે એટલે કે ઉકળતા પાણી કરતાં પાંચગણાથી વધારે ગરમ હોય છે. મોંમાં જેંચેલા ધુમાડાનું ઉષ્ણતામાન ૩૦૦ અંશ સેન્ટિગ્રેડ જેટલું હોઈ શકે છે, પરિણામે તાળવાનું ઉષ્ણતામાન ૧૦૦ અંશ સેન્ટિગ્રેડથી ઊંચું જઈ શકે છે.

## \* કેવી રીતે નુકસાન કરે છે ?

મેઈડ ફોર ઈચ અધર,  
રાહતનો દમ,  
લિજ્જિતનો દમ....

વગેરે અનેક આકર્ષક શબ્દો અને ખૂબ જ સુંદર ચિત્રોમાં જેની જાહેરાત થાય છે એ તમાકુની ભયંકરતાની કલ્પના કરવી અશક્ય છે.

તમારો કોઈ ભયંકર દુશ્મન હોય, જે તમારાથી ખૂબ જ શક્તિશાળી, પ્રભાવશાળી અને પૈસાદાર હોય, જેને તમે કોઈ પણ રીતે પહોંચી વળો એમ ન હોય તો તમને એક અદ્ભુત રસ્તો બતાવું એની જોડે તમે મિત્રતા કરી લો. પછી જેટલી વખત એ મંજે એટલી વખત પ્રેમથી તમે એને મોંઘામાં મોંઘી સિગારેટ કે તમાકુ આપો. ફક્ત એને ટેવ પડી જાય ત્યાં સુધી. બાકીનું કામ સિગારેટ (તમાકુ) કરી લે છે.

પછી ધીરે ધીરે તમાકુ એનું કામ કરવાનું શરૂ કરી દેશે. ઉધઈની જેમ એનું શરીર ખરાબ થતું જશે. એની શક્તિ ઘટતી જશે. ખર્ચાઓ વધતા જશે. ધંઘામાં ધ્યાન ઘટતું જશે, જેથી આવક પણ ઘટતી જશે અને છેવટે સિંહમાંથી શિયાળ થઈ જશે. એનું રીબાઈ રીબાઈને મૃત્યુ થશે એટલું જ નહીં એનાં બાળકો પણ આ કુટેવ નાની ઉમરમાં શીખી જશે જેથી એના આખ્યા કુઠુંબનો વિનાશ થઈ જશે.

તમાંનું હદ્ય ધ્રૂવ ઉઠશે, તમને દયા આવશે. તમને પસ્તાવો થશે, પણ આ વિનાશને તમે થતો રોકી નહીં શકો એવી ભયાનક આ ટેવ છે. કેવી રીતે નુકસાન કરે છે ?

તમાકુ શરીરને અનેક સ્વરૂપે નુકસાન કરે છે. એમાંથી થોડાંક મહત્વનાં સ્વરૂપો નીચે મુજબ છે :

## \* હૃદયના ધનકારા વધારે છે :

એક સિગારેટથી હૃદય ઉપર અસર થતાં એ મિનિટમાં વીસ વખત વધું ધબકે છે. જે સામાન્ય રીતે મિનિટમાં એંસી વખત ધનકતું હોય એ હવે સો વખત ધબકે છે.

## \* લોહીનું દબાણ વધારે છે :

એક સિગારેટ પીવાથી લોહીનું દબાણ લગભગ ૨૦ મિ.મિ. વધી જાય છે.

## \* શરીરને મળતા પ્રાણવાયુમાં ઘટાડો થાય છે :

એક સિગારેટ પ એમ.એલ. કાર્બન મોનોકસાઈડ પેદા કરે છે, જે ૩૫૦

અમ. એલ. લોહી સાથે સંયોજાઈ જાય છે અને તે લોહીને ઓક્સિજન પૂરું પાડવાનું આમ કરવા દેતું નથી. એટલે કે ૧ સિગારેટ લેવાથી ૧ બોટલ જેટલું લોહી ઉપયોગમાં આવતું બંધ થઈ જાય છે.

### \* હૃદયરોગનો હુમલો વધારે છે !

તમાકુમાં રહેલું નિકોટીન હૃદયને લોહી પૂરું પાડતી અને કોરોનેરી ઘમનીનું સંકોચન કરે છે, જેથી હૃદયમાં જતા લોહીની માત્રા ઘટી જાય છે. સાથે સાથે ક્રેટોલાઈન નામના અંતઃઝાવની માત્રા તમાકુ વધારે છે, એટલે હૃદયની ઝડપ વધી જાય છે. હૃદયની ઝડપ વધવાથી હૃદયની લોહીની જરૂરિયાત વધી જાય છે જેથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે.

હૃદયની નિયમિતતા ખોરવી કાઢીને તમાકુ હૃદયને અનિયમિત બનાવે છે. જેથી કોઈ પણ બાબુ તકલીફ ન દેખાતી હોય એવા ધૂમ્રપાન અને તમાકુના સેવનવાળા લોકોનું ઓચિંયિતું મૃત્યુ થાય છે.

લોહીની નળીઓ જાડી થઈ જતાં લોહીનું દબાસ્ત્ર વધે છે. આ ઊચા દબાસ્ત્રને લીવે હૃદયરોગ, લક્વો, આંખમાં લોહી જામી જવું વગેરે ચોગો થઈ શકે છે. ધૂમ્રપાનમાં રહેલું કાર્બન મોનોક્સાઈડ પ્રાણવાયુ લઈ જતા ડિમોગ્લોબિનની સાથે સંયોજાઈ જાય છે એટલે હૃદય શરીરને પ્રાણવાયુ પૂરો પાડી શકતું નથી. આથી હૃદયને વધુ પડતો શ્રમ કરવો પડે છે જેથી હૃદય નબળું (CCF) પડે છે.

### \* લોહી ગંઠાઈ જવાની કિયામાં વધારો કરે છે :

(હૃદયરોગ, લક્વો, પગ દુખવા, પગ કાળો પડી જવો.)

હૃદયની અનિયમિતતામાં વધારો કરે.

(હૃદયરોગ, ઓચિંયિતું મૃત્યુ)

### \* ધૂમ્રપાન અને ટી.બી. :

ધૂમ્રપાનથી ટી.બી. થવાની શક્યતા વધી જાય છે અને જેને ટી.બી. હોય એની માત્રા વધી જાય છે. દવા પણ બરાબર અસર કરતી નથી.

### \* લ્યુકો પ્લેઝિયા :

ધૂમ્રપાનથી મોંભાં સફેદ ચાંદાં પડી જાય છે જે પાછળથી કેન્સરમાં રૂપાંતર પામે છે.

### \* લોહીની નળીઓને જડી કરે છે. (Atherosclerosis) :

તેથી ફદ્ય, મગજ, આંખ, ડિડની, હાથપગ વગેરે... શરીરના લગભગ બધા જ મહત્વના અવયવોમાં લોહી ઓછું પહોંચે છે.

### \* સોજો લાવે :

(શસનતંત્ર અને પાચનતંત્ર).

### \* કોષોની કિયા-શક્તિ ઘટાડે છે

(ખાસ કરીને શસનતંત્ર અને પાચનતંત્રની).

શરીરના અને બહારના, રોગ વધારનાર જુદા રોગોની માત્રા ખૂબ જ વધારી દે છે અને એને મટવાની તકો પણ ઓછી કરી દે છે. દા.ત. કેન્સર, ડાયાબિટીસ, ઑસિડિટી, દમ, લોહીનું દબાણ, જાંદુ શરીર, ધૂળ, ધુમાડો.

### \* ધૂમ્રપાન અને કેન્સર :

કેફસાં, હોઠ, જીબ, મોં, ગળું, સ્વરપેટી, અન્નનળી, મૂત્રાશય, ડિડની, સ્વાદુપિંડ, પ્રોસ્ટેટ આમ કેટલાંથે અંગોના કેન્સર થવા માટે તમાકુ જવાબદાર છે. આ ખલનાયક એનું કામ એટલી કુશળતાથી કરે છે કે એની લોકોને ખબર જ પડતી નથી. અને જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ જ મોંડું થઈ ગયું હોય છે. ભારતમાં થતાં કુલ કેન્સરના પચાસ ટકા જેટલો અથવા એથી વધુ ભાગ તમાકુને આધારિત છે એમ માનવાને પૂરતાં કારણો છે.

### \* ધૂમ્રપાન અને કેફસાં :

ધૂમ્રપાન કરવાથી શાસની નળીમાં રહેલી કદ ઉત્પન્ન કરતી ગ્રંથિઓનો ગ્રાવ વધી જાય છે. આથી ધૂમ્રપાન કરનારને અવારનવાર કે સતત કદ રહે છે. શાસનળીને સોજો પણ આવે છે. આથી શાસનળીઓ સાંકડી થઈ જાય છે તેથી શાસ ચડે છે. આવું લાંબો વખત થતાં ફદ્ય ઉપર એની અસર થાય છે. ફદ્ય નબળું પડતાં તેની અસર લીવર અને બરોળ પર પડે છે. આવા માણસો પછી કોઈ જ કામને લાયક નથી રહેતા અને છેવટે કુંદુંબ અને સમાજ ઉપર ભાર્યુપ બને છે.

### \* ધૂમ્રપાન / તમાકુ અને લક્વો :

લક્વો એ ખૂબ જ દુઃખદાયક બીમારી છે અને મોટા ભાગના દર્દીઓ ખૂબ જ રિબાય છે. એ થવાનું સૌથી મહત્વનું કારણ તમાકુ છે. .

### \* ધૂષપાન / લમાકુ અને લાયપગા :

તાગાડુથી લોફીની નળીઓની જીવાઈ રહ્યી હત્ય છે. એવી લોફીની ઓસ્કરિજનની માત્રા પણ જીવી હશે એટલે પણ જેવા દૂરના ભાગને પ્રાણદ્વારા માત્રા ખાલ જ હથી જીવ્ય છે. આવી માત્રાને ક્રમ કરતાં કરતાં હથી જીવ્ય પણ તરોણ ધાર્ય છે અને જીવાને લોફીની માત્રા ખાલ જ ઓફી થઈ જીવ્ય નથી પણ કાણો પણ જીવ્ય છે. (નિંબુના) લ્યારે પણ કાણો પણ છે.

### \* ધૂષપાન, લોજરી અને આંતરકાસ :

ધૂષપાન / તામાકુથી લોજરીનાં એક્સિસની ખાલા વધી જીવ્ય છે, જેણાં એસીલીટી ધાર્ય છે અને છેવટે લોજરીની અને આંતરકાસની ચાંદા પણ છે.

### \* ધૂષપાન / લમાકુ અને મુખના રોગો :

ચુંબનાલમાં ધૂષપાનથી લાગુણ્ણિયાને ઉસેજિત ધાર્ય છે, જેણી લાગ ચુંબની પણ છે. ધૂઠેધૂરે લાળાંગબિઓને ચુક્કાણન છાત્રની માત્રા પણ જીવ્ય છે, જેણાં કારણે માં ચુક્ક રહે છે. પાચ-નાચક્કિને ધર્યાને ધાર્ય છે. દાંત (પ્રદ પણ તુકાના) ધાર્ય છે. સ્વાદ અને ગંધ પારખદાની શક્કા ધાર્ય છે. જો માંના ખુલાંનું દીરેદીરે હથી જીવ્ય છે. (સિં અન્કુસ ફાલ્ફાલોલોલો) અને કાંદાંનો લિલકુલ ખુલાંનું નથી થઈ જીવ્ય છે.

### \* ધૂષપાન અને આંખાં :

ધૂષપાન નેરી રસાયનોથી આંખની જોવાની કામતા ઓફી થઈ જીવ્ય છે. આંખોના નંબર પણ વધી જીવ્ય છે. ધૂષપાનની નેત્રધારણ ધરાઈ જીવ્ય છે અને રક્તાવાદિનાંનો ઓફી ધરી જત્તાં સંપૂર્ણ અંધારો પણ આવી શકે છે.

### \* ધૂષપાન અને પ્રજનનશાસ્કિના :

ધૂષપાનથી પ્રકૃષ્ટોના ચુક્કાણની સંસ્થા ઘટે છે જેણી વંદ્યત આવી છે. ધૂષપાનથી રિશ ભરાનર ઉસેજિત થઈ નથી. જેવી સંભોગ કરવાની (બિલું) અનેક મુદ્દેલીઓ આવે છે અને પતિપનની વલ્લાના સંભંધો બાબી જીવ્ય છે.

### \* ધૂષપાન - ગાલાપિસ્થા ને જાણકો :

ધૂષપાનથી વાળની રહેદાની શક્કાતા ઓફી થાર્ય છે. વાળની જીવ્ય નથી તો કસુલવાં ધરાની શક્કાતા વધી જીવ્ય છે. જે કસુલવાં ન થાર્ય તો નથી વાળની જીવ્ય છે. અથવા જીવ્યા પણ ધોય વધતાની વાળની મુલ્લ પણ નથી.

જો કદાચ જીવે તો તે ખોડખાંપણવાનું અને ઓછા વજનનું થાય છે. તે બાળકનો વિકાસ બરાબર થતો નથી અને તેનામાં શારીરિક અને માનસિક પંચાત્પણું જોવા મળે છે જેને માટે તેઓ બાળપણથી ચોરી કરતાં શીખી જાય છે અને આમ એક કુટુંબ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાય છે.

### \* ધૂમ્રપાન / તમાકુ અને સ્ટાનપાન :

નિકોટીન માતાના દૂધમાં આવી નાના શિશુનું મૃત્યુ નિપણવી શકે છે.

### \* પરોક્ષ ધૂમ્રપાન :

અત્યાર સુધી આપણે એવું માનતા કે જો હું ધૂમ્રપાન ન કરું તો મને નુકસાન નથી અને એટલે આજુબાજુના કોઈ ધૂમ્રપાન કરે તો આપણે વિરોધ કરતા ન હતા.

પણ જો તમે થોડો અભ્યાસ કરશો તો તમને ખબર પડશો કે ધૂમ્રપાન કરનાર માણસના શરીરમાં ૨૫% ધુમાડી જાય છે. અને તે પણ જો સિગારેટ પીએ તો કીલ્ટરમાંથી પસાર થયા પછી જે ઓછી જેરી હોય છે અને એ ધુમાડી પાછી બહાર તો વાતાવરણમાં આવે•૪ છે.

હવે જો તમે જોડે બેઠા હો તો ૭૫% ધુમાડી ફિલ્ટર થયા વગર તમારી પાસે આવે છે, જેમાં ફિલ્ટર થયેલી ધુમાડી કરતાં ઘણાં વધુ જેરી ભયસ્થાનો હોય છે.

ઝેરી તત્ત્વો	ફિલ્ટર થયા વગરની તમારા ઉપર સીધી આવતી ધુમાડીમાં એની વધુ માત્રા
એમોનિયા	૪૬ ગણ્ણો
ટાર (ડામર)	૧૮ ગણ્ણો
નિકોટીન	૧૨ ગણ્ણો
કાર્બન મોનોક્સાઇડ	૫ ગણ્ણો
કેન્સરજનક રસાયણો	૫૮ ગણ્ણો

આમ, ધૂમ્રપાન કરનાર કરતાં ધૂમ્રપાન કરનારની બાજુમાં રહેનારને ધૂમ્રપાનથી રોગો થવાની શક્યતા અનેકગણી વધી જાય છે.

જો તમે ધૂમ્રપાન ન કરતા હો પણ તમારી નજીકમાં કોઈ ધૂમ્રપાન કરે હું તો પણ તમને નુકસાન થાય છે. શહેરના ગીય વિસ્તાર કરતાં જે લોકો ધરે ધૂમ્રપાન કરે, તેમના ઘરમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ ૨૦૦ % થી ૩૦૦%

વધુ હોય છે.

પરોક્ષ ધૂમ્રપાનથી અનેક રોગો થાય છે. અમેરિકામાં પરોક્ષ ધૂમ્રપાનથી દર વર્ષે પાંચ હજાર લોકો મૃત્યુ પામે છે.

તમને નથી લાગતું કે 'સિગારેટના એક છેડે અભિન હોય છે અને બીજી છેડે મૂર્ખ હોય છે.' એટલે હવે પછી તમારી નજીકમાં કોઈ ધૂમ્રપાન કરે તો તમારા પોતાના હિત માટે અને તરત જ ધૂમ્રપાન કરતાં રોકો.

પરોક્ષ ધૂમ્રપાનની સૌથી ખરાબ અસર ઘરના કુટુંબીજનો જેવાં કે માતા, બહેન, પત્ની અને બાળકોને થાય છે. ધૂમ્રપાન કરનારની પત્નીને કેન્સર થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે અને એમનું મૃત્યુ પણ વહેલું આવે છે.

સૌથી ખરાબ સ્થિતિ નાનાં બાળકો અને ગર્ભસ્થ શિશુની થાય છે. એમની દ્યાજનક સ્થિતિનું વર્ણન કરવા માટે કોઈ જ શબ્દો નથી. વળી એમને પણ ખબર નથી કે એમના પોતાના જ પિતા દ્વારા એમના ઉપર આ અમાનુષ અત્યાચાર થઈ રહ્યો છે.

બાળકો વારંવાર માંદાં પડી જાય છે. શરદી, ઉધરસ, ગળજા, ન્યુમોનિયા, બ્રોન્કાઇટીસ, દમ, કાકડાનાં સોજા, ઓછું વજન, ભૂખ ન લાગવી, થાડી જવું, અભ્યાસમાં પછાતપણું અને છેવટે જાતે પણ ધૂમ્રપાન કરતાં શીખી જાય છે. આમ ધૂમ્રપાન કરનાર પિતા પોતાના કુટુંબનો સર્વનાશ જાતે જ નોતરે છે.

એ જ રીતે તમારી ઓફિસમાં, બસમાં કે ધંધા ઉપર તમારી બાજુમાં કોઈ ધૂમ્રપાન કરે તો તમે તરત જ તેને રોકો. એમને રોકવાનો તમારો કાયદેસરનો હક્ક છે અને ન માને તો કાયદાની રૂએ તમે એના ઉપર પગલાં લઈ શકો છો. એટલું જ નહીં વળતર પણ મેળવી શકો છો.

### \* નુકસાનના આધાર :

નુકસાનના આધાર નીચેની વસ્તુઓ ઉપર છે :

૧. સિગારેટની સંખ્યા / તમાકુની માત્રા
૨. કેટલો ઊંડો કસ લે છે / કેટલો વખત મોંમાં રાખે છે ?
૩. કઈ ઉમરથી શરૂઆત કરી છે ?
૪. કેટલા સંમયથી લે છે ?
૫. શરીરની રચના અને ખોરાક.
૬. ઘર અને ધંધાનું વાતાવરણ.
૭. અન્ય રોગો.
૮. વારસાગત રોગો.

દા. ત., ૩૦ થી ૬૦ વર્ષની વર્ષેની ઉમરમાં દર હજારે હદ્યરોગનો દુમલો થવાની શક્યતા ૨૭ માણસોની હોય છે. બીડી પીનારમાં આ શક્યતા પ૫૦ની થઈ જાય છે. જોડે જોડે કોલેસ્ટરોલ વધુ હોય તો ૧૦૩ થઈ જાય છે. કોલેસ્ટરોલનું અને લોહીનું દબાવા વધુ હોય તો શક્યતા ૧૮૮ની થઈ જાય છે.

એટલે કે જેમને વારસાગત રોગ હોય, શરીરમાં બીજો કોઈ રોગ હોય અથવા ધર કે વાતાવરણ પ્રદૂષિત હોય એવા લોકો માટે તમાકુનું સેવન એ દારુ અને દેવતા બેગાં કરવા બરાબર છે.

### \* ધૂમપાન અને કાયદો :

બોમ્બે પોલીસ એક્ટ ૧૯૫૧માં કલમ નં. ૧૧૬ અને ૧૧૭ મુજબ જાહેર સ્થળે ધૂમપાન કરવું એ ગુનો છે. તમારા હિત માટે કોઈ પણ સ્થળે ધૂમપાન કરનારને તરત ૪ અટકાવવા પ્રયત્ન કરો.

### \* તમાકુ અને એનાં વિવિધ સ્વરૂપોના સેવનથી થતા રોગો :

રોગ	કટલું જોખમ વધે ?
કેન્સર :	
ફિસાં	૧૦૦૦ %
મો	૮૫૦ %
ગણું, સ્વરપેટી	૪૭૫ %
અન્નનણી, હોજરી ૬૧ %	વિશેમાં થતા કેન્સરના મૃત્યુમાંથી ૩૦ %
શાસનણી ૩૦૦ %	ફાળો તમાકુનો છે.
કિડની ૫૮ %	
મૂત્રાશાય ૧૧૭ %	
સ્વાદુપિંડ ૧૮૦ %	
પકૃત અને પિતાશાય ૧૮૦ %	
પ્રોસ્ટેટ ૭૫ %	

### હદ્ય અને લોહીની નણીઓ :

લોહીનું દબાવ	
હદ્યની અનિયમિતતા	બમણાથી ઘણું વધી જાય છે.
હદ્યરોગ	ઉમર નાની અને જોખમ વધુ
ઓચિંતું મૃત્યુ	
લક્વો (C.V. Strok)	બીજીં કારણો સાથે હોય તો જોખમમાં

નાની ઉમરે મોટી નળીઓ સંકડી થવી. અકલ્ય વધારો થાય છે.

### અન્યુરીજમ (Aortic Aneurysm) :

વિચારશક્તિમાં પટાડો

હાથપગની નળીઓ સંકડી થવી.

લગભગ બધાને આમાંથી એક અથવા

હાથપગ દુઃખવા, જલદીથી થકી જવું

એકથી વધુ તકલીફ થાય છે %.

પગ કણો પરી જવો (Gangrene)

પગ કપાવવો (Amputation)

### પાચનતંત્ર :

ઓસિટિટી, હોજરીમાં ચાંદુ 99% %

અન્નનળીમાં સોજો, ભૂખ ઓછી લાગવી

વજનમાં ઘટાડો, લાળ ઓછી પડવી

સ્વાદમાં ફેરફાર, મોંમાં દુર્ગંધ

દાંત, પેઢાં અને ગાલ ગંદા રહેવા

વારંવાર ચાંદીઓ પડવી, મોં સંકું થઈ જવું.

### કેફસાં :

કેન્સર (ઉપર મુજબ) 1000 %

સતત કફ (Chronic Bronchitis) ઉમર વધે તે સાથે વધે છે. કફ અને ખાસ

2000 % ખાસ ચડવો મોટાભાગના લોકોને થાય છે.

(Emphysema) 300 %

### ગર્ભાવસ્થા :

વંધત્વ, કસુવાવડ

બાળક : ઓછું વજન

વધુ મૃત્યુદર જન્મજાત ખોડ

શારીરિક અને માનસિક પછાતપણું

### સામાજિક :

બાળકો શીખે, અકાળે વૃદ્ધત્વ,

લગભગ બધા %.

વહેલા નિવૃત્તિ (નોકરી ધંધો

ધંધા બધાને

કે સામાજિક જવાબદારીમાંથી)

કુઝદાયક વૃદ્ધાવસ્થા,

અડધાથી વધુ

સામાજિક જવાબદારી અથા  
કર્યા પહેલાં મૃત્યુ.

મોટેભાગે  
૫ % આશરે

**આર્થિક :**

પેસાનો ખોટો બગાડ થાય છે.  
કમાવાની શક્તિ ઘટે.  
જુદા જુદા રોગોને લીધે આર્થિક બોજે વધે. રોગોનો સારવાર ઉપરના બનેના સરવાળા  
નોકરી કે ધંધામાં વારંવાર ગેરહાજરી  
તથીભી સારવારની વારંવાર જરૂર પડે.  
વધતા જોખમને કારણો અને જલદી સારું  
ન થવાથી સારવાર મૌખી થાય.  
ખરાબ ટેવના તાબામાં આવી જવાય છે.  
આકસ્મિક ભૂલો

૬ લાખ કરોડ સિંગારેટ પ્રતિવર્ષ  
ધૂમ્રપાન ૧૦૦ અબજ ડોલર  
જહેરાત ૮૦૦ કરોડ ડોલર  
જેટલા ખર્ચ (૪૨,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલર  
ખર્ચ દર વર્ષે અમેરિકામાં)  
૫૦ % થી વધુ ગેરહાજરી

ગુજરાતી કરવી ખૂબ જ અધરી છે.

**અન્ય : સાપનુસાપટીસ (શરદી)**

સણગતી સિંગારેટના ફેક્ટરી દીપેલા  
હુંઠાથી લાગતી આગ

ધર, ઓફિસ, ફેક્ટરી, કારખાનાં અને  
જંગલોમાં લાગતી આગથી થતા  
નુકસાનનો અંદાજ લગાવવો શક્ય નથી.  
દર વર્ષ ૬.૮૭ કરોડ વૃક્ષોને બાળી નાખવાં  
પડે છે.

૧૩૮ તમાકુ તૈયાર કરવા

**\* ધૂમ્રપાન અને મૃત્યુ :**

**ભારતમાં :**

૬૨ વર્ષ	૧૦,૦૦,૦૦૦
૬૨રોજ	૩,૦૦૦
૬૨ કલાકે	૧૨૫
૬૨ મિનિટે	૨ થી વધુ

**\* દુનિયામાં :**

ખૂન કરતાં	૫૪ ગણી વધુ
આપધાત કરતાં	૩૦ ગણી વધુ
ડાયાબિટીસથી મૃત્યુ કરતાં	૧૮ ગણી વધુ
મોટર અક્સમાતથી મૃત્યુ કરતાં	૧૨ ગણી વધુ

### \* ધૂમપાનથી જોખમની માત્રા :

વૈજ્ઞાનિક દાખિએ ધૂમપાનનાં જોખમો નીચે મુજબ છે :

#### ૧. નિરપેક્ષ જોખમ (Absolute Risk)

૩૦ વર્ષની ઉમરનો માણસ રોજ ૧ પોકેટ સિગારેટ પીએ તો સરેરાજું નથી ૮ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે.

#### ૨. સાપેક્ષ જોખમ (Relative Risk)

કેફસાંનું કેન્સર થવાની શક્યતા, ધૂમપાન કરતા પુરુષને ૨૨ ગણી અને સ્ત્રીને ૧૨ ગણી વધી જાય છે.

જે લોકો ધૂમપાન કરવાનું હોડી દે છે એમને આ વધારાની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

### \* ૩. ધૂમપાન અને આયુષ્ય :

ઉંમર વર્ષ	પુરુષ		સ્ત્રી	
	ધૂમપાન	ધૂમપાન વગર	ધૂમપાન	ધૂમપાન વગર
૩૫	૩૬.૫	૪૩.૫	૪૧.૮	૪૬.૯
૪૦	૩૧.૭	૩૮.૮	૩૧.૦	૪૧.૮
૪૫	૨૭.૧	૩૪.૧	૩૨.૩	૩૭.૦
૫૦	૨૨.૭	૨૮.૪	૨૭.૮	૩૨.૪
૫૫	૧૮.૭	૨૪.૦	૨૩.૪	૨૭.૮
૬૦	૧૫.૦	૨૦.૮	૧૮.૪	૨૩.૪
૬૫	૧૨.૦	૧૬.૬	૧૫.૮	૧૮.૪
૭૦	૮.૩	૧૩.૫	૧૨.૭	૧૫.૪
૭૫	૭.૨	૧૦.૭	૧૦.૧	૧૨.૧

ઉંમર અને અપેક્ષિત આયુષ્ય (વર્ષમાં)


કોઈપણ ઉંમરે ધૂમપાન કરનાર અને ન કરનાર વચ્ચેના અપેક્ષિત આયુષ્ય વચ્ચેનો તરીકું ચાર્ટમાંથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક સિગારેટ કે બોડી આશરે છ મિનિટનું આયુષ્ય ઘટાડે છે.

ધૂમપાન શરૂ કરવાની ઉંમર જેમ નાની એમ અપેક્ષિત આયુષ્ય ઘટતું જાય છે. ધૂમપાનની માત્રા વધતી જાય એમ અપેક્ષિત આયુષ્ય ઘટતું જાય છે. ધૂમપાન કરનારનું ફક્ત આયુષ્ય જ ઓછું થાય છે એવું નથી, પણ જીવનમાં હુખ્ખો અને રોગોની માત્રા પણ વધી જાય છે.

### \* ૪. ધૂમપાન અને મૃત્યુનો ચાન્સ :

આવતા પંદર વર્ષમાં મૃત્યુની શક્યતાઓ -

ધૂમ્રપાન કરનાર, છોડી દેનાર અને આજીવન ધૂમ્રપાન ન કરનાર



- ધૂમ્રપાન કરનાર : ૧ પેકેટ કે તેથી વધુ સિગારેટ દરરોજ પીનાર પણ થી પણ વર્ષની વ્યક્તિ
- ધૂમ્રપાન છોડી દેનાર : ઉપર ગ્રમાણે ભૂતકાળમાં ધૂમ્રપાન કરનાર પણથી પણ વર્ષની વ્યક્તિ જેણે હવેથી ધૂમ્રપાન છોડી દીધું છે.
- ધૂમ્રપાન ન કરનાર : જેમણે આજીવન ધૂમ્રપાન કર્યું નથી તેવી પણ થી પણ વર્ષની વ્યક્તિ.

ઉપરના ગ્રાફમાં ધૂમ્રપાન કરનાર, છોડી દેનાર અને આખી જિંદગી સુધી ધૂમ્રપાન ન કરનારની આવતા પંદર વર્ષમાં મૃત્યુ પામવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

પણ થી પણ વર્ષના ધૂમ્રપાન કરતા પુરુષોમાંથી આવતા ૧૫ વર્ષમાં લગભગ ૫૦% લોકો મૃત્યુ પામે છે, જ્યારે ધૂમ્રપાન છોડી દેનાર ૩૦ % અને આજીવન ધૂમ્રપાન ન કરનારમાંથી ફક્ત ૧૮ % લોકો મૃત્યુ પામે છે.

#### \* ૫. આરોગ્યનું જોખમ (Attributable Risk) :

રોગ	મૃત્યુના ટકા
કુન્સર	૩૦
હદ્યરોગ	૨૫
દમ, એમ્ફીસીમા અને બ્રોન્કાઈટીસ	૭૫

કુન્સરથી થતા મૃત્યુમાં ૩૦ % કાળો ધૂમ્રપાનનો છે. હદ્યરોગથી થતા મૃત્યુમાં ૨૫ % કાળો ધૂમ્રપાનનો છે, જ્યારે દમ, એમ્ફીસીમા અને બ્રોન્કાઈટીસ જેવા ફેફસાંના રોગોમાં ૭૫ % લોકોનાં મૃત્યુનું કારણ ધૂમ્રપાન છે.

### \* ૬. તુલનાત્મક જોખમ : (Comparative Risk)

જીવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓનું જોખમ કેટલું છે એ આપને નીચેના ચારું ઉપરથી સમજાશે.

પ્રવૃત્તિ	૬૨ વર્ષે દસ લાખે મૃત્યુનું પ્રમાણ
ધૂમ્રપાન	૭,૦૦૦
દાડુ	૫૪૧
અંકિસ્ટેન્ટ	૨૭૫
રોગ	૨૬૬
રોડ ઉપર ચાલતાં સાધનો	૧૮૭
દાડુ સાથે સંબંધિત	૮૫
દાડુ સાથે સંબંધ લગરના	૮૨
ઘંધો	૧૧૩
તરવું	૨૨
ધૂમ્રપાન કરનાર	૧૮
પ્રદૂષિત વાતાવરણમાં	૬
ફૂટબોલ	૬
વિદ્યુત	૨
આકાશમાંથી વીજળી ડવી	૦.૫
માખીનો ડંબ	૦.૨
બાસ્કેટ બોલ	૦.૨

જીવન સાથે સંબંધિત બધી જ પ્રવૃત્તિઓમાં ધૂમ્રપાનનું જોખમ સૌથી વધુ છે. દાડુ પણ એમાં બીજે નંબરે આવે છે. બંને જોખમો વચ્ચેનો તફાવત પણ ખૂબ જ વધુ છે. આ ચારું જોઈને તમને એવું નથી લાગતું કે ધૂમ્રપાન ન કરવાની બાબત ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ?.

અમેરિકન કેન્સર સોસાયટીએ ૧,૮૮,૦૦૦ માણસોનું સર્વેક્ષણ કરેલું જેના માટે ૨૨,૦૦૦ સંશોધકોએ ભાગ લીધેલો. જેનાં મહત્વનાં તારણો નીચે મુજબ છે :

૧. કોઈ પણ પ્રકારે તમાકુ આયુધ ઘટાડે છે.
૨. જેમ તમાકુની માત્રા વધતી જાય એમ જોખમ ખૂબ જ અડપથી વધે છે.
૩. સિગારેટની માત્રા અને મૃત્યુનું પ્રમાણ

સિગારેટની માત્રા	મૃત્યુનું પ્રમાણ
અધું પાકીટ	૩૪ % વધુ
૧ પાકીટ	૭૦ % વધુ
૨ પાકીટ	૬૬ % વધુ
૨ થી વધુ	૧૨૩ % વધુ

૪. ધૂમ્રપાન બંધ કરવાથી મૃત્યુનું પ્રમાણ ઘટે છે.

૫. સ્ત્રીઓમાં ધૂમ્રપાન અને ગર્ભનિરોધક ગોળીઓ અનેક પ્રકારનું નુકસાન કરે છે.

### \* વાસ્તવિક જોખમો :

અત્યાર સુધી વैજ્ઞાનિક ભાષામાં જોખમોની ચર્ચા કરી. હવે આ જ વસ્તુઓને સાદી અને સરળ ભાષામાં મૂકીને સમજીએ.

- (૧) દર એક ટન તમાકુના ઉત્પાદને ૧ માણસને કેન્સર થાય છે.
- (૨) પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે એટલે કે કુલ મૃત્યુ ૨૧ % મૃત્યુ માટે તમાકુ કારણભૂત છે.
- (૩) એક્સિડન્ટ્યુની દર વર્ષે ૫૮,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. જ્યારે તમાકુથી દર વર્ષે દસ લાખ લોકો મૃત્યુ પામે છે.
- (૪) ૫૦ % કેન્સર નિદાન થાય ત્યારે આગળ વધેલું હોય છે.
- (૫) દર વર્ષે ૨૦,૦૦૦ પગ તમાકુથી કપાવવા પડે છે.
- (૬) દરરોજ ગુજરાતમાં ૨૪૪ નવાં બાળકો અને ભારતમાં ૫,૪૩૫ નવાં બાળકો ધૂમ્રપાન કરતાં શીખે છે.
- (૭) ભારતમાં અત્યારે બે કરોડ તમાકુના બંધાણી છે અને દર વર્ષ ૧૦ લાખ નવાં બાળકો ધૂમ્રપાન કરતાં શીખે છે.
- (૮) તમાકુ દર વર્ષ ગરીબોના બિસ્સામાંથી રૂ. ૬,૦૦૦ કરોડ લઈ લે છે.
- (૯) ભારતમાં દર વર્ષ ૫૨૦ મિલિયન ડિ.આ. તમાકુ પેદા થાય છે, એમાંથી.....
- (૧૦) ૮૫ મિલિયન ડિ.આ.ની પરદેશમાં નિકાસ થાય છે.

- ખ. ૮૫ મિલિયન ક્રિ.ગ્રા. પૈસાદાર અને મધ્યમ વર્ગ વાપરે છે.
- ગ. ૩૫૦ મિલિયન ક્રિ.ગ્રા. ગરીબ માણસો વાપરે છે.
- ઘ. ૧૦ % નકામી તમાકુ જંતુનાશક દવાઓ બનાવવામાં વપરાય છે.
- (૧૦) આંધ્ર પ્રદેશ અને કણ્ણાટકમાં સિગારેટ માટેની તમાકુ પેદા થાય છે.
- (૧૧) ગુજરાતમાં બીડી અને મસાલા માટેની તમાકુ પેદા થાય છે.
- (૧૨) કેન્સરના દર્દીઓને શેક આપવા માટે આપણાને ૬૦૦ કોબાલ્ટ મશીનોની જરૂર છે, જ્યારે આપણી પાસે ૧૭૦ મશીનો છે, જેમાંથી ૨૫ % મશીનો કામ કરતાં નથી.
- (૧૩) હૃદયરોગમાં બાયપાસ સર્જરી કરાવવા માટે બે લાખ રૂપિયાની જરૂર પડે છે. આ ઓપરેશન કરાવવાની સગવડ બહુ જ થોડી છોસ્પિટલોમાં છે. આ ઓપરેશનનું ખર્ચ કરવાની ક્ષમતા બહુ થોડા લોકોમાં હોય છે.
- (૧૪) તમાકુને તૈયાર કરવામાં દર વર્ષે ૬.૮૭ કરોડ વૃક્ષો બાળી નાખવાં પડે છે.



## ૨. તમાકુની ભેટ : ભલભલાનાં મોં બંધ કરી દેતો રોગ - ઓરલ સબમ્યુક્સ ફાઇબોસીસ

ભારતનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. દેશ ખૂબ જ વિશાળ છે. અનેક પરદેશીઓ આ દેશમાં આવીને વસ્યા છે એટલે અપાર સાંસ્કૃતિક વિવિધતાઓ પણ જોવા મળે છે.

આ દેશના વાતાવરણમાં ઉત્તરમાં બારેમાસ પુષ્ટણ ઠડી રહે છે અને દક્ષિણમાં પુષ્ટણ ગરમી. વિશ્વમાં સૌથી બધું વરસાદ ભારતની પૂર્વમાં વરસે છે તો પશ્ચિમમાં વરસાદની હંમેશાં ખેંચ રહે છે.

આ દેશમાં અનેક ધર્મો છે. દરેક ધર્મના અનેક પેટા ધર્મ છે. દરેક પેટા ધર્મના અનેક જાતિઓ છે અને દરેકે જાતિઓમાં નાનાં નાનાં જૂથ છે. દરેકનો દેખાવ, પહેરવેશ, ભાષા અને રીતભાત જુદાં જુદાં છે. એક બાજુ ખૂબ જ સુખી માણસો પણ છે અને બીજું બાજુ બિલકુલ નિર્ધન માણસો પણ છે.

આટલી બધી વિવિધતા છતાં ભારતમાં એક વિશેપતા એવી છે જે સાર્વાનુક્રમિક છે અને એ છે પાન-મસાલાના ગલ્લા. દરેક ગામમાં, દરેક બસસ્ટેન્ડ, ચાલીઓ અને સોસાયટીના નાકે, રસ્તાઓ ઉપર, હોટલો અને રેસ્ટોરન્ટમાં, પેટ્રોલ પંપ ઉપર તમે ગમે ત્યાં જાઓ તમને એકાદો ગલ્લો ચોક્કસ જોવા મળશે અને દરેક ગલ્લા ઉપર બીજું કંઈ મળે કે ના મળે, પરંતુ તમાકુ અને પાંન ચોક્કસ મળશે. દેશના ગમે તે સ્થળે જાઓ, ગમે તે સમયે જાઓ વહેલી સવારથી મોડી રાત સુધી એ ખુલ્લા જ હોય છે.

ઘરે હોય કે બહાર, જાણીતા સાથે કે અજાણ્યા સાથે તમાકુ ખાવા-ખવરાવવાનો બ્યવહાર સમાજમાં ખૂબ જ સાહજિક અને સામાન્ય છે. ધંધો કરતા વેપારીઓ, ગર્યાં મારતા મિત્રો, સગા- સંબંધીઓના સ્વાગતમાં કે પ્રવાસ-પિકનિકમાં બર્થ-ડે કે રિસેપ્શન જોવા સારા પ્રસંગે કે મૃત્યુ જોવા ખરાબ પ્રસંગે પણ તમાકુ પાન-તમાકુ એકદમ સ્વાભાવિક રીતે ખાવા-ખવરાવવામાં આવે છે.

તમાકુને લીધે હાથમાં પડેલો ડાઘ, ખરાબ દાંત, લાલ હોઠ અને ગાલ એ ભારતીય હવાનાં આધુનિક ચિહ્નો છે. વાત કરતાં કરતાં હાથમાં તમાકુ મસળવી, હાથથી ટાપલી મારી બીજાને આપવી, ગાલ કે હોઠના નીચે મૂડી અને તમાકુ મોંમાં રાખીને વાતચીત કરવી, વચ્ચે વચ્ચે ઊભા થઈને તમાકુની પિચ્કારી મારવી, રસ્તામાં ગમે ત્યાં ધૂકવું એ જાણે આધુનિક યુવાનો અને સામાન્ય ભારતીયોનાં ઓળખચિહ્નો થઈ ગયાં છે. એ એટલું બધું સ્વાભાવિક

છ કે એ ન થાય તો આપણને અડવું અડવું લાગી શકે છે.

સીડીઓ, ગેલેરીઓ, લિફ્ટો, દીવાલો, સંડાસ અને મુતરાઈમાં પડેલા હથી  
આપણે ભારતમાં જ છીએ એની ખાતરી આપે છે.

આપણી આ વિશેષતા દુનિયામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાય અન્ય  
કોઈ દેશોમાં જોવામાં આવતી નથી અને એટલે જ પરદેશ જઈએ ત્યારે અડવું  
અડવું લાગે છે. ત્યાંની ચોખાઈથી અંજાઈ જઈએ છીએ અને અહીં આવી એના  
વખાળ કરતાં થાકતા નથી. સાથે સાથે વાતો કરતાં કરતાં થૂંકવાનું પણ ભૂલતા  
નથી.

આપણી આ રાષ્ટ્રીય વિશેષતાને કારણે આપણા દેશમાં એક નવા રાષ્ટ્રીય  
રોગનું નિર્માણ થઈ રહું છે, જે વિશ્વમાં ક્યાંય નથી. જેનું નામ છે ઓરલ  
સબમ્યુક્સ ફાઇબ્રોસીસ. આ રોગની અંદર મોં પૂરેપૂરું ખુલ્લી શકૃતું નથી. ક્યારેક  
તો એવી ખરાબ સ્થિતિ આવે છે કે, બે દાંત વચ્ચેથી પાપડ પણ જઈ શકતો  
નથી.

આ અત્યંત દુઃખદાયક રોગ ખૂબ જ નાની ઉમરે થાય છે, વળી એની  
કોઈ સારવાર એવી નથી કે જે એને પૂરેપૂરો મટાડી શકે. આ રોગની સાથે  
થતા અન્ય રોગો જેવા કે ઓછી લાગતી ખૂબ, વારંવાર મોંમાં પડતાં ચાંદા,  
તીખો ખોરાક ન ખાઈ શકવો અને છેવટે કેન્સર થવું અને એવું થાય ત્યારે દરી  
રિબાઈ રિબાઈને નાની ઉમરે મૃત્યુ પામે છે.

### \* ફાયલોસીસ થવાનાં કારણો :

(૧) આ રોગ થવાનું સૌથી મહાત્વનું કારણ પાન, સોપારી, તમાકુ અને  
ચૂનો છે. (જેને આપણે મોંમાં ચાવવા માટે ચાખીએ છીએ. એવા અનેક લોકો  
છે કે, જે સવારે જાગીને સૌથી પહેલું કામ તમાકુ ખાવાનું કરે છે અને રાતે  
સૂતી વખતે સૌથી છેલ્લું કામ પણ તમાકુ ખાવાનું કરે છે. કેટલાક લોકો તો  
રાતે સૂતાં પણ તમાકુ મોંમાં રાખી અને સૂઈ જાય છે.)

(૨) લોહ તત્ત્વની ખામી

(૩) મોંમાં વારંવાર થતો ચેપ

(૪) વિટામિન 'સી'ની ખામી

(૫) ઓટોઇમ્યુન રોગ (Autoimmunity)

(૬) વારસાગત

ઓટોઇમ્યુન અને વારસાગત કારણોસર આ રોગ થતો ભાવ્યે જ જોવા  
મળે છે.

તમાકુ, પાન, સોપારી, ચૂનો વગેરે તત્ત્વો મોંમાં ચાખવાથી જે જગ્યાએ

રાખવામાં આવે ત્યાં નુકસાન કરે છે. એની સાથે સાથે લાગમાં જે રસ જાપ છે એ મોં, ગળું, સ્વરપેટી, અન્નનળી, હોજરી, મગંજ, ફદ્ય, લોહીની નળીઓ, પગ વગેરે જગ્યાઓએ પણ નુકસાન કરે છે.

બાકીના નુકસાનને ભૂલીને અત્યારે કેવળ મોંમાં થતા નુકસાનની જ વાત કરીએ :

તમાકુ, પાન, સોપારી અને ચૂનાના લીધે વારંવાર મોંમાં ચાંદાં પડી જાય છે. વળી, તીખા ખોરાક ખાવામાં તકલીફ પડે છે. ઘણી વખત તો ચાંદાં એટલાં બધાં દુઃખતાં હોય છે કે, પ્રવાહી ખોરાક પણ લઈ શકતો નથી.

ખોરાક યોગ્ય માત્રામાં ન લેવાય તે કારણે જ લોહિતસ્વ, વિટામિન અને અન્ય ખોરાકનાં તત્ત્વોની ખામીઓ આવે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી મોંમાં વારંવાર ચેપ ફેલાય છે. આમ ખરેખર તો આ રોગ થવાનું મુખ્ય કારણ ફક્ત એક જ રહે છે અને એ છે પાન, સોપારી, તમાકુ અને ચૂનો.

આજના ફેશનના યુગમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી થવાનો પ્રયત્ન કરતી થઈ છે અને એટલે એ પણ તમાકુ લેતી થઈ છે, એથી હવે આ રોગ સ્ત્રીઓમાં પણ જોવા મળે છે.

તમાકુ, પાન, મસાલો, સોપારી અને ચૂનો લેનાર બધાને આ રોગ થાય જ છે. પણ મોટાભાગનાને ઓછી માત્રામાં થાય છે એટલે ખાસ ઘ્યાલ આવતો નથી.

### \* રોગનો વધુ શિકાર કોણ બને છે ? :

જેમ નાની ઉંમરે તમાકુ લેવામાં આવે એમને આ રોગ થવાની માત્રા વધુ રહે છે. વળી, જે લોકો વારંવાર લે છે એમને પણ આ રોગ વધુ થવાની શક્યતા રહે છે. મસાલા ખાધા પછી જે મોં સાફ કરતા નથી તેમને પણ વધુ થાય છે.

કોને આ તકલીફ વધુ થશે અને કોને વધુ નહીં થાય એ કહેવું અશક્ય છે અને એટલે જ સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે એને થતું અટકાવવું.

### \* ખબર કેવી રીતે પડે ? :

માનો કે તમને વ્યસન છે અને તમારે જાણવું છે કે, તમને આ રોગની શરૂઆત થઈ છે કે નહીં તો કેવી રીતે જાણવું એ તમારો સૌથી પહેલો પ્રશ્ન હશે.

એ જાણવાના બહુ સાંદ્રા અને સરળ રસ્તા છે, જે તમે જાતે અપનાવી શકો છો.

સૌથી પહેલાં મોં પહોળું કરી તમારા મોંની અંદર તમારા હાથની જારી આંગળીઓ ઊભી રાખી મોંમાં નાખવા પ્રયત્ન કરો. જો આ ચાર આંગળીઓ થોડી તકલીફ સાથે પણ મોંમાં જાય તો તમને આ રોગ નથી. પણ જો નાખ આંગળી જ જાય તો તમને આ રોગ થવાની શરૂઆત થઈ ગઈ છે એમ સમજું. જો બે આંગળી જાય તો રોગ આગળ વધેલ છે અને એક જ આંગળી જાય તો રોગ ખૂબ જ આગળ વધેલ છે એમ માનવું અને એક પણ આંગળી જાય તો તમારી ભાવિ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે.

હવે તમારા ઘરમાં કોઈ બાળકના ગાલના અંદરના ભાગે આંગળી ફેરફારો. એના ગાલમાં રહેલ લીસાપણું, પોચાપણું અને કોમળતા જુઓ. વળી, એ ગાલને ખેંચવાથી કેટલો ખેંચી શકાય છે એ જુઓ એનો રંગ પણ જુઓ.

હવે જો તમારા ગાલના અંદરના ભાગનું લીસાપણું, પોચાપણું કે કોમળતા ઓછી થાય તો તમને રોગની શરૂઆત થઈ છે એમ માની લો. જો આ ગુણધર્મો જેમ ઘટે એમ રોગની માત્રા વધે છે.

તમારા ગાલને અંદર આંગળી મૂકીને ખેંચી જુઓ. જો ગાલ સહેલાઈથી ખેંચાય તો તમને કોઈ જ તકલીફ નથી. પણ ગાલ જેટલો ઓછો ખેંચાય એટલી વધુ તકલીફ એમ માનો અને જો ગાલ સહેલાઈથી ન ખેંચી શકાય તો વધુ તકલીફ છે એમ માનો.

તમને બરાબર ખબર ન પડે તો બાર-તેર વર્ષના બાળક ઉપર પ્રયોગ કરો. એને જેવું છે, એવું તમારે હોવું જોઈએ.

હવે હાથમાં નાનો અરીસો લઈ ઘરની બહાર જાઓ અને સારો પ્રકાશ આવતો હોય ત્યાં મોં ખોલી અરીસાની અંદર જુઓ. તમારા ગાલની અંદરની બાજુનો રંગ જુઓ. જો એ લાલ હોય તો એ બરાબર છે. પણ જો એ રંગ આછો હોય તો એ ખરાબ છે. એ જો સફેદ થઈ ગયો હોય તો ખૂબ જ ખરાબ કહેવાય.

### \* રોગ થયા પહેલાં કેવી રીતે ખબર પડે ? :

જો તમારું વજન ઘટતું જતું હોય, ખૂબ ઓછી લાગતી હોય, કામ કરવામાં અશક્તિ લાગતી હોય, લોહીમાં હિમોગલોબિન ઓછું હોય તો તમને આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

વળી જો સામાન્ય તીખું વધુ પડતું તીખું લાગતું હોય અને મોંમાં વારંવાર ચાંદાં પડી જતાં હોય તો તમને રોગ શરૂ થવાનાં પહેલાંનાં ચિકા છે એવું માનીને

ચાલો.

દાંતનો, પેઢાનો અને ગાલનો રંગ જે જગ્યાએ તમાકુ મૂકો છો ત્યાં બદલાયેલો હોય તો પણ ચેતવું વધારે સારું, ચેતતા નર સદા સુખી.

### ✽ ઓરલ સબમુક્યસ ફાઇબોસીસ :

(અ) થવાની શક્યતાઓ વધે છે -

- નાની ઉમરે તમાકુ, પાન, બીડી, સોપારી, ચૂનાનું વસન હોય તો
- લાંબો વખત મોંમાં રાજવાની આદત હોય તો
- મોં સાફ ન કરતા હો તો
- અપૂરતું પોપણ મળતું હોય તો
- લોહતત્ત્વની ખામી હોય તો
- ઓછું વજન ધરાવતા હોય તો
- મોંમાં વારંવાર ચેપ લાગતો હોય તો
- ભૂખ ઓછી લાગતી હોય તો
- મોંમાં વારંવાર ચાંદાં પડતાં હોય તો
- સામાન્ય તીખું વધુ તીખું લાગતું હોય તો
- દાંત, પેઢાં, હોઠ કે ગાલમાં તમાકુની જગ્યાએ ડાઘા જણાય તો

(બ) ચિલ્લો :

- મોં ખોલવાની માત્રા - સીધી ચાર આંગળીથી ઓછી.
- ગાલના અંદરના ભાગમાં ચળકાટ, પોચાપણું, લીસાપણું, નાજુકતામાં ઘટાડો.
- ગાલના લાલ રંગમાં ફેરફાર
- ગાલ ઝેંચી શકવાની માત્રામાં ઘટાડો.
- ગાલના અંદરના ભાગમાં સંકેદ રંગ.

\* તમે શું કરશો ? :

તમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, આમાનું કોઈપણ ચિલ્લો હોય તો મારે શું કરવું ?

જો આપને જેનાથી થવાની શક્યતા વધુ છે એમાંનાં કોઈપણ ચિલ્લો હોય તો

- તાત્કાલિક વસન બંધ કરો.
- લીલાં શાકભાજી, ફળ-કઢોળ વધુ માત્રામાં લો.
- નિયમિત દરેક ખોરાક પછી બ્રશ કરો.

● જમવાના વચ્ચે કંઈપણ ના લેશો.

● ઓરાકમાં કડક, તીણું, તળેલું, બહુ જ ગરમ અને બહુ જ  
વસ્તુઓનો ત્યાગ કરો.

. આટલું કરવાથી મોટાભાગે તમને બધું જ મટી જરો પણ જો ન મટે  
તમારા ડોક્ટરને બતાવો.

જેમને સેબમ્યુક્સ ફાઈબ્રોસીસનાં ચિન્હ છે એમને ઉપર બતાવેલી તમાં  
વસ્તુઓ તો કરવી જ જોઈએ. વધારામાં તાત્કાલિક તમારા ડોક્ટરને બતાવો.  
બને ત્યાં સુધી કેન્સરના નિષ્ણાત ડોક્ટરને બતાવો.

શરૂઆતના સ્ટેજમાં આ રોગ સારવારથી મટી શકે એવો છે અને પાછળન  
સ્ટેજમાં પણ સારવારથી ઘણી રાહત થાય છે. માટે નિરાશાથ્યા વગર તાત્કાલિક  
તમારા ડોક્ટરને બતાવો.

ખૂબ જ આગળ વધેલા રોગમાં સારવાર ખૂબ જ અધરી છે અને એને  
માટે નિષ્ણાત ડોક્ટરની જરૂર પડે છે. વળી, વારંવાર બતાવવા જરું પડે છે.

પણ રોગની સારવાર કરવી, પૈસા ખરચવા અને હેરાન થવું એના કરતાં  
વસન બંધ કરવું શું ખોટું ?

તમે વસન કરો છો ?

તો રાહ શું જોઈ રહ્યા છો.

અત્યારે જ બંધ કરી દો.

થતું અટકાવવા શું કરવું ?

આજના ડોક્ટરો માટે આ પ્રશ્ન માથાના દુઃખાવારૂપ થઈ પડ્યો છે. ડોક્ટરને  
ત્યાં દર્દીઓ રોગની અજ્ઞાનતાના લીધે મોડા આવે છે. જેમને રોગનો ખ્યાલ  
આવે છે એવા લોકોને એની ગંભીરતા હોતી નથી એટલે મોડા આવે છે અને  
પછી શરૂ થાય છે દુઃખ, મુશ્કેલીઓ અને પ્રશ્નો.

આ પ્રશ્નની શરૂઆત હાઈસ્કૂલોમાં અને કોલેજોમાં થાય છે. શિક્ષકો,  
પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ અત્યારે સાથે બેસીને તમાકુ ખાય છે, અરે શિક્ષકો  
વિદ્યાર્થીઓને જ તમાકુ લેવા મોકલે છે. આવા સમયમાં શું કરવું એ ખરેખર  
એક મોટો કોયડો છે.

ધોળ્ય સાહિત્ય, ફોટોગ્રાફ, ઓડિયો વિજ્યુલ લેક્ચરથી આ વાતને વિદ્યાર્થી  
જગતમાં મૂકવામાં આવે તો પ્રશ્ન ઘણો જ સરળ થઈ જાય.

જો પાઠ્યપુસ્તકોમાં અભ્યાસક્રમ રૂપે આવા મહત્વના રોગોને આવરી  
લેવામાં આવે તો ભાવિ પેઢીની મોટી સેવા કરી ગણાશે. નકામી અને બિનજરૂરી  
ચીજો વિદ્યાર્થીઓને ગોખાવવી એના કરતાં ઉપયોગી વસ્તુઓ એમના જીવનમાં

વહી લેવી ખૂબ જ મહત્વની વસ્તુ છે.

બાળકોના નાજુક મનની અંદર આ જીવલેણ કુટેવ ઘર કરી જાય, ધીરે ધીરે એમને ઉંદરની જેમ કોરી જાય અને છેવટે એક ઘરને ઊંડા અંધારામાં ફેંકી દે એ પહેલાં એને અટકાવવું જ જોઈએ.

આ કામ શાળાના શિક્ષકોનું છે, આચાર્યનું છે, પ્રોફેસરનું છે, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું છે. સમાજ સેવકોનું છે, પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ નક્કી કરનારનું છે, શિક્ષણમંત્રીનું છે, સરકારનું છે, તમારું છે, મારું છે, આપણા બધાનું છે.

પણ એવું તો નહીં થાય કે, “સૌનું કામ એ કોઈનું નહીં.”

### \* કોણ આગળ આવશે ? :

ભલે બીજા કોઈ આગળ ન આવે તમે જરૂરથી આગળ આવો. તમારા માટે, તમારા આત્મસંતોષ માટે, તમારા જીવનની સફળતા માટે આ સર્વોત્તમ તક છે અને જરૂરી લો.

### \* કચારથી કામ શરૂ કરશો ? :

આજના જેવી શુભ ઘડી કોઈ નથી, આજથી જ શરૂ કરો, અત્યારથી જ શરૂ કરો. “શુભસ્ય શીଘ્રમ्.” સારા કામમાં ઢીલ કેવી ?

તમારે માહિતી, માર્ગદર્શન કે મદદની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.



### 3. તમાકુની ભેટ : કેન્સરનો સગોભાઇ - લ્યુકોપ્લેકીયા ॥

સામાન્ય રીતે હોઠ, ગાલ, તાળવું, જીબ વગેરે મોંના અંદરના ભાગની દત્તવ્યા (મ્યુકોજિયા) એકદમ લીસી, સુંવાળી અને મુલાયમ હોય છે. સિગારેટ, ચુંગી, બીડી, સોપારી, પાન, મસાલા, છીકણી, દારૂ, તીખા તમતમતા ખોરાક અને એકદમ ઠંડા પદાર્થો આ નાજુક અને મુલાયમ અંતઃત્વચાને નુકસાન પહોંચાયે છે. આપણા સફુનસીબે આવાં નુકસાન કુદરત પોતાની મેળે રિપેર કરી લે છે. પણ જો આ પ્રક્રિયા સતત ચાલુ રહે, ખોરાકમાં યોગ્ય પોષક તત્ત્વ ન હોય કે કુદરતી રીતે શરીર યોગ્ય માત્રામાં રિપેર કરવા શક્તિમાન ન હોય ત્યાં મોંની અંદરની ત્વચા ધીરે ધીરે એનો રંગ બદલે છે અને છેવટે સફેદ અને બરછટ થઈ જાય છે. અને લ્યુકોપ્લેકીયા કહે છે. જો આ રંગ લાલ અને બરછટ હોય તો અને એરીથ્રોપ્લેકીયા કહે છે.

#### \* લ્યુકોપ્લેકીયાનાં કારણો :

1. બીડી, સિગારેટ, ચુંગી.
2. પાન, તમાકુ, મસાલા, સોપારી.
3. છીકણી ઘસવી.
4. દારૂ.
5. તીખા તમતમતા ખોરાકો.
6. ખૂબ જ ઠંડા અથવા ગરમ ખોરાક. દા. ત., (ખૂબ જ ઠંડી આઈસકીમ, ગરમાગરમ ચા)
7. ખોરાકમાં લીલાં શાકભાજી, ફળ અને કઠોળની ઊણપ.
8. કુદરતી રીતે.

#### \* લ્યુકોપ્લેકીયા થાય ત્યારે શું કરવું ? :

લ્યુકોપ્લેકીયા અથવા મોંમાં સફેદ ડાઘ એ ગંભીર બીમારી છે. પદેલી દિન્દિએ નિર્દોષ લાગે, પણ આ સફેદ ડાઘમાંથી લાંબા ગાળે કેન્સર થઈ શકે છે. એટલે જ્યારે પણ સફેદ ડાઘ મોંમાં દેખાય એટલે તરત જ ડોક્ટરને બતાવો.

1. તરત જ ડોક્ટરને બતાવો.
2. જરૂર લાગે તો બાયોપ્સી કરો.

૩. નિયમિત લાંબા વખત સુધી ડોક્ટરને બતાવો.
૪. ડાઘ મોટો થાય, ઉંડો થાય કે ચાંદી પડે તો ફરીથી બાયોપ્સી કરાવો.
૫. જરૂર પડે સર્કેદ ડાઘ આખેઆખો કાઢીને લેબોરેટરીમાં મોકલાવો.
૬. સિગારેટ, બીડી, ચુંગી, પાનમસાલા, તમાકુ, સોપારી, છીકળી કે દારુ બિલકુલ બંધ કરી દો.
૭. તીખા તમતમતા, કડક, ખૂબ જ ઠંડા અથવા એકદમ ગરમ પદાર્થોને ન ખાશો, ઠંડા ખોરાક ગરમ થવા દઈને અને ગરમ ખોરાક ઠંડા થયા પછી જ લો.
૮. ડોક્ટરની સલાહ મુજબ દવાઓ નિયમિત રીતે લો.
૯. ક્યારેક લ્યુકોપ્લેક્ટીયા જેવો દેખાતો સર્કેદ ડાઘ લ્યુકોપ્લેક્ટીયાની જગ્યાએ બીજો જ કોઈ રોગ હોઈ શકે છે, જે બાયોપ્સી કરવાથી ખબર પડે છે.
૧૦. યોગ્ય કાળજી રાખવામાં આવે તો મોટાભાગના લ્યુકોપ્લેક્ટીયામાંથી કુન્સર થતું અટકી શકે છે.



૪.

## મધ્યપાન (૬૧૩). કેંસરનું પણ કારણ બની શકે છે !

સમાજ હિતચિતકોની ઈચ્છા વિરુદ્ધ કહેવાતા આધુનિક સમાજમાં અને ફાત્તી રહેલા કલબ-કલ્યારમાં મધ્યપાન પ્રતિષ્ઠાનું પ્રતીક બની રહેલું છે.

વસન અંગેના લેખની શ્રેષ્ઠીમાં આ વખતે દારુ દ્વારા ઊભી થતી કેંસરની અને બીજા શારીરિક નુકસાનની વૈજ્ઞાનિક વાતો વાંચીને યાદ રાખવા જેવી છે. દારુ નામના દેત્ય વિષે આ લેખમાં આરંભે જ ટાંકેલા વિશ્વવિષ્યાત ઈતિહાસકાર ટોયમ્બીના કથનમાં તો કહ્યું છે કે, “વિશ્વા વિનાશ માટે એકલો શરાબ જ પૂરતો છે !”

આટલી અસરકારક રીતે દારુની વિનાશક તાકાતની વાત સાંભળ્યા પછી તો સંવેદનશીલ અને સમજું માણસે કદાચ આવા લેખ વાંચવાની જરૂર ન રહે પરંતુ ભલભલા સંવેદનશીલ માણસને પણ વિચારશુન્ય બનાવી દેવાની ‘શક્તિ’ પણ દારુમાં ક્યાં નથી ?

-ને છતાં, જેમને ચેતાવું જ હોય કે પોતાના કોઈ વસની સ્વજનને ઊડા અંધારેથી પરમ તેજને માર્ગ લઈ આવવા હોય તો આ અને ઉપચાર-લેખ બંને અવશ્ય વાંચવા-વંચાવવા જોઈએ.

જીણામાં જીણી વિગતોનો અભ્યાસ કરીને આ બધાં વૈજ્ઞાનિક તથો આપણી સમક્ષ મૂકું છું.

“વિશ્વની અતિ પ્રાચીન એકવીસ સંસ્કૃતિઓમાંથી ઓગણીસ સંસ્કૃતિઓના વિનાશનું કારણ છે - મધ્યપાન. વિશ્વા વિનાશ માટે એકલો શરાબ જ પૂરતો છે.”

- પ્રો. આનોદ ટોયમ્બી (વિશ્વવિષ્યાત ઈતિહાસકાર) દારુનો ઈતિહાસ માનવજીતના ઈતિહાસ જેટલો જ જૂનો છે. ડોક્ટરો, સમાજસેવકો અને ધર્મ વર્ષાથી દારુના સેવનનો વિરોધ કરે છે. પણ દિનપ્રતિદિન દારુની પ્રતિફા વધતી જાય છે. પહેલાં લોકો ખાનગીમાં, ચોરીધૂપીથી પીતા. હવે એ હોટલો, કલબો અને ઘરમાં પીવાય છે. પહેલાં દારુ પીવો એ શરમજનક કહેવાતું, હવે દારુ આધુનિકતાની નિશાની ગણ્યાય છે. લોકો પ્રેસ્ટિજ માટે પણ દારુ પીએ છે.

જે લોકો જુગાર, શરાબ, ધૂમપાન અને સુંદરીના શોખીન ન હોય એમને પછીત ગણવાની કેશન થઈ ગઈ છે. આં ચારે રાખસો એક એકથી ચાર્ચિયાતા

છ. તેની અસરો એઈડ્સ, કેન્સર, હદ્યરોગ, અક્સમાત વગેરે સ્વરૂપે અત્યારે જાઈ રહી છે. જાણે કે માનવજીતના ઈતિહાસની આ સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિના નાશ માટે આ રાખસો મેનકાનું મોહક સ્વરૂપ લઈને આવ્યા છે. જ્યારે આ રાખસો સંયુક્ત રીતે આવે છે ત્યારે એની અસર ખૂબ જ પ્રચંડ હોય છે.

### \* દારુનાં સ્વરૂપો :

- \* ઈથાઈલ આલ્કોહોલ
- \* મિથાઈલ આલ્કોહોલ (લકો).

### \* લોકો શા માટે દારુ પીએ છે ?

- \* ટેસ્ટ કરવા
- \* બહાદુરી બતાવવા
- \* દોસ્તીના કારણે
- \* ધંધાના કારણે
- \* મોડર્ન દેખાવા
- \* બધા વચ્ચે જુદા પડવાની હિમતના અભાવે
- \* માનસિક તનાવથી મુક્ત થવા (દા.ત. એકલતા, કંટાળો, માંદગી, દાંપત્યજીવનના પ્રશ્નો, વ્યક્તિગત નિષ્ફળતાઓ, ચોંઝિદા પ્રશ્નો, નોકરીના પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, વૃદ્ધાવસ્થા વગેરે)
- \* નિર્ભળતામાં : (દા.ત. શરમાળ પ્રકૃતિ, લઘુતાગ્રંથિ)
- \* વિકલ્પ તરીકે : (દા.ત. અસલામતી, છેતરામણી, સંબંધોમાં તિરાડ, પડકાર રૂપ કાર્ય આવી પડે ત્યારે)
- \* અન્ય કારણો : (દા.ત. અનુકરણ, વાતાવરણ, ધંધો, વારસાગત)

### \* શું દારુથી એમના પ્રશ્નો ઉકલી જાય છે ?

ના,

ખરેખર દારુનો ઉપાય બામક અને તકલાદી છે, જે પ્રશ્નોને ઉકેલવા કરતાં વધુ ગુંચવે છે.

ધ્યાન લોકો એવું માનતા હોય છે કે પોતે દારુ ઓછો પીએ છે. અથવા પોતે કંદ્રોલ રાખી શકે છે. પણ બધા દારુ પીનારામાં એક વાત સામાન્ય હોય છે અને એ છે કાબૂ બહાર દારુ પીવાની ટેવ.

શરૂઆતમાં વ્યક્તિ માનસિક તનાવ હેઠળ દારુ પીએ છે. પછી મૂડ લાવવા માટે દારુ પીવો પડે છે અને એક સમય એવો આવે છે કે શારીરિક, સામાજિક,

આર્થિક અને કોટુંબિક ખાનાખરાબી છતાં દારુ પીધે જ રાખે છે અને છેવણે દારુથી જ મૃત્યુ પામે છે. એટલું જ નહીં, એની પાછળના કુઠુંબનું પણ સત્યાના વાળતો જાય છે.

### \* દારુની તાત્કાલિક અસરો :

લોહીમાં દારુની માત્રા (મિલિગ્રામ %)	શરીર પર તેની અસર
૫૦ થી ૧૦૦ મિ.ગ્રા.	માનસિક રાહત, ચિંતા મુક્તિનો બમ, બોલકાપણ, નિર્ણયશક્તિમાં ક્ષતિ
૧૦૦ થી ૨૦૦ મિ.ગ્રા.	સંવેદનશીલતામાં વધારો, અશીષ વર્તન, મંદબુદ્ધિ, મંદ પ્રતિભાવ, ખૂબ જ ઓછી નિર્ણયશક્તિને કારણે શરીર ઉપર કાબૂ ગુમાવવો.
૨૦૦ થી ૩૦૦ મિ.ગ્રા.	અણધાર્ય વર્તન-મિજાજ જવો, ભયભીત થતું, કોવિત થઈ જવું, જલ થોથરાવી, ડગમગતા પગ, ડબલ દસ્તિ
૩૦૦ થી ૪૦૦ મિ.ગ્રા.	ઘટતી જતી ચેતના, ઉભા રહેવાની અસમર્થતા, ઉલ્લંઘનો.
૪૦૦ થી ૫૦૦ મિ.ગ્રા.	સંપૂર્ણ બેભાનાવસ્થા.
૫૦૦ થી ૧૫૦ મિ.ગ્રા.	નિશ્ચિત મૃત્યુ.

લડો ખૂબ જેરી હોવાથી ૭૦થી ૧૦૦ મિ.ગ્રા. મિથાઈલં આલોહોલ (લડો) જીવનનો નાશ કરવા માટે પૂરતો છે.

દારુની લાંબાગાળાની અસરો : દારુના લાંબાગાળાની અસરો કરતાં ટૂંકાગાળાની અસરોથી આપણે વધુ પરિચિત છીએ. પણ લાંબાગાળાની અસરો ખૂબ જ મહત્વની છે.

	કોને અસર થાય ?	શું અસર થાય ?
કેન્સર થઈ શકે		મોં, ગળું, અન્નનળી, હોજરી, મોટું આંતરું, પ્રોસ્ટેટ, સ્વાદુપિંડ, સ્તન.
લીવર		સિરોસીસ
હૃદય		કૃદ્યરોગ
પાચનતંત્ર		ચાંદાં, એસ્ટાઇટીસ, ભૂખ ન લાગવી, અપગો, એસીડીટી.
પોષક તત્ત્વો		વિટામિન અને ખનિજ તત્ત્વોની ઉષાપ દા.ત. વિટામિન ડી, ક્રેલિયમ, મેળેશિયમ, જિંક.
સ્નાયુઓ અને છાડકાં		નબળાં બને, ફેક્ચર થઈ જાય, ખજ્મા અને થાપાના સ્નાયુઓ નબળાં બને.
મગજના કોષો		કાયમી અને ગંભીર ઈજા પહોંચાડે
વ્યક્તિત્વ		માણસ એકલો, ચીટિયો, ઈર્ધાળું થઈ જાય
યાદશક્તિ		ઘટી જાય, ચિત્ત બ્રમ થાય, સમજશક્તિ ઘટી જાય
કાર્યશક્તિ		મંદ પડે
સામાજિક		માણસ નીતિ-નેયમ અને જવાબદારી ભૂલી જાય. વાતોડિયો, તુંડમિજાજી, અઘડાખોર, હિસ્કવૃત્તિવાળો થઈ જાય.
શુક્કપિંડ		નાના થાય, પૌરુષવૃત્તિનું શમન, બાળકો થવાની શક્તિ ઘટે.
પેટ		બેરોળ મોટી થાય, જલોદર, લોહીની નળીઓ મોટી થાય, લોહીની ઉલટીઓ થાય.
ચામડી		જાતજાતના રોગો થાય.
રોગપ્રતિકારકશક્તિ		ઘટે

માનસિક દર્દો	વધે	
અક્ષમાતો	વધે	
ગુનાખોરી	મારામારી, મિલકતના પ્રશ્નો, જાતીય પ્રશ્નો, ઘરડાંચોરી, બળાતકાર વધે.	કુલ સા ઉદ દા
આર્થિક નુકસાન	અકલ્ય.	અ. દા

ખરેખર તો શરીરનો એકેય ભાગ એવો નથી કે જેને દારૂથી નુકસાન ન થતું હોય.

### \* દારૂ અને કેન્સર :

દારૂથી કેન્સર થવાનાં કારણો માટે જાતજાતની વિધરીઓ છે. દા. ત. ૧. સોજાની વિધરી, ૨. શારીરિક અશક્તિ, ૩. ઘટતી રોગપ્રતિકારક શક્તિ, ૪. દારૂમાંના ખાનગી તત્ત્વો, ૫. કેન્સરકારકોને ઉત્તેજિત કરવાં, ૬. લીવરની શક્તિમાં ઘટાડો થવો, ૭. તમાકુનાં એરી તત્ત્વોને ઓગાળી પેટમાં લઈ જવાં.

આમાંનાં એક અથવા એકથી વધુ કારણોને કારણો દારૂથી કેન્સર થાય છે.

અવધવ	દારૂથી વધતી કેન્સરની માત્રા	દારૂ અને તમાકુ / ધૂમ્રપાનથી વધતી કેન્સરની માત્રા
સ્તન	૫૦ થી ૧૦૦ %	
મોં અને ગળું	૨૦૦ થી ૬૦૦ %	
અન્નનળી	૨૦૦ થી ૬૦૦ %	૧૫૦૦ % ૨૫૦૦ %

દારૂ મોં, ગળું, અન્નનળી, હોજરી, મોટું આંતરું (રેકટમ) પ્રોસ્ટેટ, સ્વાહુપિંડ અને સ્તનના કેન્સરમાં વધારો કરે છે અને જો તમાકુ કે ધૂમ્રપાનની હોજરી હોય તો આ વધારો અનેકગણ્ણો વધી જાય છે. શરીરને નુકસાન કરવાની ગુનેગારીના બે મોટા ભાગીદાર ભલભલાના હાંજ ગગડાવી નાખે છે અને મોટી સંસ્કૃતિઓનો બહુ જ સરળતાથી નાશ કરી દે છે.

### \* દારૂ અને અક્ષમાત :

દારૂને લીધે રોડ પરના અક્ષમાતમાં અનેકગણ્ણો વધારો થાય છે. ભારતમાં

કુલ અક્સમાતના ૬૬ % અક્સમાત દાડને લીધે થાય છે. દાડ પી અને મોટર સાઈકલ ચલાવનારને અક્સમાતનો ૭૨ સાત ગણો વધી જાય છે અને મૃત્યુ ઉપજવાનો ભય સતત ગણો વધી જાય છે. રાતે થતા અક્સમાતોમાં ૭૦ % દાડ પીને વાહન ચલાવનાર હોય છે.

ઘરના અક્સમાતોમાં પણ દાડ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કુલ અક્સમાતોમાંથી ૩૩ % અક્સમાતો દાડને લીધે થાય છે. આગની અંદર ઘેરાયેલા દાડ પીધેલ વ્યક્તિઓમાંથી ૮૦ % વ્યક્તિઓ માટે દાડ ધાતક પુરવાર થાય છે.

### \* દાડ અને ગુનાખોરી :

ગુનેગારો મોટેભાગે ગુનો કરતા પહેલાં દાડ પીવાનું પસંદ કરતા હોય છે. જેથી એમને ગુનો કરવાની હિમત વધે છે.

ગુનાનું નામ	દાડના લીધે થતા ગુના
મારામારી	૬૩ %
મિલકતના ગુના	૬૮ %
જાતીય ગુના	૭૦ %
લિસ્ક હુમલા	૭૦ %
ઘરફોડ	૫૦ %
જેલમાં ગયેલા કેદીઓને ગુમ રોગો	૭૦ થી ૮૦ %
બળાતકાર	૫૦ %

### \* દાડ અને લીવર :

દાડથી શરીરમાં આવેલી મુખ્ય લેબોરેટરી જેવું લીવર નુકસાન પામે છે. શરૂઆતમાં પદ્ધત કૂલે છે, જેને Fatty Liver કહે છે. પાછળથી એ લીવર સંકોચાઈને નાનું થઈ જાય છે તેને સીરોસીસ ઓફ લીવર કહે છે.

સીરોસીસ બહુ જ ગંભીર બીમારી છે. શરીરમાં અનેક મહત્વના ફેરફારે થાય છે. દા. ત. જલોદર, લોહીની ઊલટીઓ વગેરે જેનાથી છેવટે વ્યક્તિઓ રિબાઈ રિબાઈને મૃત્યુ પામે છે.

માનવ જાતના બે વિનાશક શરૂઆતો તમાકુ અને દાડ વિષે આપે જાણ્યું છે. હવે આપની ઈચ્છા એને છોડવાની હોય અથવા તમારી કોઈ અંગત વ્યક્તિને એમાંથી છોડાવવાની હોય તો એ માટે હવે પછી વાંચો : વયસ્ન મુક્તિના સરળ ઉપાયો.

## \* બિયર... વાઈન... વ્હીસ્કી :

ત્રણેમાં શો ફરક છે ? બિયર ખૂબ હંડો કરીને પીવામાં આવે છે. મળનું બરફ નાખ્યા વગર બિયરમાં બે થી છ ટકા આલ્કોહોલ હોય ! કંદ મળનું હોલાવે તેવા બિયરમાં આલ્કોહોલ બાર ટકા પણ હોઈ શકે છે.

વાઈન પણ ચીલ ઉંડ હંડો પીવાય છે. વાઈનના બે મુખ્ય પ્રકાર છે. નેચરલ અથવા જેને ટેબલ વાઈન કહે છે. તેમાં દરથી ગોંદ ટકા આલ્કોહોલ કન્ટેન્ટ્સ હોય છે. બીજી પોર્ટ અથવા રેઝાર્ટ પ્રકારના વાઈનમાં આલ્કોહોલનું પ્રમાણ પંદરથી ચોવીસ ટકા હોઈ શકે. રેઝાર્ટ વાઈનમાં લિક્ષ્યોર પાછું જુદું % પીણું છે.

બિયર-વાઈન હાઈ શ્રીન્ક ગણ્ણાતાં નથી.

હાઈ શ્રીન્ક એટલે વ્હીસ્કી, રમ, વોડકા કે જીન. તેમાં આલ્કોહોલનું પ્રમાણ એંસી ટકા સુધીનું હોય છે. હાઈ શ્રીન્કને ડાયલ્યુટ કરવું જોઈએ. પાણી, ચોંઠ કે કોઈ પણ સોફ્ટ શ્રીન્કથી. માર બરફના દુકડા નાખી ‘ઓન ઘ રોક્સ’ પીનાનું પણ છે.

છેલ્લે ? કોકટેઇલ !

કોકટેઇલ એટલે પીતાં અગાઉ જ બનાવવામાં આવતું જતજતનું મિશ્રણ ! ટોમેટો જ્યુઈસથી માંડીને જતજતના ફળના રસ હાઈ શ્રીન્કમાં ચોક્કસ પ્રમાણમાં મિક્સ કરો તે કોકટેઇલ ! બલી ગેરી, સ્કૂ પ્રાઈવર, સિંગાપોર સ્લીન્ઝ, જલ્દું, ફોસ્ટ... કોકટેઇલનો પાર નથી. જેવો ટેસ્ટ અને જેવી મિક્સિંગની કલા !

આપણે ત્યાંના દેશી તાડી, લડો, પોટલી, કેની, રતલામી કે બાર ગાઉદીંદી બોલી બદલાય તેમ મહુગથી મણીપુરી સુધીના આપણા આગવા ‘શ્રીન્કસ’ના તો પાર નથી !



૫.

## કુગથી બચીએ

### \* ઘેર ઘેર માટીના ચૂલા :

“કેમ બેટા રોજ રોજ મોંડો આવે છે ?”

“હમણાં અશોકનો સ્વભાવ ખૂબ જ બદલાઈ ગયો છે.”

“આખો દિવસ રૂમ બંધ કરીને શું કરે છે ?”

“હમણાં ઘરમાંથી ચોરી થાય છે.”

“એ તમારું કહ્યું માનતો નથી તો શા માટે માથાકૂટ કરો છો ?”

અનેક આશાઓ, અરમાનો અને સ્વભાવ સાથે માબાપ બાળકોને ઉછેરે છે. એના માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ તેઓ હસતાં હસતાં સહંન કરી લે છે. પણ જ્યારે બાળક પુવાવસ્થામાં પદેલું ડગ માર્દી છે ત્યારે માબાપની ખરી કસોટી શરૂ થાય છે. પંદર વર્ષથી ત્રીસ વર્ષ સુધીની ઉમરના ગાળામાં પુવાનો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એ નાની બાબતને મોટું સ્વરૂપ આપી દેતાં ખચકાતા નથી.

બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવવા માબાપ રાતદિવસ મજૂરી કરતાં હોય છે, ત્યારે બાળકોને પૂરેપૂરાં સમજવાનો સમય એમની પાસે હોતો નથી અને હોય તો એનું મહત્વ એ સમજતા નથી.

ત્યારે શરૂ થાય છે ઉપર દર્શાવી તેવી વાતચીત. ક્યારેક ભય, ચિંતા, નિરાશા અને કોષ પણ આવી જાય છે. પણ આવા વખતે એ બધું કરવું નકામું છે. ભાવિના આવનાર ખરાબ દિવસોની એ આગાહી છે. કદાચ આપણો પુત્ર કે પુત્રી ડ્રગ પણ લેતાં હોય એવી શક્યતા રહે છે. જો તમે અત્યારે કાળજી ન લો તો તમારા પુવાન પુત્ર કે પુત્રીનું જીવન બરબાદ થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે. એની સાથે સાથે તમારી આશા, અરમાનના ભુક્કેભુક્કા બોલાઈ જશે. તમારું ઘડપણ રગડોળાઈ જશે.

### \* ક્યારે શંકા કરશો ?

તમારા જેવાં સંતત પ્રવૃત્તિશીલ દંપતીને ખબર કેવી રીતે પડે કે તમારું પુવાવસ્થાને આવેલ બાળક ડ્રગ લેતું થઈ ગયું છે અથવા થઈ જવાની અણી ઉપર છે ? નીચે જણાવેલ ચિહ્નો હોય ત્યારે આપે શંકા કરવી જરૂરી છે.

૧. શાળા, કોલેજ, નોકરી કે ધંધામાં ઓછી હાજરી.

૨. અભ્યાસમાં ઓચિંતા નિષ્ઠળ જતું.

૩. ધંધામાં કારણ વગર નુકસાન કરવું.
૪. ઘર, કુટુંબ કે મિત્રો સાથેના બગડતા સંબંધો.
૫. વાજબી કારણ વગર ઉધાર લેવું / દેવું કરવું.
૬. ચોરી કરવી.
૭. ઘરની જીલ્લામયર્યાંડા અને નિયમોનું ઉલ્લંઘન રહ્યું કરવું.
૮. વર્તનમાં ઓચિતો આનંદ, ગુસ્સો કે તિરસ્કાર આવી જવો.
૯. ખાનગી રાખવા પ્રયત્ન કરવો.
૧૦. નવા મિત્રો અને સર્કલ બનાવવું.
૧૧. ચારે મોડા ઘરે આવવું. સવારે મોડા ઉઠવું.
૧૨. જાહેર પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવું.

ઉપરોક્તમાંથી એક અથવા એકથી વધુ ચિક્કો હોય તો આપના બાળકુનું હું લેવાની ટેવ નથી ને એ જાણવું જરૂરી છે. બધા જ લોકોમાં એવી ટેવ હંથી એવું નથી, પણ માબાપ તરીકે આપે સચેત થઈ જવું ખૂબ જ જરૂરી છે.

### ● શંકા જાચ ત્યારે શું કરશો ?

તમે ગુસ્સે થશો.

અખડાવવાની હંચુા થશો.

મારવાની હંચુા થશો.

તમારી જત તમારા કાખું બધાર પણ જતી રહે.

પણ પાદ રાખો કે, ઉપરનામાંથી એક પણ વસ્તુ ન કરશો.  
મનને ખૂબ જ શાંત રાખો.

તમારા વર્તનમાં શંકા આવે એવો કોઈ જ ફરજાર ન કરશો. હવે તમાં તમારા બીજું પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી તમારા બાળકનો અભ્યાસ કરવાનો છે.

- ક્યારે જગે છે, ક્યારે ઉધે છે ?

- આખો દિવસ શું શું કરે છે ?

- એના મિત્રો કોણ કોણ છે ?

- આખા દિવસમાં ક્યાં ક્યાં જાય છે ?

- એનાં ખીસાં, દફતર એની વસ્તુઓને ખાનગીમાં તપાસો.

- શાળા, કોલેજ, નોકરી કે ધંધાની જગ્યાએ અવારનવાર જાઓ.

- એના મિત્રો અને સર્કલને મળો. એમના ઘરે જાઓ. આટલું કરશો.

એટલે તમને ઘણી માહિતી મળશે. તમારી શંકા સાચી છે કે ખોટી એ તમને ખબર પડી જશે.

✿ કુંગ લેતો કેવી રીતે વાય છે ?

પદરથી એક વર્ષની કુંગ એ જિજડાળનો સેંચી જીણવાની સમય છે અને ન્યારે પુરાન ઉપર બીજી લોકોની તરફ જ અસર ચાપ છે. એટલે ગોધ માટે, આસ્પરાનથી, શરમથી કે દુષ્યથી એ હોય લેતો રહીની જીવ છુટ્ટ.

✿ લમારા ભાગને જાગાવવા માટે શું કરવો ?

લમારા ભાગને ક્રીએલી જીવાદું છોપ તો સીઁશી સરળ રહ્યો એ છે કે રોજ એના માટે એક કલાક ચાલી, સાથે બેસે, ઘાતો કરો, બિકાર કરું, આસ્પરાનથી તેજલો. એને સમજો તો એ પ્રકાર આવશે જ એવી. બાળકને બીજા મિત્રને ત્યાં મોકલેવાના બદલે એના મિત્રને તમારે ત્યાં જ પોલાઓ. વળી અવારનાવાર એના જિત્રોના ઘરે તમે પણ જીવાનું ચાલો. શાળા, કોલેજ કે અન્ય સ્કૂલે તમે આવારનાવાર જીવાનું ચાલો એને ત્યાં એના સાધારણપણે, જિલ્લાની કે સાલકમ્પન્યારીનો સાથે જિત્રોનું કેળવો. મસ્ટોપણ ત્યાં થતા પ્રોટોનોમાં ખાજર્યી આપો. અને એટલું કરશો તો તમારું જાળી આનંદમાં રહેશો એને વાસનાની સુનોલાનાં પણ કસાયે નાલી.

✿ ઝોણા વ્યાસનાનોની સંખા કેટલી :

કુંગ લેતારની સાચી સંખા જીવાદું કાંઈ લાગલેલ અથડામ છે. પછા વિશ્વ નારોએ સંખ્યાના જીવાદું મુજબ આ સંખા જીવાનું જ જાગૃતી જીવ છે એને આસ્પરાનિકરણ એ વધારો કરવામાં જીવ જ મરદાદ્ય જીવ છે.

ક્ર.	સંખ્યાબ્ક	વિસ્તાર	પદાર્થ	સંખ્યા
૧૮૮૫	ચુંચા લંબાબો	અસરા	ચરણસાંજે	૩૦ લાખી જીવ.
૧૮૯૪	ઘાંસિટેકે નૌધાંસેલ લારા	-	-	૧૦૦,૦૦૦
૧૯૦૮	કી. દેવેન મોદ્દા	ફેલી પો. જીવી. ૧૧	૩૧	૩૨.૪ %
૧૯૧૮	કી. ગુરુકિતસ્થિ	પદીપાલ	કુંગ	૮૨ % વિશ્વાની
કી. શમી	જાગરસે	કુંગ	૧૬	૧૬ શી. ૨૫ %
કી. દેવેન ચાલ	મદુરાની	કુંગ	૧૬	૧૬ શી. ૨૫ %
કી. લોમે	-	કુંગ	૩	૩ લાખ
કી. વિલી	-	કુંગ	૨	૨ લાખ

અને

કેવી શીતે અભિયાનો ?

કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે :

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે :

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

(૧) સાહેબ (અનુભાવ)

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

એનું પ્રાપ્તિ હશે કે, કેવી વિદેશી રાણી કેવી શીતે અભિયાનો ?

હોય છે.

સૌથી સરળ રસ્તો કોઈપણ વ્યસનીને ફોસલાવીને પૂછી લેવાનો છે. જેથી આખા વિસ્તારની તમામ માહિતી મળી જશે.

ખુલ્લી અંખો અને ખુલ્લા કાન તમને ઘણી બધી માહિતી સરળતાથી આપી શકે છે.

### \* દ્રગ શું છે ?

દ્રગ અંગ્રેજ શબ્દ છે. એનો અર્થ તો દવા થાય. અહીં દ્રગ એટલે એવા પદાર્થો જે શરીર માટે ઉપયોગી નથી છતાં એને લેતાં એનું વ્યસન સરળતાથી થઈ જાય છે જે પાછળથી છોડવું ખૂબ જ અઘરું છે.

### \* દ્રગના મુખ્ય પ્રકાર :

1. નારકોટીકસ - અફીઝા અને એને સંબંધિત પદાર્થો
2. વિચારો ઘટાડતા અને ઊંઘ લાવતા પદાર્થો
3. મનને ઉત્સેજિત કરતા પદાર્થો
4. દિવાસ્વખ્નોની દુનિયામાં લઈ જતા પદાર્થો
5. ભાંગ અને એના જેવા પદાર્થો

### \* અફીઝા ( $C_{10}H_{12}NO_3$ )

અફીઝા શબ્દ, સંસ્કૃત શબ્દના અપલંશ શબ્દ ‘અહિફન’ ઉપરથી ઉત્તરી આવેલ છે. એનો અર્થ “નાગ ફેનમાંથી જેર આંકે છે” એવો થાય છે. મોરફિન શબ્દ લેટિન શબ્દ મોરફસ ઉપરથી ઉત્તરી આવ્યો છે જેનો અર્થ “સ્વખ્નોના દેવતા” એવો થાય છે.

અફીઝા એ સર્વ કેફી દ્રવ્યોના રાજાઓનો રાજા છે. મોટાભાગના કેફી પદાર્થો અફીઝાની ગંગોત્રીમાંથી પેદા થાય છે. એ બધા જ જેરોનું જેર છે.

અફીઝા એ ખસખસના છોડની પેદાશ છે. ઓક્ટોબરમાં બી રોપો તો ફેબ્રુઆરીમાં કાલાં તૈયાર થાય છે. (લગભગ કપાસનાં કાલાં જેવાં જ હોય છે) ફેબ્રુઆરીમાં કાલાં તૈયાર થાય છે. ચેકામાંથી રસ જોળે છે. એ રસને કાલાં ઉપર છરીથી ચેકા લગાવવામાં આવે છે. ચેકામાંથી રસ જોળે છે. એ રસને થીજુ જીય એટલે નાની ખપરીથી ભેગો કરવામાં આવે છે. આ થીજેલા રસને અળશીમાં બોળીને સૂકવો એટલે અફીઝા તૈયાર થાય.

અફીઝા કાળા, પીળા, ધોળા કે કાબરચીતરા, રંગમાં આવે છે.

વધો પહેલાં અફીઝાની ખેતી અફધાનિસ્તાન અને તુકસ્તાનમાં જ થતી

କାହାରେ କାହାରେ କାହାରେ କାହାରେ କାହାରେ

କାହିଁ ଏହାରେ ପାଇଁ ଆମ କାହାରେ ନାହିଁ । କାହାରେ ପାଇଁ ଆମ କାହାରେ ନାହିଁ ।

ପ୍ରମାଣ ଗ୍ରନ୍ଥ ଶତରୂପ

અને એટા કાર્યક્રમની પ્રદર્શન આપવાની સાથે એટા કાર્યક્રમની પ્રદર્શન આપવાની સાથે એટા કાર્યક્રમની પ્રદર્શન આપવાની સાથે

ପ୍ରମାଣିତ ହେଉଥିଲା ନାହିଁ କିମ୍ବା କିମ୍ବା କିମ୍ବା

ପ୍ରାଚୀ ମହିଳା କାନ୍ଦିଲା କାନ୍ଦିଲା କାନ୍ଦିଲା

\* द्वे ऐसे  $[C_{1,2}H_{10}NO(C_2H_5O_2)_2]$  काय ओक्सीटिल मोर्टक्युल :

Digitized by srujanika@gmail.com

સર્વાંગ રીતે ૧૩૦૦૦ હજુનું ૫૦૫૦ ટાકો અનીંતે બાંધુણી કરી શકતું છે.

କୁଟୁମ୍ବରେ ଲୋଟିକ ଅନ୍ତର୍ଦ୍ୱୀପ ହା ହେ ଏବଂ ଅନ୍ତର୍ଦ୍ୱୀପରେ ତାଙ୍କ ସାଥୀ ଦୟାରୁ

मैंने उसका अप्रूवण किया है। लेकिन वह एक बड़ी तरफ़ पर आता है।

એ ત્યાં ખાસ કરીને મહેસૂસ રહ્યા હતું અવિજ્ઞાન પોતી થાપ છે. દાય માટે

ପ୍ରକାଶକ ପରିଷଦ୍ୟ ମହାନ୍ତିରି ପରିଷଦ୍ୟ ମହାନ୍ତିରି

ՀԱՅԱՍՏԱՆԻ ՀԱՆՐԱՊԵՏՈՒԹՅԱՆ ԿԱռավարության կողմէ

एवं आदि तथां चीनगां देशवा भास्मि.

અનુભૂતિ

### (A) અક્ષરાને સંબંધિત ચારાં

એપોપેશન ખલી અથવા દુઃખના વખતે લાગેલો પાણ તુલી અક્ષરાની દ્વારાને લેવામાં આવે તો અક્ષરાના નંધાલી ખની જવાય છે.  
અક્ષરાં આપણે તથા વરસેચી અનેક રૂપોએ વપટાય છે.

ક્રમાંક	અક્ષરાં	દ્વારાં ઉપયોગ	દ્વારાં કાઢાની માફતા જીંની	સમય અનેક ક્રમાંક દ્વારાં લેવા પણ	ક્રમ મીઠે લેવાની?
૧	અ-ન-ન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨	અ-ઓ-ઓ-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩	અ-એ-એ-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪	અ-ઔ-ઔ-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૫	અ-િ-િ-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૬	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૭	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૮	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૯	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૦	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૧	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૨	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૩	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૪	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૫	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૬	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૭	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૮	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૧૯	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૦	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૧	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૨	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૩	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૪	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૫	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૬	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૭	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૮	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૨૯	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૦	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૧	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૨	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૩	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૪	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૫	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૬	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૭	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૮	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૩૯	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૦	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૧	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૨	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૩	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૪	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૫	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૬	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૭	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૮	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૪૯	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના
૫૦	અ-િન-િન-	દ્વારાં ઉપયોગ	અસરિયી	ખલું વિનું	ના

### ★ અક્ષરાની અસરો :

#### (A) દુંકા ગતિની :

એકોણી માર્ગનાં એકોણા લેવાચી પહેલાં ખગ પ્રિરનો કટ્ટોલ ઘટી જાય  
એથી સામાજિક બધનની અસર જરૂર રેખ છે એટલે લેનાર માઝસનો મૂડ  
વરી જાય છે.

નુંચ માત્રા વધે એમ પછી ઉલ્લેખિયો થાય છે. વધુ માત્રા વધે એટેલે  
પૈન આવે છે. ધીરે ધીરે ખાસો ખાસની આવી વધું જાય છે. આંખની કિંદી  
પૈન-ની બદ્દ જાય છે એને છેચે લેનાર વ્યક્તિ મૂઢુ પાણે છે.

#### (B) કંદા ગતિની :

લાંબો દાખત અને પદાંચ લેવાચી આરોબ્રમાં બાળો થાય છે. ધૂનાર,

કાળો, કરણો સોજો, કફામાં અને મજજુમાં પડ્ય હિંજી શક ને અને ખેડું  
ઘેલ્યા મૃત્યુ પડે છે.  
જેમ એ ચાલ્યું વાંચ રહ્યા હોયાં આવે એમ એની વાતાની જ્યું ન  
દર્શા દેવી પડે છે. એક સમય એવો આવે છે કે, એના દેશ ગેરાનું પણ નથી.

### ✿ મૃત્યુ માત્રાનું દેતો :

શાસ્ત્રની જીવનું અને સંચાય હટે છે.  
ધાર્યાગ કર્યા પડ્યું જ્યાપ છે.  
કુર્દિચાલિસરાજ તરતમાં ગંભોરી ધર્તિનો આવે છે.  
અંદર્યાંતી પદ્ધતિ આવી રહ્યે.  
ભેદાના ધર્યાય.  
મૃત્યુ ધર્યા.

### ✿ દંદ કરવાની બતી આડાસરો :

અદ્ધીલાલાના પ્રદાણી બંધ કરવાની નિર્દેશી આપાસરો આદે છે :  
ઉંઘ ન આવવી.  
અંદ અને નાકમણી પણી આવવું.  
બાળાણી આવવાં.

લાઘ હટી જઈ,  
ગુરુસ્થો આવી જવે.  
ધાર પડી મુજજવા.  
કર લાગવો.  
ધારી જુનું.  
દીલાટીએ થવી.  
કંઠ લાગવી.  
પરસેલો થવે.

આડા થલા વગેરે આપાથસરો આવે છે.

(2) બિવાયો ધરાતાન અને ટીંધ લાઘતું પદાર્થ  
દી-નોનાલીટોન અને શાબ્દોપાન નામની દવાઓ ખૂબ જ માત્રાનો અન્યાને  
દર્શાવે છે. આનો પરારસ રહે થયું પછી ટેવ પડી જવાની પક્કતાનો  
રહે છે.

નામ	બીજું નામ	દ્વારાં ઉપયોગ	વસન થવાની શક્યતા શારીરિક માનસિક	સમય જરૂર વધુ માત્રામાં લેવી પડે	અસર કલાકમાં	કૃતી રીતે લવાયા
બાર્બિગુરેટ	શાનોભાર્બિટેન	આંગડી માટે જિથ માટે	વધુ	વધુ	દા	૧ થી ૬ મો
બેન્જોડાપ્ટેપીન્સ	ડાપ્ટેપામ	જિથ માટે	ઓછી	ઓછી	દા	૪ થી ૮ મો
	વેલીપમ	ચિંતા દૂર કરવા				
	કામપોજ	આંગડી માટે				
	લાભ્રીપમ					
મેથાક્યુલોન	મેટ્રોક્સ	ચિંતા દૂર કરવા જિથ માટે આંગડી માટે	ખૂબ વધુ જિથ વધુ	ખૂબ વધુ	દા	૪ થી ૮ મો
અન્ય		"	મધ્યમ	મધ્યમ	દા	૪ થી ૮ મો

### \* આડાસરો :

તરત જ થતી :

- બોલતાં જીબ થોથડાવી
- સમય અને સ્થળનું ભાન ન રહેવું.
- કાર્ય કરવામાં ધીમાપણું આવતું.

લાંબા ગાળાની અસરો :

- કાર્યશક્તિમાં ઘટાડો
- વિચારશક્તિ ઘટવી
- બોલવામાં ધીમા અને અસ્પષ્ટ બનવું
- સમજશક્તિમાં ઘટાડો
- પાદશક્તિમાં ઘટાડો
- નિર્ઝયશક્તિમાં ખાખી
- ધ્યાન આપવાની શક્તિ ઘટે
- ગુસ્સાવાળો સ્વભાવ.
- જઘડાખોર

\* વધુ માત્રામાં લેવાથી થતી આસરો :

- શાસની સંખ્યા અને ઊડાણ ઘટે
- હાથપગ ઠંડા પડી જવા
- આંખની કિડી પહોળી થઈ જવી
- નાડીના ઘબકારાની સંખ્યા વધી જવી અને બરાબર ન ચાલવી.
- બેભાન થઈ જવું
- મૃત્યુ થવું

\* બંધ કરવાથી થતી આડાસરો :

- ચિંતા
- ઊંઘ ન આવવી
- દુઃજરી
- આંચકી
- ક્યારેક મૃત્યુ

\* 3. મનને ઉચેચિત કરતા પદાર્થો

\* કોકેઇન :  $C_{17}H_{22}NO_4$

દક્ષિણ અમેરિકામાં થાક, તરસ - ખૂબ મટાડવા માટે આદિવાસીઓ કોકાના વેલાનાં પાંદાં ચાવતો. અમેરિકો નામના હટાલિયને સન્ન ૧૪૮૮માં કોકાના પાંદાનો ચમત્કાર અનુભવ્યો.

સન્ન ૧૮૬૦માં આલબર્ટ નિમેને કોકાના પાંદામાંથી કોકેઇન શોધી કાઢ્યું. તેનો ઉપયોગ ઓસ્ટ્રેલિયાના ડૉ. કાર્લ કોલટે આંખ, કાન, ગળા અને નાકના નાના ઓપરેશનમાં એનેસ્થેસિયા લાવવા કરવા માંડયો.

આજ સુધી અજ્ઞાદ્યો આ છોડ પહેલી દાણિએ સાવ સામાન્ય આઠ ફૂટ ઊંચો અને જાડી જાંખરા જેવો લાગે. એથે અમેરિકા અને આફ્રિકાની કાળી પ્રજાને બરબાદ કરી મૂકી છે. અને હવે આખ્યા વિશ્વને બરબાદ કરવાની તૈયારીમાં છે.

ભલભલા જેનાથી ગભરાય છે એ અમેરિકા આજે કોકેઇનથી ગભરાઈ. ગયું છે. અને પાલવો એસ્કો બાર જેવા કોકેઇનના માફિયા માટે ટંબું લાખ ડોલરનું હિનામ જાહેર કર્યું છે.

મજૂરો કોકાનાં ખેતરોને હરિયાળી ખાંચ કરે છે. (ગ્રીન માઇન) તેમને મજૂરી ખૂબ જ મળે છે.

૫૦૦ ડિ.ગ્રા. કોકાનાં પાંદામાં સલ્ફાયરિક એસિડ નાખી મજૂરે પગથી

લુગદીને ચારથી પાંચ દિવસ લુગદીને મસળ્યા કરવી પડે છે. જેનાથી પગમાં ફોલ્લા પડી જાય છે. ૫૦૦ કિ.ગ્રા. પાંડાંમાંથી અડધો કિ.ગ્રા. લુગદી બને છે. આ કાચા માલને દાણાચોરો રિફાઈનરીમાં રિફાઈન કરે છે. તેમાં એસિયેન, ઈથર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતાં કોકેનનો સફેદ પાઉડર તૈયાર થાય છે.

કોકેઠન મોધું પડે છે. એટલે કોકેઠનમાં ખાવાના સોડા કે ઈથર ઉમેરી વરાળરૂપે જે ઢારવામાં આવે છે તે સસ્તું પડે છે, જે કેક તરીકે ઓળખાય છે.

નામ	દવામાં ઉપયોગ	વ્યસન યવાની શક્યતા		સમય જાતાં મધુઃ માગ્નામાં લેવી પડે	અસર કલાકમાં	કેવી રીતે લેવાય
		શારીરિક	માનસિક			
કોકેઠન	ચામડી બહેરી કરવા	જાય	ખૂબ વધુ	દા	૧ થી ૨	છીંખણી, બીડી, હંજેકશન
એમ્ફેટેમાઈન	ધ્યાન શક્તિ વધારવા વજન ઘટાડવા	જાય	ખૂબ વધુ	દા	૨ થી ૪	મોં, હંજેકશન
કેનમીટ્રેઝન	વજન ઘટાડવા	જાય	ખૂબ વધુ	દા	૨ થી ૪	મોં, હંજેકશન
મિથાઈલિનિડે	ધ્યાન શક્તિ વધારવા	જાય	મધ્યમ	દા	૨ થી ૪	મોં, હંજેકશન
અન્ય	વજન ઘટાડવા	જાય	ખૂબ વધુ	દા	૨ થી ૪	મોં, હંજેકશન

### \* આડાસરો

દૂકા ગાળાની :

જી ધ્યાનશક્તિ વધવી

જી ગુસ્સો થવો

જી તોફાની

જી મનસ્વી

જી નાડીના ધબકારા વધવા

જી લોહીનું દબાઢા વધતું

જી ઉંઘ ન આવવી

જી ભૂખ ન લાગવી

લાંબા ગાળાની :

- લોહીની નસોમાં નુકસાન
- શાનતંતુઓમાં નુકસાન
- બેસવાની પદ્ધતિમાં ફેરફાર
- માનસિક રોગ થવો

વધુ માત્રામાં લેવાથી :

- ગુસ્સો
- શરીરનું ઉષ્ણતામાન વધવું
- દિવાસ્વખનો
- આંચડી
- મૃત્યુ

બંધ કરવાથી થતી આડઅસરો :

- ખૂબ ઊંઘ આવવી
- વાતાવરણમાંથી રસ ઉડી જવો
- ડીપ્રેસન
- સ્થળ અને સમયનું ભાન ન રહેવું
- ગુસ્સો આવવો

(૪) દિવાસ્વખનોની દુનિયામાં લઈ જતા પદાર્થો

\* એલ. એસ. ડી. :

લાયસરજીક એસિડ ડાય ઇથાઇલ એમાઇડ  $C_{20} H_{28} N_3 O$

સ્વિસ કેમિસ્ટ આલ્બર્ટ હોફમેનને ૧૮૪૭ની અંદર ઘઉના કાશસલાની ફૂગમાંથી રસી બનાવવા જતાં અચાનક રીતે એલ. એસ. ડી. મળ્યું. એમાંથી કોઈ ઉપયોગી દવા આજ સુધી મળી નથી. એ એટલું બધું શક્તિશાળી છે કે ત્રીજી નીનો ગ્રામ (એટલે કે એક ડિ. ગ્રા. નો હજારમો ભાગ ગ્રામ. એક ગ્રામનો હજારમો ભાગ મિલિગ્રામ અને એનાથી પણ એ અનેક ભાગ ઓછું છે) છતાં પણ બંધાળીને એટલું આપવામાં આવે તો ત્રણ-ચાર દિવસ સુધી એ હવામાં તરતો છોય એમ બેબાન રહે છે.

નામ	દવામાં ઉપયોગ	વ્યસન યવાની શક્યતા		સમય જતાં વધુ માત્રામાં હેવી પડે	અસર કલાકમાં	કેવી રીતે લેવાય
		આરીરિક	માનસિક			
એલ. એસ. પી. નોફેટેમાઈનના સ્વરૂપો	-	-	?	કા	૮ થી ૧૨	મો
ફિસીકલીક્રિન	-	?	?	કા	અનિયમિત	મો, હૃદયકાળ
અન્ય	-	-	ખૂબ વધુ	કા	દિવસોમાં	મો, હૃદયકાળ, બીજી

### \* આડઅસરો :

દૂકા ગાળાની

■ દિવાસ્વખનો

■ સમય અને અંતરનું ભાન ન રહેવું

લાંબા ગાળાની :

■ ભયંકર ડિપ્રેસની

■ માનસિક રોગો

■ વિકૃત વર્તન

■ વિચારશક્તિમાં ઘટાડો

વધુ માત્રામાં લેવાતાં થતી આડઅસરો :

■ માનસિક રોગ

■ મૃત્યુ

(૫) ભાંગ અને એના જેવા પદાર્થો

કેનાબીસ : ભારત દેશમાં વિવિધ પ્રકારના નશાકારક પદાર્થોનો ઉપયોગ જુદા જુદા સમયે થાય છે. સમયાંતરે કેટલાક પદાર્થો બદલાતા રહ્યા છે, પરંતુ

કેનાલીસ અર્થात् ભાંગ સૈકાઓથી તમામ સ્તરના લોકો માટે લોકપ્રિય બનેલો નશાકારક પદાર્થ છે. ભાંગ નશાકારક પીજા તરીકે ધૂમ્રપાન દાચા તથા અન્ય પદ્ધતિ રૂપે નશો કરવા માટે વપરાય છે.

ભાંગની આનંદદાયક અસરોનાં વખાળ સૈકાઓથી થાય છે, ૧૯૬૮માં પ્રકાશિત થયેલ એક પુસ્તકમાં ભાંગ વિષે નીચેનું વાક્ય લખાયું છે.

‘ભાંગ આઇલાટક, આનંદદાયક, હવાઈ સફરે લઈ જનાર, સ્વર્ગની સીરી ચઠાવનાર, ગરીબોને સ્વર્ગીય સુખની અનુભૂતિ કરાવનાર, વેદનાના ઘાને રૂઝવનાર અને દુઃખ મુક્તિ અપાવનાર અદ્ભુત ચીજ છે.

કેનાલીસ જુદા જુદા ત્રણ સ્વરૂપે વપરાય છે.

ચરસ : ચરસની નાની નાની ગોળીઓને સિગારેટમાં નાખીને ગૂંડી લેવાની પદ્ધતિ આપજા દેશમાં પ્રચલિત છે. ચરસ સામાન્ય રીતે કેનાલીસના માદા છોડવાના પાંદડા અને ફૂલોની ટોચ પરથી મેળવવામાં આવે છે.

ગાંજો : સામાન્ય રીતે કેનાલીસનાં સૂકાયેલાં ફૂલોની ટોચ પરથી મેળવાય છે. અને તેને ચલમભાં નાખીને પીવામાં આવે છે.

ભાંગ : સામાન્ય રીતે નર અને માદા કેનાલીસનાં સૂકાયેલાં પાંદડાં અને ફૂલોની ડાળીઓમાંથી ભાંગ મેળવાય છે. તે સામાન્ય રીતે પીવાના સ્વરૂપમાં વપરાય છે. જોકે મીઠાઈ અને ખાદ્ય પદાર્થોમાં નાખીને પણ તેનો ઉપયોગ કરાય છે. ભાંગ શિવરાત્રીના દિવસે લેવાય છે. અને તેની પ્રસાદી લેવી એ ધાર્મિક રીત રિવાજના એક ભાગ રૂપે છે. સામાન્ય રીતે ભાંગનો નશો લોકો સમૂહમાં કરે છે. કોઈ એકલદોકલ વ્યક્તિ ભાંગ પીતો ભાગ્યે જ જોવા મળે છે. હોળી-દુલેટીના પર્વ નિયમિતે પણ ભાંગનો ઉપયોગ પ્રચલિત છે.

ભાંગ, ચરસ અને ગાંજનો વપરાશ આપજા દેશમાં સૈકાઓથી પ્રચલિત હોવા છતાં આ વ્યસની પદાર્થો અંગેનાં વિવિધ સંશોધનો છેલ્લા દોડ દાયકાથી જ શરૂ થયાં છે. માત્ર વાર- તહેવાર કે સામાજિક પ્રજાલી સિવાય પણ યુવા પેઢીમાં તેનો નિયમિત રીતે વપરાશ ચિંતાનું કારણ બન્યો છે.

ભાંગ-ચરસ અને ગાંજનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિ કાયમી ધોરણે તીવ્ર મનોવિકૃતિનો શિકાર બની જાય છે. આવી વ્યક્તિમાં નીચેનાં લક્ષણો જોવા મળે છે.

1. ચિંતા, વચ્ચતા.
2. ફિદ્યના ઘબકારા વધી જવા, ગભરામજી થવી, હાથ-પગ ઠડા પડી જવા.
3. અકારણ ભય અને નકારાત્મક વિચારો આવવા.

૪. અકારણ શંકાશીલ થઈ જવું.

૫. બીજાઓ પોતાના વિષે વાત કરી રહ્યા છે. પોતાની વિદુદ્ધ કાવનું કરી રહ્યા છે વગેરે ખોટી અને વધારે પડતી શંકાઓ થવી.

સામાન્ય સંજોગોમાં વ્યસની પદાર્થ લેવાનું બંધ કરાય તો દસ દિવસમાં ઉપરોક્ત તમામ રોગનાં લક્ષણો દૂર થઈ જાય છે. જ્યારે વ્યસની પદાર્થનું વધારે માત્રામાં લાંબા સમયથી સેવન કરાતું હોય તો ઉપરોક્ત મનોવિકૃતિઓ ઉપરાંત પાદશક્તિ કીણ થવી, સ્થળ અને સમયનું અપૂરતું ભાન રહેવું. આત્મ વિકૃતિઓનો શિકાર બને છે.

ભાંગ-ચરસ અને ગાંજાના વધારે પ્રમાણમાં સેવનને કારણો થતી મનોવિકૃતિ પેરાનોઇડ સ્કીજોફેનીયા સાથે સરખાવી શકાય.

વધો સુધી ચરસ-ગાંજા કે ભાંગનો વપરાશ કરતા વ્યસનીઓમાં કોઈ પણ પ્રકારની પ્રેરણા કે ઉત્સાહનો અભાવ જોવા મળે છે અને તેઓ ‘એમોટીવેશનલ સિન્ડ્રોપ’ના શિકાર બને છે. જેમાં નીચે મુજબનાં રોગનાં લક્ષણો જોવા મળે છે.

૧. વ્યક્તિ બેપરવાઢ, ઉદાસીન, અતડો, ભાવનાશૂન્ય બની જાય છે. તેનામાં કોઈ પણ પ્રકારની લાગણી, સહાનુભૂતિ અને દિત સંબંધનો સંપૂર્ણ અભાવ વર્તાય છે.

૨. આજુભાજુના વાતાવરણમાં કોઈ જ પ્રકારનો રસ કે રુચિ નથી રહેતાં.

૩. શારીરિક તાકાત કીણ થતી જાય છે અને દુર્બળ થતો જાય છે.

૪. ઈચ્છાઓ, અભિલાષાઓ નાચ થઈ જાય છે.

૫. બૌધ્ધિક ક્ષમતા તેમજ કાર્યક્ષમતામાં વિક્ષેપ પડે છે.

૬. નોકરી - ધંધો કરવાની ઈચ્છા થતી નથી અને કુટુંબના સભ્યો પ્રત્યે પણ રસ દાખવતો નથી.

નામ	અન્ય નામ	દવામાં ઉપયોગ	વ્યસન થવાની શક્તિ		સમય જતાં વધુ માત્રામાં લેવી પડે	અસર કલાકમાં	કેવી રીતે લેવાય
			શારીરિક	માનસિક			
મારીજુભાના	ભાંગ, ગાંજો	-	?	મધ્યમ	શ	૨ વી ૪	મો, બીડી
ટેટ્રાથાઇડ્રો	THC	કેન્સર	?	મધ્યમ	શ	૨ વી ૪	મો, બીડી
કેનાભીનોલ							
દસીસ	ચરસ, દસ	-	?	મધ્યમ	શ	૨ વી ૪	મો, બીડી
દસીચનું તેલ	દસનું તેલ	?	મધ્યમ	શ	૨ વી ૪	મો, બીડી	

### \* આડાસરો :

દુંકા ગાળાની : પુફોરીયા, બૂખ વધુ લાગવી, સમય અને સ્થળનું ભાન જતું રહેવું.

લાંબા ગાળાની : કદયની ગતિ વધવી, લોઈનું દબાણ વધવું, સમય અને સ્થળનું ભાન જતું રહેવું; સ્વભાવમાં ફેરફાર, જૈદગીમાં સફળ થવાની હંચુણામાં ઘટાડો

વધુ માત્રામાં લેવાથી : થાક લાગવો, માનશિક રોગો

બંધ કરવાથી થતી અસરો : ઉંઘ ન આવવી, બૂખ ઘટી જવી, બિનાંજરી દોડાદોડ.

પેટ્રોલ : લોકો જાતજાતના પદાર્થોનું વ્યસન કરે છે. એમાં હવે પેટ્રોલનો પણ ઉમેરો થયો છે.

### \* બધા ઝુગ માટે :

સામાજિક અસરો :

ધર : બાળક અને પત્નીને મારગૂડ કરવી, છૂટાછેડા

સ્કૂલ : અભ્યાસ બંધ, નાપાસ થવું.

ધંધામાં : નિષ્ફળ, નોકરી છોડવી પડી,

સામાજિક : અકસ્માત, જઘડા, ચોરી, ખૂન, બળાત્કાર, ધરમાં જઘડા, આર્થિક નુકસાન.



## ૬. જીજાને વ્યસન મુક્ત કરવાના રસ્તા વ્યસન છોડાવવું છે...? વ્યસન-મુક્તિના આ રહ્યા સરળ રસ્તાઓ !

---

વ્યસન એટલે બરબાઈ. વ્યસનથી થતી બરબાઈને વર્ણવવા માટે કોઈ જ પોગ્ય શર્જદો નથી. વ્યસનથી થતા નુકસાનની ગણતરી કરવી લગતમાં અશક્ય છે. એક જ દાખલો લઈશું તો થોડો અંદાજ આવશે. દા.ત. તમાકુથી દર વર્ષે ૩૦ લોકો મૃત્યુ પામે છે એટલે કે દર દસ સેકન્ડ એક માણસનું મૃત્યુ તમાકુથી થાપ છે. તમાકુથી મરનાર લોકોમાં અડધાથી વધુ લોકો ડિશોર અને યુવાન હોય છે એટલે જ વિશ આરોગ્ય સંસ્થાને તમાકુ વિરુદ્ધ યુદ્ધ છેઝું છે. એવી શંકા છે કે આવતા ત૩૦ વર્ષની અંદર તમાકુથી દર વર્ષે એક કરોડ લોકો મૃત્યુ પામશે. એટલે કે દર ત્રીજી સેકન્ડ એક માણસનું મૃત્યુ એક માત્ર તમાકુથી જ થશે.

### \* વ્યસનથી થતાં નુકસાન

આર્થિક : પૈસા વપરાય, ખર્ચ વધે, આવક ઘટે.

શારીરિક : શક્તિ ઘટે, રોગ વધે.

કૌણ્ણિક : સંબંધ બગડે.

સામાજિક : પ્રતિષ્ઠા ઘટે.

માનસિક : સંતુલન બગડે, નિર્ણય શક્તિ ઘટે.

અભ્યાસ : ઓછો કરી શકાય.

નેતિક : અધ્યપત્રન, ચોરી, વ્યભિચાર, જુહુ બોલવું.

આ તો ફક્ત તેનો આછો ઘ્યાલ જ છે. નજરોનજર જોયેલાં ડિસ્સાઓથી તો હદ્ય. દ્રવી જાય છે.

### \* વ્યસનના પ્રકાર :

- |                           |   |
|---------------------------|---|
| ૧ નારકોટીક                | ઓપિયમ, મોરકીન, કોડીન હેરોઈન,              |
|                           | પેવિડીના, ફોર્ટવીન, મેથાડોન               |
| ૨ મગજની કિયાશક્તિ ઘટાડતાં | ડાયજેપામ, લાલાયમ, બાબીગુરેટ, મેટ્રોકેસ    |
| ૩ મગજને ઉત્તેજિત કરતાં    | કોકેઈન, એન્ડેટેમાઈન્સ                     |
| ૪ હેલ્યુસિનોજન            | એલ. એસ. ડી., એમેન્ડેટેમાઈન્સ, ફ્રિન્સિલિન |

૫	કેનાબીસ	મેરાજુઆના, હશીશ, ટ્ર્યાઇઝ્રોકેનાબીનોલ
૬	તમાકુ	પાન, બીડી, સિગારેટ, મસાલા, ગુટકા, છીકણી, ટૂથપેસ્ટ

આમાંથી મોટાભાગની વસ્તુના મોહપાશમાં ફસાયા પછી નીકળવું અશક્ય થઈ પડે છે. દુર્ઘાસનની જેમ પોતાને ખબર હોય કે હું ખરાબ કરું છું છતાં છોડી શકતા નથી અને પોતાનો વિનાશ નોતરે છે.

### \* વ્યસન છોડવું કેમ અધ્યરું છે ?

મોટાભાગનાને વ્યસન છોડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે શરૂઆતમાં બહુ જ તકલીફ પડે છે. દા.ત. બગાસાં આવવાં, આળસ ચડવી, પરસેવો વહેવો, ચિંતા થવી, ભૂખ ઘટી જવી, આત્મવિશ્વાસ જતો રહેવો, તાવ, ઘબકારા વધી જવા, ઊલટી થવી, જાડા થઈ જવા વગેરે થાય છે. એટલે મોટાભાગના લોકો શરૂઆતથી જ થાકી જાય છે.

### \* વ્યસનની માત્રા વધારાટ કરતાં પરિબળો :

#### અ. વ્યસન ઘટાડતાં પરિબળો

- ૧. વ્યસનવિરોધી સંશોધકો અને વિચારકો
- ૨. વ્યસનવિરોધી પ્રચારકો
- ૩. વ્યસનવિરોધીઓ
- ૪. નિર્વસનીઓ

#### બ. વ્યસનીઓ

- ૧. વ્યસનથી આકર્ષિત / વ્યસન માટે દબાણ
- ૨. દબાણ-આકર્ષણથી ક્યારેક વ્યસન કરનાર
- ૩. સંકોચ, શરમ સાથે નિયમિત વ્યસન કરનાર
- ૪. નિ:સંકોચ રીતે નિયમિત વ્યસન કરનાર

#### ક. વ્યસન વધારતાં પરિબળો

- ૧. વ્યસનના વેપારીઓ
- ૨. વ્યસનના પ્રચારકો
- ૩. વ્યસન વધારવા માટે સંશોધન કરનાર
- ૪. વ્યસનના મોટા ઉદ્યોગપતિઓ

૩. વયસન વધારવા કે ઘટાડવામાં અન્ય પરિબળો :

- ૧. કાયદાઓ
- ૨. સામાજિક રિવાજો
- ૩. ધાર્મિક
- ૪. નેતાઓનાં વ્યક્તિગત ઘોરણો
- ૫. સાહિત્ય, અખભાર, સામયિકો, ટી.વી., ફિલ્મો વગેરે

ઉપરનાં દરેક પરિબળોની કલ્યાણમાં ના આવે એવી મોટી અસરો છે.

### \* શું વ્યસનમુક્તિ શક્ય છે ?

મોટાભાગનો જવાબ 'ના' હશે. જેમણે પ્રયત્ન કર્યો છે એ તો સ્પષ્ટપણે 'ના' પાડશે. વિશ્વમાં જે સંશોધનો થયાં છે એના આધારે આપ જતે જ નિર્ણય કરશો તો વધુ સારું.

૧. ફક્ત સલાહ આપવાથી બહુ જ ઓછી અસર થાય છે.
૨. માછિતી અને સલાહ આપવાથી ૧૦ % બંધ થાય છે.
૩. એક વખત વ્યવસ્થિત સલાહ આપવાથી ૪૦ % લોકો વ્યસન છોડે છે. ૩૦ % લોકો વ્યસન ઓછું કરે છે. ૩૦ % લોકો ગંભીર બને છે - વિચારતા થાય છે.

૪. માછિતી, સલાહ અને નજીકના યોગ્ય દાખલા આપવાથી ૩૦ થી ૬૦ % લોકો બંધ કરે છે.

૫. માછિતી, સલાહ અને નજીકના યોગ્ય દાખલા, પ્રેમ, સતત પ્રયત્ન, પ્રોત્સાહન અને ડૉક્ટરની મદદથી મોટા ભાગે બંધ થાય છે.

### \* વ્યસનમુક્તિનું રહણ્ય

- સતત માછિતી
- યોગ્ય સમયે યોગ્ય શર્દૂમાં સલાહ
- નજીકના યોગ્ય દાખલા
- પ્રેમ
- સતત પ્રયત્ન
- પ્રોત્સાહન
- ડૉક્ટરની મદદ

### \* વ્યસન બંધ કેવી રીતે કરાવશો ?

ઉત્સાહ અને પ્રેમના અતિરેકથી આપ કોઈને સમજાવો અને એ ન માને

તો પણ શક્ય હોય ત્યાં સુધી

- જઘડો ન કરશો.
- રિસાઈ ન જશો.
- અબોલા ન લેશો.
- બહુ જ દબાડા ન કરશો.
- ન માને તો ફરીથી પ્રસંગ જોઈ યાદ કરવાનું ભૂલી ન જશો.
- મશકરી ન કરો.
- ધમકી ન આપો.

આ વસન બંધ કરવા માટે નીચેની સરળ પદ્ધતિનો ઉપયોગ કરો.

#### \* પીતાં / લેતાં અટકાવો :

તમારી હાજરીમાં કોઈપણ વ્યક્તિ વસન કરે તો એને અટકાવવા પ્રયત્ન કરો. ફક્ત વિનંતીથી પણ ૫૦ %થી વધુ લોકો તમારું કહું માન્ય રાખશો. યોગ્ય સામાજિક કે ધાર્મિક કારણો બતાવવાથી થોડા સમય માટે કોઈ પણ વ્યક્તિ તમારી વાત માન્ય રાખશો. દા.ત. વડીલો કે બાળકોની હાજરી, ધાર્મિક કિયાઓ, ધાર્મિક સ્થળ.

#### \* એમને થયેલા નુકસાનની જાણ કરો :

તમે જેનું વસન બંધ કરાવવા માગો છો એના શરીરનો અભ્યાસ કરી, ક્યાં નુકસાન થયું એ શોધી કાઢો અને વાતવાતમાં સરળતાપૂર્વક આ વાત એને કહો. મોં વાસ મારે છે, વજન ઘટી ગયું છે, ખાંસી આવે છે, શાસ ચેતે છે વગેરે...

બને તો બીજા સેહીજનોની હાજરીમાં કહો, જેથી એ પણ તમને મદદરૂપ થાય.

#### \* વિશ્વાસ વ્યક્ત કરો :

વસનમુક્તિ માટે કોઈપણ પ્રયત્ન કરે ત્યારે મોટાભાગના લોકો એમને નાહિંમત થાય, નિરાશ થાય એવું બોલતા હોય છે. એટલે નિષ્ફળ જવાની બીકમાં મોટા ભાગના લોકો પ્રયત્ન કરવાનો છોડી દે છે.

પણ હવે કોઈ જીતે પ્રયત્ન કરતું હોય કે તમે પ્રયત્ન કરો ત્યારે તમે એનામાં વિશ્વાસ વ્યક્ત કરો.

'તમારા જેવા સારા માણસ આ કામ ચોક્કસ કરી શકશે.'

'તમારા માટે આ કામ મુશ્કેલ નથી.'

'તમે ચોક્કસ સફળ થશો.'

‘અમે બધા તમારી સાથે છીએ.’

એકથી વધુ વખત નિષ્ઠંગ ગયા હોય તેમને પણ હિંમત આપો. તમારો વિશ્વાસ એમને આત્મવિશ્વાસ અપાવરો જેથી તેઓ જરૂરથી સફળ થશે.

### \* જીજાને થયેલા નુકસાનની જાણ કરો :

આપના નજીકના વર્તુળમાં કોઈને કેન્સર, શાસ, ખાંસી, હદ્યરોગ, ઓચિંટું મૃત્યુ, સામાજિક જવાબદારી અદા કરતાં પહેલાં મૃત્યુ વગેરે થાય ત્યારે આખી વાત સવિસ્તાર કરી એને વ્યસન છોડવા વિનંતી કરો. આ પદ્ધતિની સૌથી સારી અસર થશે.

### \* હકીકતો રજૂ કરો :

પેપરો - સામયિકોમાં આવતા સારા લેખો એમને મોકલાવો. આ વિપ્યનાં સારાં પુસ્તકો લાવી વાંચવા માટે આપો. અનુકૂળતાએ ચર્ચા કરવાનું ભૂલતા નહીં.

### \* પ્રોત્સાહન અને હિંમત આપો :

શરૂઆતના સ્ટેજમાં એની ખાસ જરૂર હોય છે.

### \* વારંવાર સમજાવો અને વારંવાર ચાદ કરાવો :

સમય, સ્થળ અને વાતાવરણની પસંદગી કરી પછી જ પ્રયત્ન કરો, નહિતર ફાયદા કરતાં નુકસાન વધુ થશે અને ફરીથી તમારી વાત માન્ય નહીં રાખે.

### \* પ્રેમનો ઉપયોગ કરો :

એની શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરો.

### \* દોસ્તી બદલો :

ખૂબ જ સરળ અને અસરકારક ઉપાયો છે.

### \* જીજાઓની મદદ લો :

તમે જ એક ને એક વાત વારંવાર રજૂ કરો એના કરતાં અન્ય સ્નેહીજનો, મિત્રો કે સાથે રહેતા લોકોને વારંવાર વિનંતી કરો. મોટા ભાગના લોકો મદદ કરવા તૈયાર જ હોય છે અને એની અસર પણ ખૂબ જ સારી થશે.

### \* દર વર્ષે એક વખત ડોક્ટર દ્વારા નિયમિત તપાસ કરાવો :

એનાથી બેવડો ફાયદો થશે. શરીરમાં કોઈ રોગ હશે તો વહેલી જાળ થશે અને ડોક્ટરની સલાહની તમારા કરતાં વધુ અસર થશે.

- \* નાનકડાં મંડળ અથવા ગુપ બનાવો :
- \* માહિતીપત્રિકાઓ કે પુસ્તિકાઓ વહેંચો :
- \* કેટલાક પ્રશ્નો :

તમે વસન છોડાવવા જશો ત્યારે ઘણા પ્રશ્નો રજૂ થશે. એમાંથી સૌથી અગત્યના પ્રશ્નો નીચે મુજબના છે. ઉપરની માહિતીને આધારે આપ એના વધુ સારા જવાબ આપી શકશો.

- (૧) મને વસન નથી, હું ગમે ત્યારે છોડી શકું છું.  
⇒ એમ કરતાં કરતાં જ વસન થઈ જાય છે અને પછી આખી જિંદગી છૂટતું નથી.
- (૨) કબજિયાત, ગેસ, પેટના દુખાવા માટે પીઉં છું.  
⇒ એની સારવાર માટેના વધુ સારા રસ્તાઓ છે.
- (૩) મજા આવે છે / શોખ છે.  
⇒ પોતાની જાતને નુકસાન કરી મજા કે શોખ ન કરાય. બીજા ઘણા રસ્તા છે.
- (૪) વિચારવાની અને કામ કરવાની શક્તિ વધે છે. શરીરમાં સ્હૂર્તિ આવે છે.  
⇒ થોડા સમય માટે ફાયદો થાય છે પણ લાંબા ગાળે તો નુકસાન જ થાય છે.
- (૫) \* કંપની માટે પીઉં છું.  
\* ધંધા માટે પીવી પડે છે.  
\* ધંધો એવો છે કે પીવી જ પડે.  
⇒ શરીર બગાડી ધંધો કે કંપની ન થાય. વધુ સારી રીતે ધંધો કરવાના ઘણા રસ્તા છે.
- (૬) અમારે ત્યાં બધા જ પીએ છે.  
⇒ બધા કૂવામાં પડે એટલે આપણાથી ન પડાય.
- (૭) વધુ જવવાની ચિંતા નથી.  
⇒ મોત માઝું મળતું નથી. પાછળથી રિબાવાનો સમય ચોક્કસ આવશે.
- (૮) ફલાણા પીએ છે. એમને હજુ કંઈ જ થયું નથી અને ફલાણા નહોતા પીતા છતાં એમને તકલીફો છે.  
⇒ તકલીફો થવાનાં અને ન થવા માટેનાં ઘણાં કારણો હોય છે. પણ જ મોહું થઈ જશે.

(૯) અનેક વખત પ્રયત્નો કર્યા પછી નિષ્ઠળ ગયો છું.

⇒ એમ થવું શક્ય છે. પણ જેમ પ્રયત્ન કરીએ એમ સફળતા વધતી જાય છે. હવેનો પ્રયત્ન પહેલાં કરતાં વધુ સફળ હશે.

(૧૦) કોઈ કોઈ વખત ખૂબ જ ઈચ્છા થઈ આવે છે.

⇒ એ સ્વાભાવિક છે. એવું થાપ ત્યારે ઊંડા શાસ લો, કામે લાગી જાઓ, કામ ન હોય તો સારું વાચન કરો, કર્ય જ ન હોય તો ઊભા થઈ આંટ્ય મારો.

(૧૧) છોડવા પછી મારી સ્થિતિ બહુ જ ખરાબ થઈ જશે. મને એનાથી ખૂબ જ ફાયદો થયો છે.

⇒ ઘણા બધા તમારા જેવું માને છે. કંત શરૂઆતમાં જ એવું થાપ છે પછી કાયમ માટે આ દ્યાજનક સ્થિતિમાંથી બહાર આવી જશો.

(૧૨) છોડવાથી હું ખૂબ જ જરૂર થઈ જઈશ.

⇒ આજ સુધી છોડવાથી કોઈ જ ખૂબ જરૂર થયા નથી. તંદુરસ્તી માટે જરૂર હોય. એટલું વધી, પછી વજન વધતું અટકી જાય છે.

### \* પરદેશમાં શું ચાલી રહ્યું છે :

ધૂમ્રપાનથી થતા આ નુકસાનથી મોટાભાગના દેશો ખણાખણી ઉઠ્યા છે અને ભાવિ પેઢીનો નારા થતો રોકવા માટે સર્કિય પ્રયત્નો શરૂ કર્યા છે.

### \* વીમા કંપનીઓ :

ધૂમ્રપાનથી જોખમ વધે છે. એટલે વિશ્વની મોટાભાગની કંપનીઓ ધૂમ્રપાન કરનાર માણસોનું વીમાનું ગ્રીમિયમ ઉંઠ્યું વધુ ૭૦ % સુધી વધુ લે છે.

કંપની	ધૂમ્રપાન કરનાર અને ન કરનાર વચ્ચે ગ્રીમિયમનો તફાવત ટકામાં	
	પુરુષ	સ્ત્રી
આયર્લેન્ડ		.
સમલાઈફ કેનેડા	૫૪ %	૫૫ %
લાઈબરમેન લાઈફ	૫૪ %	૩૩ %
યુનાઇટેડ કિંગડમ		.
કોમર્શિયલ યુનિયન	૭૦ %	૬૫ %
ગા. રોપલ એક્સ.	૫૦ %	૬૦ %

ઉચ્ચાં ગ્રીમિયમોના લીધે ઘણા લોકો ધૂમ્રપાન કરવાનું છોડી દે છે અને એનાથી તેમને બેવડો ફાયદો થાપ છે. આરોગ્ય વધે છે અને પેસા પણ બચે છે.

### \* વર્લ્ડ બેન્ક :

વર્લ્ડ બેન્ક એક મહત્વના પોલિસીવિષયક નિર્ણયમાં એવું નક્કી કર્યું છે કે તમાકુને લગતા ઉધોગોમાં પૈસાનું રોકાણ કરવું નહીં.

### \* સાઉથ કોરિયા :

સાઉથ કોરિયાએ તમાકુની ખેતીમાં આપવામાં આવતી સબસીડી બંધ કરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને અન્ય સંસ્થાઓ :

વિશ્વ આરોગ્ય સંસ્થા, પુરોપિયન કોન્ફરન્સ ઔફ ટોબેકો પોલિસી અને કમિશન ઔફ પુરોપિયન કોમ્યુનિટીએ સર્વાનુમતે નીચેનાં સૂચનો કર્યા છે :

(૧) ગુરુતમ દરો ઉપરના ટેક્સની જગ્યાએ લઘુતમ દરો ઉપર ટેક્સ લગાવવો;

(૨) ટેક્સના દરો એવી રીતે નક્કી કરવા કે તમાકુ અને એની બનાવટો દિવસે દિવસે વધુ ને વધુ મોંઘી થાય. (બધા જ પ્રકારની તમાકુ અને કાચી તમાકુ (ઉપર.)

(૩) મોંઘવારીના વધારા કરતાં તમાકુ ઉપરના ટેક્સનો વધારો વધુ રાખવો.

(૪) આ દરેક પ્રકારની તમાકુ ઉપર ઓછામાં ઓછા અમૂક ટેક્સ તો રાખવો જ જેથી અત્યારે સસ્તી મળતી તમાકુની અમૂક જાતો મોંઘી થાય.

(૫) તમાકુમાંથી મળતા ટેક્સનો અમૂક હિસ્સો તમાકુથી થતા નુકસાનના પ્રચાર માટે વાપરવો.

(૬) કન્જુમર ગ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ગણવા માટેના પદાર્થોના લિસ્ટમાંથી તમાકુને કાઢી નાખવી.

આવા બીજા ઘણા મહત્વના નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા છે.

### \* સિંગાપુર :

જાહેરમાં પિચકારી મારનારને મોટી માત્રામાં દંડ થાય છે. એને લીધે સિંગાપુરમાં વસતા ભારતીયોમાં ગળાના કેન્સરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

### \* કુર્યાત સદા મંગલમ્...

આ અક્સીર રસ્તાઓનો આજ્ઞથી જ ઉપયોગ કરવાનું શરૂ કરો. જીવનમાં તમારી જાત, કુટુંબ, સમાજ અને દેશ માટે ખૂબ મહત્વનું કામ કરવાનો સંતોષ મેળવો. તમે આ ચોક્કસ કરી શકશો. તમારી આ શક્તિ અનેકનાં જીવન અને બરબાદી થતી રોકી શકે એમ છે.



## ૭. સ્વયં વ્યસન-મુક્તિના સરળ ઉપાય

---

‘મને કોઈ વ્યસન નથી, ક્યારેક જ લઉં છું.’

‘હું ઈચ્છું ત્યારે બંધ કરી શકું છું.’

‘ધંધા માટે ક્યારેક લેવું પડે છે.’

‘વધુ સારી રીતે કામ કરવા લઉં છું.’

‘થાક ઉતારવા માટે લઉં છું.’

‘વ્યસનથી કોઈ તકલીફ થતી નથી અને વ્યસન ન કરનારને ઘણી જ તકલીફ થાય છે.’

‘કબજ્જિયાતં માટે લઉં છું.’

‘ગોસ માટે લઉં છું.’

મોટા ભાગના લોકો જે હજુ વ્યસની બન્યા નથી એ ઉપરનામાંથી કોઈ એક અથવા એના જેવી જ કોઈ દલીલ કરશે. ખૂબ જ સુંદર દલીલો છે. મોટાભાગના લોકો એને સ્વાભાવિકપણે સ્વીકારી લે છે. પણ પછી શું થાય છે એ કોઈ જ જોતું નથી.

### \* વ્યસનનું વિષયક :

માનો કે તમે આજ દિન સુધી કોઈ જ વ્યસન કેળવ્યું નથી. ફક્ત આજે તમને શોખ ખાતર સિગારેટ પીવાની ઈચ્છા થઈ અથવા કોઈના દબાણ કે શરમના લિધે તમારે સિગારેટ પીવી પડી. હવે જુઓ એની અસર.

ફક્ત દસ સેકન્ડની અંદર તમાકુની અંદર આવેલું નિકોટીન તમારા મગજમાં પહોંચી જાય છે અને મગજના કોષો ઉપર એની અસર શરૂ કરે છે. એક સિગારેટમાંથી મળેલું ૧.૫ મિ.ગ્રા. નિકોટીન શરીરને ઉત્તેજિત કરતાં તત્ત્વો દા.ત. એરીનાલીન અને નોરેએરીનાલીનની માત્રા લોહીમાં વધારી દે છે. એરીનાલીન એ વિશ્વમાં ઉપલબ્ધ ઉત્તેજકોમાં સૌથી વધુ ઉત્તેજના પેદા કરનાર તત્ત્વ છે. બજારમાં મળતું એરીનાલીનના ઈન્જેક્શનમાં એક હજાર ભાગમાં એક ભાગ એરીનાલીન હોય છે જેનાં બેચાર ટીપાં બંધ હદયને પણ ચાલુ કરવા શક્તિમાન હોય છે.

અને થોડીકવારમાં જાણે જાદુ થઈ જાય છે. તમારા શરીરમાં શક્તિનો સંચાર થતો તમને લાગશે. તમારી વિચારશક્તિમાં સુધારો દેખાશો. કામ કરવાની ધગશ વધશે. જાણે તમે બદલાઈ ગયેલા લાગશો. પણ પછી પરિસ્થિતિનું લોલક થોડીકવારમાં બીજી દિશા પકડે છે.

ત્રીસ મિનિટ પછી શરીરમાં રહેલા નિકોટીનની માત્રા ઘટતી જશે એથી શરીરમાં રહેલા એન્ઝીનાલીનની માત્રા ઘટી જશે. ફરીથી તમે બદલાઈ જશો, આ વખતે ઊંઘી દિશામાં પ્રક્રિયા થશે. તમને કંટાળો લાગશે, થાક લાગશે, આપસ આવશે; વિચારવાની શક્તિ ઘટી જતી લાગશે, કંઈ ગમશે નહીં, ચિંતા થશે, ગુસ્સો આવશે, નિરાશ થઈ જશો, ઊંઘ નહીં આવે, હૃદયના ઘબકારા ઘટી જશે.

હવે તમારો હાથ ફરીથી સિગારેટ તરફ ખેંચાશે. તમે સિગારેટ પીશો એટલે ફરીથી તાજગી આવશે જે થોડા વખતમાં જતી રહે છે. એટલે તમને ફરીથી સિગારેટ પીવાની ઈચ્છા થશે. આમ આ લોલક બન્ને દિશામાં વારાફરતી ફર્યા કરે છે અને તમે ધૂમ્રપાન કર્યા કરો છો.

દરેક વ્યક્તિનો સ્વભાવ, શરીરની પ્રકૃતિ, ઈચ્છાશક્તિ અને વાતાવરણ જુદુજુદુ હોય છે એટલે શરૂઆતની માત્રા જુદી જુદી હોય છે. અંતે એ બધા જ લોકો ધીરે ધીરે એમને ખબર પડે એ પહેલાં વસ્તની બની જાય છે અને પછી એની ચુંગાલમાંથી છૂટવું ખૂબ જ અધરું બની જાય છે.

આ વાત દારુ, અફીણ, ગાંઝો એમ બધા જ પ્રકારનાં વસ્તનો માટે પણ સાચી છે.

પછી એ વસ્તન શરીરના જુદા જુદા ભાગોને નુકસાન કરવાની શરૂઆત કરી દેશે. દા.ત. સિગારેટમાં કાર્બન મોનોક્સાઈડ આવેલ છે. ઓક્સિજન લઈ જવાનું કામ કરતા હિમોગ્લોબીન જોડે એનું જોડાડા બસો ગણું વધુ મજબૂત હોય છે. એટલે કે ફેફસાંમાં લોહી શુદ્ધ થવાને બદલે વધુ ખરાબ થઈને શરીરના બાકીના અવયવોમાં જશે. એક સિગારેટમાં લગભગ ૨૦ મિ.ગ્રા. જેટલું કાર્બન મોનોક્સાઈડ હોય છે જે હિમોગ્લોબીનની ઓક્સિજન લઈ જવાની શક્તિમાં દસ ટકા જેટલો ઘટાડો કરે છે.

એ જ રીતે કાર્યશક્તિમાં ધૂમ્રપાનથી તરત જ વધારો થાય છે પણ લાંબાગાળો વસ્તન કરતાં નિર્વસનીઓની કાર્યશક્તિ ખરેખર વધુ હોય છે અને જેમ ગૂંચવાડાભર્યું કામ હોય એમાં વસ્તનીઓ વધુ ને વધુ પાછળ પડતા જાય છે.

કદાચ કંઈક ખરાબ થઈ જાય તો વસ્તનીની વિચારશક્તિ બિલકુલ શૂન્ય થઈ જાય છે અને એના પરિણામે તેમને મોટું નુકસાન થાય છે.

### \* ધૂમ્રપાન અને નુકસાન :

આપુથ્યમાં ઓછામાં ઓછાં ૬ વર્ષ, વધુમાં વધુ રૂપથી ૨૬ વર્ષનો ઘટાડો. દર વર્ષ ૩. ૧૫૦ અબજનો ખર્ચ સિગારેટની ખરીદીમાં થાય છે.

છેલ્લા ૨૦ વર્ષમાં ધૂમ્રપાનમાં ૧૭ %નો વધારો થયો છે. દર વર્ષ ૧૦૦૦

અમદાબદથી વધુ સિગારેટનું ઉત્પાદન થાય છે.

રોજ ૨૦ સિગારેટ હુંડી નાખનાર વક્તિ દિવસમાં ઓછામાં ઓછા ૨૦૦ પાખત સિગારેટવાળો હાથ ઊંચકે છે અને વર્ષે ૭૩ હજાર વાર હોઠ સુધી ઊંચકીને સિગારેટનો કસુ મારે છે.

કદાચ તમને પણ કોઈ વ્યસન હોય એ શક્ય છે. તમારા સ્વભાવ, તમારી આર્થિક, સામાજિક, ધાર્મિક કે રાજકીય સ્થિતિને કારણે કદાચ બીજા તમને રોકવાની હિંમત કરશે નહીં. સ્વાર્થી માણસો તમને દુઃખ પહોંચાડી તમારા લાભની વાત તમને નહીં કરે. એમને તો ફક્ત એમના જ લાભની ચિંતા છે.

તમારા જેવા હોશિયાર, બુદ્ધિગાળી પણ વ્યસનમાં ફસાઈ ગયેલા માણસોને જગૃત કરવા માટે અનેક પ્રયત્નો વિશ્વમાં થઈ રહ્યા છે. દા.ત. ૩૧મી મેના દિવસને 'અન્ટી સ્મોકિંગ દે' અર્થાત 'ધૂમ્રપાન નિષેધ દિન' તરીકે વિશ્વભરમાં ઊજવવામાં આવે છે.

તમને તમારી જિંદગી, તમારું સુખ, કુટુંબ, વ્યવસાય કે સમાજ કે રાજકીય જીવન વહાલું હોય કે પછી દુઃખથી રિબાઈ રિબાઈને મૂત્રુ પામવાની હુંચાન હોય તો તમારે બચવા માટેના અનેક રસ્તાઓ છે.

### \* સ્પયં વ્યસનમુક્તિના રસ્તા :

૧. વ્યસન છોડવાનાં કારણો વિચારો
૨. વ્યસન છોડવાની તૈયારી કરો
૩. વ્યસન છોડી દો.

૪. ફરીથી વ્યસન શરૂ ન થાય એની કાળજી રાખો.

વ્યસન બંધ કરવાની ઘટના સમય માગી લે છે.

થોડા લોકો જ સેકન્ડમાં વ્યસન બંધ કરી શકે છે પણ મોટા ભાગના લોકો એમ કરી શકતા નથી. ક્યારેક વ્યસન ફરીથી શરૂ થાય તો પછી ફરીથી બંધ કરો. આ વખતે તમને પહેલી વખત તકલીફ પડી એટલી તકલીફ નહીં પડે.

કદાચ તમને એમ લાગે કે તમે વ્યસન છોડી શકો એમ નથી તો પણ આ જરૂરથી વાંચો. વાંચ્યા પછી એના ઉપર વિચાર કરો. થોડો પ્રયત્ન પણ કરો. તમને કલ્યાના પણ નહીં હોય અને તમે એક દિવસ વ્યસનમુક્ત થઈ જશો.

અત્યાર સુધી અનેક માણસો વ્યસનમુક્ત થઈ ચૂક્યા છે અને હજુ પણ એ વ્યસનમુક્ત છે. આપ એમના સાથે દોસ્તી કરો.

### \* ૧. વ્યસન બંધ કરવાનાં કારણો :

શક્ય છે કે તમારામાં વ્યસન બંધ કરવાની તાકાત નથી એવું તમે માનતા

હો; પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે વ્યસન છૂટી જાય તો એવું તમને ગમે છે? ખરેખર તમે વ્યસન છોડવા માગો છો? કેમ કે તમારા હંદ્યમાં વ્યસન છોડવાની થોડી પણ ઈચ્છા હશે તો આ કામ ખૂબ જ સરળ થઈ જશે.

### \* (A) વ્યસન બંધ કરવાના ફાયદા :

- શરીરને થતું નુકસાન અટકી જશે.
- શરીરને થતા નુકસાનના કારણે થતા ખર્ચ ઓછા થશે.
- ઘડપણ ઓછું દુઃખદાયક બનશે.
- આર્થિક બચત થશે.
- તમારા મોંબાંથી દુર્ગંધ નહીં આવે.
- આંગળાં અને દાંત ઉપર ડાઘ નહીં પડે.
- કામ કરતાં ચાકી નહીં જાઓ.
- તમે તમારો નાશ કરી રહ્યા છો, એ ભાવના નહીં થાય.
- તમારી ખાંસી ઓછી થઈ જશે અથવા બંધ થઈ જશે.
- શરદી અને અન્ય પ્રકારના ચેપી રોગો ઓછા થશે.
- સ્વાદ પારખવાની શક્તિમાં સુધારો થશે.
- મોંબાં ચાંદાં પડવાં અટકી જશે.

### \* (B) અન્ય ફાયદા :

- (૧) ખોરાક અને પીણાંના સ્વાદ વધુ સારા લાગે.
- (૨) ત્વચાનો રંગ પણ તંદુરસ્ત રહે.
- (૩) હંદ્ય અને ફેફસાં વધુ અસરકારક રીતે કામ કરી શકે, જેથી શારીરિક સ્થિતિ સુધરે.

- (૪) માથાનો દુઃખાવો ઓછો થાય.
- (૫) રાત્રે નિદ્રા પણ સારી આવે.
- (૬) બધા કરતાં તો નાણાંનો વિચાર કરો જે તમે બીજા હેતુઓ માટે વાપરી શકો.

- પણી, બાળકો અને કુદુંબીજનોને ચોખ્ખી હવા મળશે.
- નીચેનું સૂત્ર પાદ રાખો.

*'Kiss a non-smoker and test a difference'*

- બાળકોને ન્યુમોનિયા અને અન્ય ચેપી રોગો ઓછા થશે.
- બાળકોની વ્યસની થવાની શક્યતા ઘટી જશે.
- સમાજમાં તમારું માન વધશે.

- સ્વજનોની લાગણી-પ્રેમ વધશે.

આ સિવાય બીજાં અનેક ફાયદા છે જે તમે જાતે વિચારી રહ્યો એમ છો.

કેટલાક પ્રશ્નો : વસનમુક્તિ પહેલાં તમને કેટલાક પ્રશ્નો મૂંજવી રહ્યે છે

દા. તા.,

(૧) પહેલાં મેં વસન છોડી દીવેલું જે હવે ફરીથી રહ્યું છે.

આવું બનતું જ હોય છે. જે એક વખત વસન છોડી રહે છે એ બીજી વખત ચોક્કસ વસન છોડી રહે છે અને ધીરે ધીરે વસનમુક્તા થઈ રહે છે.

(૨) અત્યારે મારાથી વસન છોડી રહ્યા એમ નથી.

એ વાત સાર્થી છે કે અમુક મુશ્કેલભરી પરિસ્થિતિમાં વસન છોડવું અધરું પડે છે પણ વસનમુક્તિની સૌથી મોટી રહ્યાંથી જ શક્ય બને છે.

(૩) હું કદાચ નિષ્ફળ જાઉ...

તમે વસનમુક્તિના પ્રયત્ન ન કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમે નિષ્ફળ ગયા કે સફળ રહ્યા. કદાચ નિષ્ફળ જાઓ તો પણ જેટલો વખત બંધ રાખ્યું એનો ફાયદો તો થશે જ. વળી ફરી વખતે વસનની માત્રા પણ ઘટશે. એટલું જ નહીં તમે બીજી, ત્રીજી, ચોથી... એમ અનેક વખત પ્રયત્ન પણ કરી રહ્યો છો. એમાં ફાયદો જ છે કોઈ નુકસાન નથી.

(૪) હા, હું ભવિષ્યમાં ચોક્કસ છોડી દઈશ.

ભવિષ્યની વાત છોડો. ભવિષ્યમાં નહીં અત્યારે જ વસનમુક્તિ માટે તૈયાર થાઓ. ભવિષ્યમાં એ કામ વધુ અધરું પડશે.

(૫) મારી જિંદગીનો એક માત્ર આનંદ લુટાઈ જશે.

એ વાત ખોટી છે. વસનમુક્તિ પછી તમારું જીવન વધુ આનંદાયક બનશે.

(૬) મારો સ્વભાવ ભગડી જતાં ઘરે અને ધંધામાં હું જઘડો કરી બેસીશ.

કદાચ એવું થોડા દિવસ બને. પણ પહેલાંથી જ બધાને કહી. દો એટલે કોઈ ખોટું નહીં લગાડે અને છતાં થોડું નુકસાન થાય તોપણ વસનમુક્તિના ફાયદા સામે એ ખૂબ જ ઓછું નુકસાન છે.

(૭) વસન વગર હું ચલાવી નહીં શકું.

પ્રયત્ન કરીને જોઈ જુઓ. તમે ચોક્કસપણો વસન વગર ચલાવી રહ્યા રહ્યો. અનેક માણસો વસન વગર ખૂબ જ સારી જિંદગી જીવે છે.

(૮) મારું વજન વધી જશે.

અ, શક્ય છે કે થોડું વજન વધે. પણ વજન કાબૂમાં રાખવાના ઘણા સારા રસ્તાઓ છે. કાળજી રાખશો તો વજન નહીં વધે.

(૮) વસન સાથે લાંબું આયુષ્ય જીવનાર પણ હોય છે.

હા. તમારી વાત સાચી છે, પણ એવા માણસોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. તમારા માટે પણ એ વાત સાચી પડશે, એવી કોઈ જ ખાતરી નથી.

(૯૦) હું તો ક્યારેક જ વસન કરું છું.

ધીરે ધીરે માણસ વસની બની જાય છે. અત્યારે એ છોડવું સહેલું છે, પછી એ બહુ જ અધરું પડશે.

(૯૧) હું તો ઓછા યારવાળી સિગારેટ કે 'નિર્દોષ' સિગારેટ કે બિયર પીઓ છું.

તમે તમારી જીતને મૂર્ખ ન બનાવશો. તેનાથી પણ નુકસાન થાય છે જ.

શરૂઆતના થોડા દિવસ આવા વિચારો બધાને આવતા જ હોય છે. છોડી દીધા પછી પણ ક્યારેક આવા વિચારો આવતા હોય છે.

(૯૨) ક્યારેક તમને એવું પણ થશે કે હવે આ ઉમરે છોડીને શું ફાયદો? બધાને મૃત્યુ તો પામવાનું જ છે તો મોજમજ શા માટે ન કરવી?

કોઈ પણ ઉમરે વસન છોડવાથી ફાયદો થાય જ છે. એટલે આપ વસન જરૂરથી છોડો. જો મોજમજ સાથે જ જિંદગી જીવવી હોય તો તો ખાસ વસન છોડી દો. વસનથી મોજમજ નથી મળતી પણ ફક્ત દુઃખ જ મળે છે.

(૯૩) તમારાં પત્ની, ભાણકો કે મિત્રો કદાચ તમારી મશ્કરી પણ કરે અથવા તમે નહીં છોડી શકો, અત્યાર સુધી કેટલી વખત છોડી એવી મશ્કરી પણ કરે.

આવી પરિસ્થિતિમાં જ્ઞાત્મવિશ્વાસ ન ગુમાવશો. એમની વાત બીજે કાનેથી કાઢી નાખો અને તમાર પ્રયત્નો ચાલુ રાખો. સાંકું ફળ ચોક્કસ મળશે જ.

#### \* દિવસ નક્કી કરો :

વસનમુજિ માટે ચોક્કસ દિવસ નક્કી કરો. એ દિવસ પછી વસન કરવું જ નથી એવું ચોક્કસ નક્કી કરો. આજના દિવસથી વધુ સારો દિવસ ક્યો હોઈ શકે? માટે આજનો જ દિવસ નક્કી કરો.

#### \* તમારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ :

જે દિવસ તમે વસનમુજિ માટે નક્કી કરો છો એ તમારી જિંદગીનો સૌથી મહત્વનો દિવસ છે. એ દિવસને આનંદથી ઉજવો. શાંતિથી સરસ રીતે પ્રશા કરો. આનંદપૂર્વક જ્ઞાન કરો. ફળોનો નાસ્તો કરો. ફરવા જાઓ. ભાણકો સાથે કે પત્ની સાથે આનંદ કરો. સાંકું પુસ્તક વાંચો.

### \* જીવન શુદ્ધાની પદ્ધતિ અથવા :

જે જે સરળો વ્યાસન કરતા હો ત્યાં ન જાઓ. જે બેનો સાથે વ્યાસન કરતા હો એમની સાથે દોષની છોપી હો. મહિરમાં લગ્નાનાં દર્શન માટે જાઓ. કોઈ પણ વ્યાસન માટે આચાર કરે તો તેને સ્વા 'ના' કહેતા શીખો.  
શરૂઆતના ઘોડા દિવસ તકલીફ પડો. આજાસ આવશે. થાક લાગશે.  
જુસ્ટો આવશે. હુંઠાળો આવશે. ચેન નહીં પડે. કબજીયાત રહે. પાચનશક્તિમાં કેરફાર થશે.

આ વધું તો અધ્યાત્મિક હીતે પણ જ બોધ છે. એમાં બેલા કરવા માટે કોઈ જ કરણ નાથી. દિવસો દિવસો એની અસરો પઢતી જશે. એક દિવસ અસાનાં રાખશો પંજમાંથી તમે સંપૂર્ણ મુક્તા થઈ જશો.

### \* માદ વી :

અસાનગુજરાતી માટે તમને અનેક લોકો મદદરેખ થઈ શકે. ખાસ કરીને -  
- પણી, ખાળી અને કુદુરીજાનો  
- બેનો  
- અસાનગુજરાતી સંસ્કારનો  
- જે વાસના નાથી કરતા એવા લોકો ચાંદની મેળી  
- ધર્મજીનાન  
- ધર્મજીનાનમાં  
- સ્વધાર વાળીકરણ  
- એકૃષ્ણપત્ર  
- સર્વાસન  
- ધારા  
- કસરત, રમતગમત  
- વાયન  
- અત્યત પ્રવૃત્તિશીલ જીવન,

### \* વાસાનગુજરાતીની શ્રીયી સાગોર ઉપાય લાદું દટ મળોલા :

તમે ગમે તે પદ્ધતિ અપનાવો. ધનોભાડ 'ના' હોય તો તમે સર્કાર 'ના' હોય. મન હોય તો જ માળવે જયાય.

### \* વસન છોડયા પછી :

વસન એક વખત તો ઘણા લોકો બંધ કરે છે પણ પછી વસનનુંપી મેનકા અને લલચાવે છે.

'લાગોને એક વખત લઉ ! પછી બંધ કરી દઈશ.'

'એક વખત લેવાથી શું ફરક પડે છે ?'

'મને તો વસન છે જ નહીં.'

'આજે ટેન્શન છે તો લઉ, પછી નહીં લઉ.'

'મિત્રોને ખોટું લાગશે, એમને ના કેમ પડાય ?'

'ઘણા માટે તો લેણું જ પડે ને, એ ક્યાં વસન છે ??'

અથવા તો પછી -

તમારા મિત્રો તમને આગાહ કરશે. કોઈ સામાજિક કે ઘંધાડીય કારણ આગળ આવશે.

વસનનુંપી મેનકા એ વખતે સોણે શાકગાર સજી નાચતી-ગાતી તમારી આગળપાછળ ફર્યા જ કરશે. તમને લલચાવવા માટે અનેક પ્રકારના ઘણ આજમાવશે અને તમે ભોળે ભાવે ભરમાઈ પણ જશો. ત્યારે તમને એ મેનકામાં દુનિયા દેખાશે, બાકીનું બધું ખોટું લાગશે.

કોઈ તમને ચેકવા આવશે તો તમને દુષ્મન લાગશે. તમે એની જોડે ગુસ્સો કરશો, અભોલા લેશો કે તેનાથી દૂર ભાગવા પ્રયત્ન કરશો.

માખણ કરતાં પણ લપસણી આ ભૂમિ ઉપર મેનકાનું કામણ જો લાગી ગયું તો તમે તરત જ લપસી જશો અને સીધા જ વસનની ઊરી ખાઈમાં ઘટેલાઈ જશો. અને અંધારી ખીણમાં પડી જશો ત્યાં સુધી તમને ખબર નહીં પડે.

એક વખત પડી ગયા પછી તમે જાગશો પણ ત્યારે મોટું થઈ ગયું હશે. વસન - મુજિતના માખણ કરતાં વધુ લપસણા પર્વત ઉપર તમારા દઢ મનોબળના નહોર જ કામ લાગશે. એ તમને સહેજ પણ નીચે નહીં ચસકવા હે. માટે મન મજબૂત રાખો.

### \* કેટલાક પ્રશ્નો :

\* મને વસનમુક્ત થતાં કેટલા દિવસ લાગશે ?

⇒ દરેક વ્યક્તિ માટે એનો સમય જુદો જુદો હોય છે. જે લોકો નવા વસની છે એમને ઓછો સમય લાગે છે. જ્યારે જૂના વસનીઓને વધુ સમય લાગે છે. તમારી પ્રકૃતિ, તમારું મનોબળ અને વાતાવરણ પણ મહત્વનો ભાગ બજવે છે.

એક વખત વસનમુક્ત થયા પછી જેમ વધુ સમય પસાર થાય એમ વસનમુક્ત થવાની શક્યતાઓ વધતી જાય છે.

\* વસનમુક્ત થવું અધરું કેમ છે ?

⇒ કોઈ પણ ટેવ છોડવી અધરી હોય છે. એ ટેવ સારી હોય કે ખરાબ. એટલે જ સારી ટેવો પાડો.

\* હું ક્યારેક ક્યારેક વસન કરું તો શું વાંધો ?

⇒ ભૂલથી પણ એવું ન કરતા. એક વખત વસન કર્યું તો ફરીથી એની લતે ચડી જતાં વાર નહીં લાગે.

\* વસનની હંચા ઘટાડવાના કોઈ રસ્તા છે ?

⇒ સંમોહન વિદ્યા, એક્યુપ્સ્ક્રિપ્ટ, સાયકોથેરોપી, યોગ, શવાસન વગેરે જરૂરથી મદદરૂપ થાય છે. પણ મોટામાં મોટી વસ્તુ તમારું દૃઢ મનોબળ છે.

\* વસનની ખરાબ અસરોમાંથી હું ક્યારે મુક્ત થઈશ ?

⇒ જેવું વસન બંધ કરો કે તરત જ તેના ફાયદા શરૂ થઈ જાય છે. તમારા શરીરની પ્રકૃતિ, ખોરાક, કેટલા સમયથી વસન કરતા હતા, કેટલું વસન કરતા હતા વગેરે પણ મહત્વની વસ્તુઓ છે: એ.ટ. ધૂમ્રપાન બંધ કરવાથી દદયના રોગો ઉપર તરત જ ફાયદો થાય છે.

- લોહીના દબાજા ઉપર તરત જ ફાયદો થાય છે.

- કફ અને ખાંસી બહુ જલદીથી ઓછાં થાય છે.

- ફેફસાંમાં થયેલા એમકીસીમા ઉપર કોઈ જ ફાયદો થતો નથી.

\* જો હું ફરીથી વસન શરૂ કરું તો ?

⇒ એવી ભૂલ ન કરતા; પણ કદાચ ફરીથી વસન શરૂ થઈ જાય તો એને ફરીથી બંધ કરવાના પ્રયત્નો આજ્યો જ ચાલુ કરી દો. બંધ કરવાના પ્રયોગમાં ફાયદો જ છે કોઈ નુકસાન નથી.

વસનમુક્તિ માટે અનેક જોક સમાજમાં ચાલે છે, પણ એનાથી

ગભરાશો નહીં. આ રાક્ષસના પંજામાંથી છૂટવું ખૂબ જ મહત્વનું છે.

કેમકે બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા લોકો કરતાં છેલ્લા છ વર્ષમાં તમાકુને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા બેઠી ત્રણ ગણી છે. ફક્ત બ્રિટનમાં દારૂ, ફેન, ખૂન, આપધાત, રોડ અક્સમાત, રેલવે અક્સમાત, એરોપ્લેનના અક્સમાત, આગ, ધરતીકંપ, મકાન પડી જવાં, સાપ કરવા, વિદ્યુતથી થતા મૃત્યુ કરતાં

પણ તમાકુથી થતા મૃત્યુનું પ્રમાજા ચારગણાથી વધુ છે.

ધૂમ્રપાન છોડવામાં વાર જરૂર લાગે છે પણ છોડવાનો પ્રયત્ન ખરેખર ઉપયોગી નથી ?

આપ હજુ પણ ધૂમ્રપાન / તમાકુ છોડી શકો છો :

- ધીમા પણ મક્કમ પગલે આગળ વધી કેન્સર તમને બરખી જાય એ પહેલાં

- ગેન્ગારીનના અસાધ્ય પીડાદાયક રોગથી તમારો પગ કપાવવો પડે એ પહેલાં

- હદ્યરોગના હુમલાનો ભોગ બની તમે તમારા ધરમાં કેદી બની જાઓ એ પહેલાં

- ફેફસાંની શક્તિઓનો નાશ કરી બેઠાંબેઠાં પણ શાસ ન લઈ શકો એવી સ્થિતિ સર્જય એ પહેલાં

- તમારો લાડકવાયો તમારી જેમ જિંદગી બરબાદ કરવાનું શીખી જાય એ પહેલાં

### \* અંતિમ અપીલ :

ઉપરોક્ત વાતો મોટાભાગનાને હચ્ચમચાવી નાખે એવી છે. છતાં આપ આત્મવંચના કરવા માગતા હો અને આપ વસન કરવા કે ચાલુ રાખવા માગતા હોય તો એ આપની અંગત મરજી છે, પણ છતાં એક તમારા જેવા જ વસની માણસની અંતિમ અપીલ સાંભળીને પછી નિર્ણય કરો.

આ અપીલ વિલિયમ ટોલમેનની છે જે અમેરિકાનો વિખ્યાત ટીવી કલાકાર હતો. એ રોજ ત્રણ પેટેટ સિગારેટ પીતો હતો. તેના દુઃખ મૃત્યુના થોડા દિવસ પહેલાં એકો ટીવી ઉપર ધૂમ્રપાનની લયાનકતા ઉપર એક મિનિટનો સંદેશ આપ્યો હતો. આ રહ્યા એના હદ્યદ્રાવક શબ્દો :

‘કદાચ કોઈમાં મારે કોઈ કેસમાં લડવાનું હોત અને એમાં હારી જાત તો મને દુઃખ ન થાત. પણ અત્યારે હું મારી જિંદગી સામે લડી રહ્યો છું. મારે એમાં કોઈપણ ભોગો જીતવું જ છે. કારણ કે એમાં હું હારી જઈશ તો મારી પ્રિય પત્ની અને મારાં પ્રિય બાળકોને મારે કાયમ માટે છોડી ઢેવાં પડશે. મારી ઈચ્છા ન હોવા છતાં ! કારણ કે મને ફેફસાંનું કેન્સર છે.’

આ હદ્યને હચ્ચમચાવી નાખતા સંદેશના શૂટિંગ વખતે જ તેને છાતીમાં જીવલેણ દુખાવો ઊપડ્યો અને મરતાં મરતાં તમારા જેવા અનેક વસનીઓ માટે એનો અંતિમ સંદેશો આપતો ગયો.

‘મેં મારા જીવનની તમામ ઉત્તમ તકોને સિગારેટના ધૂમાડામાં ફૂકી મારી છે એને હું કખૂલ કરું છું. મારી સર્વને અંતિમ અપીલ છે કે જો તમે સિગારેટ પીવાનું શરૂ ન કર્યું હોય તો હવે ન જ પીતા અને જો પીતા હોય તો આજે જ છોડી દો.’

આવા જ અંતિમ શબ્દો અમેરિકાના જાણીતા પત્રકાર માર્ક વોટર્સના છે અને મૃત્યુના છ દિવસ પહેલાં એણે કહ્યું હતું કે -

'સિગારેટ જ મારા માટે યમરાજ બનીને આવી.'

સિગારેટથી તેનાં ફેફસાં બગડી ગયાં, ખૂબ કષ થયો અને પછી એનું મૃત્યુ થયું. એના છેલ્લા શબ્દો તમારી આંખોમાંથી આંસુ લાવે એવા છે.

'મારા માટે પાછા વળવાની - બચવાની કોઈ જ તક નથી રહી.  
મારા માટે હવે ઘણું મોહું થઈ ગયું છે. તમારા માટે એવું ન બને  
એ જ શુભેચ્છા...'

જીવનના આ અંતિમ શબ્દો તમને જરૂરથી અસર કરશે અને તમે નવજીવન શરૂ કરી શકશો.

કદાચ કોઈ એવા પણ હોય જેને આ શબ્દો અસર ન કરે. એમની સ્થિતિ દુધોધન જેવી પણ હોય. જે કહે કે, 'મને ખબર છે કે હું ખોટું કરું છું. એનો અંત ખરાબ છે એ પણ મને ખબર છે, છતાં હું એ છોડી શકતો નથી.'

આવા વિચારવાળા માઝસો માટે શું કરવું એ મને ખબર નથી. માણસ જ્યારે દુઃખી થવાની હઠ પકડે છે ત્યારે ભગવાન પણ લાચાર બની જાય છે.

કેમ કે સુખી થવા માટે દરરોજ સવારે, દરેક પળે સંકલ્પ કરવો  
પડે છે કે મારે સુખી થવું છે એના માટે હું કોઈ પણ વ્યસન નહીં  
કરું. જે કંઈ વ્યસનો છે એને છોડી દઈશ.

તમે સુખી થવાનો સંકલ્પ કરો છો કે દુઃખી ? ભગવાન તમને સુખી થવાના સંકલ્પમાં જરૂર મદદરૂપ થશે.

આપની મદદની અમને જરૂર છે :

આપને વ્યસનમુક્તિમાં રસ છે ?

આપ શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં મહત્વનું સ્થાન ધરાવો છો ?

આપ લાયન્સ, રોટરી કે અન્ય કલબ સાથે સંકળાયેલા છો ?

આપ કોઈ સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા છો ?

આપ કોઈ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છો ?

આપ કોઈ બેન્ક, જાહેર સંસ્થા, ધંધા, ઉધોગ સાથે સંકળાયેલા છો ?

તો આપની મદદની અમને જરૂર છે.

## \* શું મદ્દ કરશો ?

આપને ત્યાં વસનમુક્તિનાં વ્યાખ્યાનો ગોઠવો.

વસ્તુનું મુક્તિ ઉપર સાહિત્ય વહેંચો.

વસનમુક્તિ ઉપરની વીડિયો ફિલ્મ માટે આપના દાનની આવશ્યકતા છે.

સાહિત્ય કે લેકચર માટે જરૂર હોય તો અમારો સંપર્ક સાધો.

આપના લાડકવાયાને ખાતર આપ હજુ પણ ધૂમ્રપાન છોડી શકો છો.

કેન્સરથી ધીમા પણ મક્કમ પગલે તમારી તરફ આવતા મૃત્યુનું દર્શન થાય એ પહેલાં આપ હજુ પણ ધૂમ્રપાન છોડી શકો છો.

ગેન્ગરીનના અસ્થિ પીડાદાયક રોગથી તમારો પગ કપાલવો પડે એ પહેલાં આપ હજુ પણ ધૂમ્રપાન છોડી શકો છો.

દિદ્યરોગના હુમલાનો ભોગ બની તમે તમારા ઘરના જ કેદી બની જાંઓ એ પહેલાં આપ હજુ પણ ધૂમ્રપાન છોડી શકો છો.

ફેફસાંનાં અનેક દર્દોની આવી બિધામણી દર્શામાં ધકેલાઓ એ પહેલાં આપ હજુ પણ ધૂમ્રપાન છોડી શકો છો.




## માંસાહાર ને કેન્સર

તમાકુ પછી કેન્સર થવાનાં સૌંથી મહત્વનાં કારણોમાં ચરબી મુખ્ય છે. ખાસ કરીને જે દેશો આર્થિક રીતે સમૃદ્ધ છે એવા દેશોમાં પ્રાણીજન્ય ચરબીની માત્રા વધી જાય છે અને એની સાથે કેન્સર થવાની શક્યતાઓ પડી વધી જાય છે.

### \* માંસાહાર અને કેન્સર

અવયવ	માંસાહારથી કેન્સર થવાની વધતી શક્યતા
સ્તન	પાંચ ગજી વધુ
પ્રોસ્ટેટ	૩.૬ ગજી વધુ
સ્વાહુપિંડ	૫ થી ૧૦ ગજી વધુ
મોટું આંતરડું	જુઓ નોચેની આકૃતિ

દર એક લાખે દર વર્ષ થતાં મોટા આંતરડાનાં કેન્સર



માંસાહારની માત્રા વધે તેમ મોટા આંતરડાંના કેન્સરની માત્રા વધતી જાય છે. શાકાહારીઓમાં મોટા આંતરડાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે; એટલું જ નહીં, શાકાહારી ખોરાકમાં કેન્સર થતું અટકાવવાનાં, રોગપતિકારક શક્તિ વધારવાનાં અને કબજિયાત ન થવા દેવાનાં તત્ત્વો હોય છે અને એટલે જ હિન્દુઓમાં આંતરડાના કેન્સરનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

માંસાહારથી ફક્ત કેન્સર જ વધે છે એવું નથી. એની સાથે સાથે શરીરની જાડાઈ વધે છે, જેના લીધે પગનો વા, ડાયાનિટીસ, લોહીનું દબાણ, વધુ કોલેસ્ટ્રોલ અને ફદ્યરોગનો ખુમલો થવાની શક્યતા પણ વધી જાય છે. સાથે સાથે ચાસ ચડવો, જલદીથી થાકી જવું, આળસ, પ્રમાદીપણું વગેરે પણ આવી જાય છે જીણે કે 'જે પોખ્યતું તે મારતું, દિશે એ કમ કુદરતી.' વનસ્પતિજન્ય ચરબી નુકસાન તો કરે જ છે. પણ વનસ્પતિમાં ચરબીની માત્રા ઓછી હોય છે. વળી તે અનશેચ્ચેરેટડ ફેટ હોય છે અને સાથે સાથે વનસ્પતિમાં ફાઈબર પણ હોય છે. એંદે નુકસાનની માત્રા પ્રાણીજન્ય ચરબી કરતાં વનસ્પતિજન્ય ચરબીમાં ઓછી હોય છે.

જો માંસાહાર આટલું બધું નુકસાન કરે છે તો પછી એના પ્રત્યે લોકોને આટલું બધું આકર્ષણ શા માટે છે? માંસાહાર વનસ્પતિજન્ય ખોરાક કરતાં વધું ખર્ચણ હોય છે અને એટલે મોટાભાગે સુખી લોકો જ એનો ભૂતકાળમાં ઉપયોગ કરતા એટલે એના પ્રત્યે એક પ્રકારનો લોકોમાં આદર છે. અને એથી માંસાહાર સારો એવી સામાજિક માન્યતા બંધાઈ છે. વળી માંસાહાર વિશે ટી.વી. અને પેપરમાં આવતી જહેરાતો પણ મોટો ભાગ ભજવે છે. દા.ત. સન્દે હો યા મન્તે રોજ રોજ ખાઓ અને, ઈડાં ગુજ્ઝોમાં એવાં, શુદ્ધ સોના જેવાં, સમાઇમાં સાતેય વાર, લો ઈડાંનો આહાર વગેરે વગેરે.

તમે ન માનતા હો તો જુઓ નીચેનો ચાર્ટ જેમાં પ્રાણીજન્ય ખોરાક અને વનસ્પતિજન્ય ખોરાકની સરખામણી કરેલ છે.

### આહાર કોષ્ટક

#### \* શાકાહારી

ખોરાક	પ્રોટીન	ચરબી	ક્રાંકોણા.	અનિજ	ક્રેલિયમ	ફોલ્ફરસ	લોહતાય	રેખાતાય	ફેલી
પદ્ધતિ	12.1	1.0	02.2	1.0	0.04	0.32	0.3	1.2	326
ચોખા	6.4	0.1	09.8	0.6	0.01	0.26	2.6	-	388
જાડાઈ	11.1	3.1	11.2	1.4	0.01	0.33	2.1	2.6	382
ખજરી	11.1	4.0	17.1	2.0	0.04	0.34	6.6	1.2	310

જુવાર	૧૧.૫	૧.૩	૬૮.૩	૧.૪	૦.૦૩	૦.૨૩	૩.૦	૩.૬	૩૫૫
મગ	૨૪.૦	૧.૩	૫૯.૬	૩.૬	૦.૧૪	૦.૨૮	૮.૪	૮.૧	૩૩૮
મહિને	૨૪.૦	૧.૪	૧૦.૩	૩.૪	૦.૨૦	૦.૩૯	૮.૮	-	૩૪૦
તુલેર	૨૨.૩	૧.૩	૫૭.૨	૩.૬	૦.૧૪	૦.૨૬	૮.૮	-	૩૪૩
ગણા	૨૨.૫	૫.૨	૫૮.૬	૨.૨	૦.૦૩	૦.૩૧	૮.૮	૩.૬	૩૩૨
વાત	૨૪.૧	૦.૭	૫૫.૭	૩.૨	૦.૦૩	૦.૪૬	૩.૨	૧.૪	૩૨૯
મસૂર	૨૫.૧	૦.૭	૫૮.૭	૨.૧	૦.૧૩	૦.૨૪	૨.૦	-	૩૭૬
વટાણા	૨૨.૬	૧.૪	૧૩.૪	૨.૩	૦.૦૩	૦.૩૧	૪.૦	૪.૪	૩૪૮
તલ	૧૮.૩	૪૩.૩	૨૪.૨	૫.૨	૧.૪૪	૦.૪૩	૧.૦૪	૩.૬	૫૧૪
મગફળી	૩૧.૫	૩૮.૮	૧૬.૩	૨.૩	૦.૦૪	૦.૩૮	૧.૬	૩.૧	૫૪૮
સોયાબીન	૪૩.૨	૧૬.૫	૨૨.૮	૪.૧	૦.૨૪	૦.૧૯	૧૧.૪	૩.૦	૪૩૨
નારિયેળ	૪.૨	૪૧.૬	૧૩.૦	૧.૦	૦.૦૧	૦.૨૪	૧.૦	-	૪૪૪
છુ	૧૮.૭	૧૪.૦	૩૧.૬	૪.૮	૧.૮	૦.૪૮	૩૧.૦	-	૩૪૬
મેધી	૨૧.૨	૫.૮	૪૪.૧	૩.૦	૦.૧૧	૦.૩૯	૧૪.૧	૫૯૦	૩૩૩
દૂધનો પા.	૩૮.૦	૦.૧	૧૪.૦	૬.૬	૧.૩૦	૧.૦	૧.૪	-	૩૪૭

### \* માંસાહારી

ઈડા	૧૩.૩	૧૩.૩	-	૧.૦	૦.૦૧	૦.૨૨	૨.૧	-	૧૩૭
માછલી	૨૨.૬	૦.૬	-	૦.૮	૦.૦૨	૦.૧૮	૦.૬	-	૬૧
માંસ-અકરી	૧૮.૫	૧૩.૩	-	૧.૩	૦.૧૪	૦.૧૪	૨.૫	-	૧૬૪
માંસ-સૂવર	૧૮.૭	૪.૪	-	૧.૦	૦.૦૩	૦.૨૦	૨.૩	-	૧૪૪

ચોકઠામાં આપેલ પોષકતાનો વધારે પ્રમાણમાં છે. માંસાહાર કરતાં શાકાહારમાં સર્વાંગી વિપુલ પોષકતાનો દેખાઈ આવે છે.

શાકાહારમાં સર્વાંગી વિપુલ પોષકતાનો દેખાઈ આવે છે.

D.T. ઈડાની કરતાં મોટાભાગનાં કઠોળમાં લગભગ. ડબલ મોટીન હોય છે, મગફળીમાં અઢી ગણું અને સોયાબીનમાં તો જરૂર ગણું વધુ મોટીન હોય છે. એ જ રીતે કાર્બોલાઇન્ડ્રિટ, બનીજ, કેલિસ્યમ, ફોસ્ફરસ, લોહતાત્વ, વિટામિન્સ અને રેસાતાત્વ શાકાહારી ખોરાકમાં વધુ હોય છે. ૧૦૦ મિ.ગ્રા. વિટામિન 'સી', અને રેસાતાત્વ શાકાહારી ખોરાકમાં વધુ હોય છે. પરંતુ એટલું જ વિટામિન 'સી' ઈડામાંથી મેળવવા માટે ૧. આમણું પૂરતું છે. પરંતુ એટલું જ વિટામિન 'સી' ઈડામાંથી મેળવવું હોય તો ૫૦૦ ઈડાની આરોગ્યવાં પડે. એક સરખા પેસા ખરચતાં ઈડાની કરતાં ઘઉં, બાજરી, જુવાર અને મકાઈમાં આઠથી દસ ગણી શક્તિ વધારે મળે છે. વળી ઈડાની શાકાહાર કરતાં મોંઘાં હંય છે અને હેરફેર વખતે ૧૦ % ઈડાની દુટી જાય છે.

### \* માંસાહારથી કેન્સર કેમ વધુ થાય છે ?

યોગ્ય વાતાવરણમાં જેમ બીજનો વિકાસ સારો થાય છે એમ કેન્સરના કોષોનો વિકાસ ચરબીની માત્રા વધુ હોય ત્યારે સારો થાય છે. ચરબી જાતે કેન્સર શરૂ કરવાનું કામ કરતી નથી પણ કેન્સરના થયેલા કોષોને ઝડપથી વધવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે.

વધુ પડતી ચરબી પ્રોલેક્ટીન નામના અંતઃઝાવની માત્રા વધારે છે. સામાન્ય સંજોગોમાં પ્રોલેક્ટીનનું કામ ધાવજા વધુ લાવવાનું છે. પણ વધુ પડતું પ્રોલેક્ટીન સ્તનના કેન્સર અને ચરબી વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. એ જ રીતે વધુ પડતી ચરબી ખાતા લોકોમાં શાકાહારી કરતાં ઈસ્ટ્રોજન નામના અંતઃઝાવનું પુનઃશોષજા વધુ થાય છે. એટલે લોહીમાં ઈસ્ટ્રોજનની માત્રા વધે છે અને આ વધુ માત્રામાં ઈસ્ટ્રોજન સ્તનનું કેન્સર કરવા માટે કારણભૂત છે. એટલું જ નહીં ચરબીના લીધે પ્રોસ્ટ્રાગલેન્ડીનની માત્રા પણ શરીરમાં વધે છે. આ વધેલું પ્રોસ્ટ્રાગલેન્ડીન માથાનો દુખાવો, માસિક વખતે દુખાવો અને સ્તનના કેન્સર માટે પણ કારણભૂત છે.

પ્રોસ્ટેટને કેટલાક વૈજ્ઞાનિકો પુરુષોના સ્તન કહે છે અને એની રૂચના અને કાર્ય પણ અમુક રીતે મળતું આવે છે. એના કેન્સરમાં પણ ઉપરોક્ત અંતઃઝાવો કારણભૂત છે.

વધુ પડતી ચરબીને પચાવવા માટે બાઈલ એસિડ નામના પાચક રસની વધુ જરૂર પડે છે. આ પાચક રસની માત્રા વધતાં આંતરડાના અંદરના ભાગમાં આવેલ રક્ષણાત્મક ઘુક્સ નામના થરનો નાશ થાય છે અને કોષોને પણ નુકસાન કરે છે. આના લીધે આંતરડાના કોષો વારંવાર વધુ માત્રામાં નવા પેદા કરવા પડે છે. વળી આંતરડામાં અમુક બેક્ટેરિયા બાઈલનું સેકન્ડરી બાઈલ એસિડમાં રૂપાંતર કરે છે. આ બધી જ વસ્તુઓ આંતરડાના કેન્સરની શક્યતાઓ વધારે છે.

વનસ્પતિજ્ઞન્ય ખોરાકમાં આવેલા ફાઈબર બાઈલ એસિડને શોખી લે છે. આંતરડાની દીવાલને રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે અને બેક્ટેરિયાની માત્રા પણ ઘટાડે છે. આમ ફાઈબર આંતરડાનું કેન્સર થતું અટકાવવામાં ખૂબ જ મદદરૂપ છે.

### \* કચા પ્રકારની ચરબી વધુ નુકસાનકારક છે ?

વનસ્પતિજ્ઞન્ય અને ગ્રાઝીજ્ઞન્ય બન્ને પ્રકારની ચરબીઓ વધુ માત્રામાં લેવાથી નુકસાનકારક સાબિત થાય છે પણ બન્નેમાં ગ્રાઝીજ્ઞન્ય ચરબી વધુ નુકસાનકારક છે. સેચ્યુરેટેડ ફેટીએસિડ અને અનસેચ્યુરેટેડ ફેટીએસિડ બન્નેથી

કોઈનું પજા વધુ પ્રમાણ કેન્સરની માત્રા વધારે છે. કોલેસ્ટરોલનું વધુ પ્રમાણ પજા આંતરડાના કેન્સરને વધારવા માટે કારણભૂત છે.

### \* કયા પ્રકારની ચરબી વધુ લેવી ?

શક્ય હોય ત્યાં સુધી ખોરાકમાં વનસ્પતિજન્ય ચરબી વધુ લેવી. તેનાથી કેન્સર થવાની શક્યતા ઓછી છે. વળી ફંદ્યોગની અને કોલેસ્ટરોલની માત્રા પજા એનાથી ઓછી વધે છે.

### \* કેટલી માત્રામાં ચરબી લેવી ?

સામાન્ય રીતે ખોરાકની કુલ કેલરીના ૩૦ % ચરબીમાંથી મળવા જોઈએ. પજા અમેરિકન હેલ્થ ફાઉન્ડેશનના મત પ્રમાણે આ માત્રા ફક્ત ૨૦થી ૨૫ % હોવી જોઈએ. એનો અર્થ એ થયો કે તમને કયા ખોરાકમાંથી કેટલી કેલરી ચરબીના લીધે મળશે એનો ખ્યાલ આવવો જોઈએ.

### \* ખોરાકમાં ચરબીની માત્રા :

ખોરાક	ચરબીમાંથી મળતી કેલરી ટકામાં
-------	-----------------------------

#### ૧. વનસ્પતિજન્ય

બટાટાની કાતરી	૫૬ %		
તળેલા બટાટા	૫૬ %		
બાંદેલા બટાટા			
ફોલ્યા પઢી	૧ %	મેકેરીલ	૧૦ %
ફોલ્યા વગર	૮ %	સાલમોન	૫૩ %
કુંગળી	૫ %	ચીકન	૧૪ %
ગાજર	૩ %	ડક્ક	૫૦ %
મશરૂમ	૧૩ %	ગુજ	૪૮ %

#### ૨. સલાદ

ચીજ સલાદ	૮૨ %	બેકોન	૭૭ %
રશિયન સલાદ	૮૧ %	બીફ	૬૮ %
ઈટાલિયન સલાદ	૮૧ %	હેમ	૬૮ %
ફેન્ચ સલાદ	૮૪ %	લીવર	૭૮ %

#### ૩. દરિયાઈ

ખ્યુ ફિસ	૩૦ %	ચોખા	૪ %
ફિસ કેક	૪૨ %	બ્રેડ	

ધર્મ	૨૮ %	ચીજ	૭૨ %
દ. ફળ		કીમ	૬૪ %
સફરજાન	૫ %	દૂધ	
કુણા	૪ %	આખું	૪૮ %
દ્રાક્ષ	૪ %	ઓછી ચરબીવાળું	૨૨ %
નારંગી	૨ %	સ્કીમ	૪ %
સ્ટ્રોબરી	૧૦ %	બટરમિલ્ક	૧૯ %
૭. ડેરી પ્રોડક્ટ		પોગાર્ટ	૨૧ %
માખજા	૮૮ %		

સારાંશમાં કહેવું હોય કે તંદુરસ્ત રહેવું હોય તો ફળની પ્રથમ પસંદગી કરો ઓછી અનાજ અને વનસ્પતિજન્ય ખોરાક. બાકીનું બધું આનંદ અને સ્વાદ માટે છે એટલે અનો ઓછો ઉપયોગ કરો.

### \* વધુ પડતું વજન અને કેન્સર :

વધુ પડતું વજન હોય એમને કેન્સર થવાની શક્યતા વધી જાય છે. ઊંચાઈના પ્રમાણમાં ૪૦ %થી વધુ વજન હોય એમને કેન્સરથી મૃત્યુ પામવાની શક્યતાઓ વધી જાય છે. ખાસ કરીને મોટું આંતરદું, પ્રોસ્ટેટ, પિતાશય, ગાભાર્શય, ગાભાર્શયનું મુખ અને સ્તનનું કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.

૧૦ % વધુ વજન ધરાવતી સ્ત્રીઓને ગાભાર્શયના કેન્સરની શક્યતા ૩૬ % વધી જાય છે. જ્યારે ૪૦ % વધુ વજન ધરાવતી સ્ત્રીઓને ગાભાર્શયના કેન્સરની શક્યતા ૫.૫ ગણી વધી જાય છે. દર મહિને ૧૦૦૦ ગ્રામ ચરબી લઈએ તો મૃત્યુની શક્યતા ૧૦૪ ગણી વધી જાય છે એટલે કે રોજનું ૨ ચમગા માખજા.

### ઊંચાઈ, ઉંમર, વજન અને કેલરી :

જેમ ઉંમર વધી એમ વજન વધતું જાય છે. તમારી ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં તમારે કેટલું વજન જોઈએ એ નીચેના ચાર્ટમાંથી મળી રહેશે.

### ઊંચાઈ, ઉંમર અને આદર્શ વજન

ઊંચાઈ	વજન સલખમાં			વજન સલખમાં		
	ફૂટ અને ઇંચ	ઉંમર ૨૫-૨૮	પુરુષ અને સ્ત્રીની ઉંમર	પુરુષ અને સ્ત્રીની ઉંમર	ફૂટ	ફૂટ
૪-૧૦	૫૩૪	૩૮	૨૫	૩૫	૪૫	૫૫
	... ૧૦૦-૧૩૧	૮૪-૧૧૧	૮૨-૧૧૮	૮૮-૧૨૭	૧૦૭-૧૩૪	૧૧૪-૧૪૨

૪-૧૧	...	૧૦૧-૧૩૪	૮૦-૧૧૫	૮૪-૧૨૩	૧૦૩-૧૩૧	૧૧૧-૧૩૮	૧૧૬-૧૪૦
૪-૦	...	૧૦૩-૧૩૭	૮૦-૧૧૬	૮૮-૧૨૦	૧૦૬-૧૩૪	૧૧૮-૧૮૩	૧૨૩-૧૪૨
૪-૧	૧૨૩-૧૪૪	૧૦૪-૧૪૦	૮૩-૧૨૩	૧૦૧-૧૩૧	૧૧૦-૧૪૦	૧૧૮-૧૮૮	૧૨૦-૧૪૯
૪-૨	૧૨૪-૧૪૮	૧૦૮-૧૪૪	૮૬-૧૨૭	૧૦૪-૧૩૬	૧૧૩-૧૪૪	૧૨૨-૧૪૩	૧૩૧-૧૬૩
૪-૩	૧૨૭-૧૪૧	૧૧૧-૧૪૮	૮૮-૧૩૧	૧૦૮-૧૪૦	૧૧૦-૧૪૮	૧૨૬-૧૪૮	૧૩૪-૧૬૮
૪-૪	૧૨૮-૧૪૫	૧૧૪-૧૪૨	૧૦૨-૧૩૪	૧૧૨-૧૪૪	૧૨૭-૧૪૪	૧૩૦-૧૬૩	૧૪૦-૧૦૩
૪-૫	૧૩૧-૧૪૮	૧૧૦-૧૪૬	૧૦૬-૧૪૦	૧૧૪-૧૪૮	૧૨૪-૧૪૮	૧૩૮-૧૬૮	૧૪૪-૧૭૮
૪-૬	૧૩૩-૧૬૩	૧૨૦-૧૧૦	૧૦૮-૧૪૪	૧૧૬-૧૪૪	૧૨૮-૧૬૪	૧૩૮-૧૦૪	૧૪૮-૧૮૪
૪-૭	૧૩૪-૧૬૭	૧૨૩-૧૧૪	૧૧૨-૧૪૮	૧૨૨-૧૪૮	૧૩૩-૧૧૮	૧૪૩-૧૦૮	૧૪૩-૧૬૦
૪-૮	૧૩૦-૧૦૧	૧૨૧-૧૬૭	૧૧૬-૧૪૩	૧૨૬-૧૬૩	૧૩૦-૧૦૪	૧૪૦-૧૮૪	૧૪૮-૧૬૬
૪-૯	૧૩૮-૧૦૪	૧૨૮-૧૯૦	૧૧૮-૧૪૭	૧૩૦-૧૧૮	૧૪૧-૧૦૮	૧૪૯-૧૫૦	૧૬૨-૨૦૧
૪-૧૦	૧૪૧-૧૦૬	૧૩૨-૧૦૩	૧૨૨-૧૧૨	૧૩૪-૧૦૩	૧૪૪-૧૬૪	૧૪૬-૧૪૪	૧૬૭-૨૦૭
૪-૧૧	૧૪૪-૧૮૩	૧૩૪-૧૦૧	૧૨૧-૧૬૦	૧૩૦-૧૦૮	૧૪૮-૧૬૦	૧૫૦-૨૦૧	૧૦૨-૨૧૩
૫-૦	૧૪૭-૧૮૭	...	૧૨૮-૧૦૧	૧૪૧-૧૮૩	૧૪૩-૧૫૪	૧૬૪-૨૦૧	૧૦૦-૨૧૮
૫-૧	૧૪૦-૧૮૨	...	૧૩૩-૧૦૧	૧૪૪-૧૮૮	૧૪૭-૨૦૦	૧૬૬-૨૧૩	૧૮૨-૨૨૪
૫-૨	૧૪૩-૧૮૭	...	૧૩૭-૧૮૧	૧૪૮-૧૮૪	૧૬૨-૨૦૧	૧૭૪-૨૧૮	૧૮૭-૨૩૨
૫-૩	૧૪૭-૨૦૨	...	૧૪૧-૧૮૬	૧૪૩-૧૮૮	૧૬૬-૨૧૨	૧૭૮-૨૨૪	૧૮૨-૨૩૮
૫-૪	...	...	૧૪૪-૧૮૧	૧૪૭-૨૦૪	૧૭૧-૨૧૮	૧૮૪-૨૩૧	૧૮૭-૨૪૪

\* બૂટ કે ચંપલ વગર + કાંડા, બૂટ કે ચંપલ વગર

નોંધ : જે લોકોને દર વર્ષે ૧ રતલા કે ઓછું વજન વધે છે, એમનો મૃત્યુદર સૌથી ઓછો હોય છે.

### ઉમર, ઉંચાઈ અને વજન પ્રમાણે કેલરીની જરૂરિયાત

ઉમર (વર્ષ)	વજન કિ.ગ્ર.	ઉંચાઈ સે.મી.	કેલરી	શીખ	દાઢ	દાઢ	કેલરી
નવજાત શિશુ	૦.૦	૦.૪	૬	૧૩	૧૦	૨૪	૮૩૧.૬૧૧૫
	૦.૪-૧.૫	.૬	૨૦	૧૧	૨૮		૮૩૧.૬૧૦૪
બાળકો	૧-૩	૧૩	૨૮	૬૦	૩૪	૧૩૦૦	૪૦૦
	૪-૬	૨૦	૪૪	૧૧૨	૪૪	૧૯૦૦	૪૦૦
	૭-૧૦	૨૮	૬૨	૧૩૨	૫૨	૨૪૦૦	૪૦૦
કુદુ	૧૧-૧૪	૪૪	૮૮	૧૪૭	૬૨	૨૯૦૦	૪૦૦

						૨૬૦૦	૪૦૦
૧૫-૧૮	૧૧	૧૪૪	૧૭૯	૧૬			
૧૮-૨૨	૩૦	૧૪૪	૧૦૯	૩૦	૨૬૦૦		૪૦૦
૨૩-૪૦	૩૦	૧૪૪	૧૦૮	૩૦	૨૦૦૦		૪૦૦
૪૧-૬૪	૩૦	૧૪૪	૧૦૮	૩૦	૨૪૦૦		૪૦૦
૭૬+	૩૦	૧૪૪	૧૦૮	૩૦	૨૦૪૦		૪૦૦
સ્ત્રીઓ	૧૧-૧૪	૪૧	૧૦૧	૧૪૭	૬૨	૨૨૦૦	૪૦૦
	૧૫-૧૮	૫૫	૧૨૦	૧૬૩	૬૪	૨૧૦૦	૪૦૦
	૧૮-૨૨	૫૫	૧૨૦	૧૬૩	૬૪	૨૧૦૦	૪૦૦
	૨૩-૪૦	૫૫	૧૨૦	૧૬૩	૬૪	૨૦૦૦	૪૦૦
	૪૧-૬૪	૫૫	૧૨૦	૧૬૩	૬૪	૧૬૦૦	૪૦૦
	૭૬+	૫૫	૧૨૦	૧૬૩	૬૪	૧૬૦૦	૪૦૦
ગર્ભવત્સા					+ ૩૦૦		
શાવસુ આપતી માતાઓ					+ ૪૦૦		

### \* વજન ઘટાડવાળા સુંદર રક્તા :

(૧) ધીમેથી જમો, ચાવી ચાવીને જમો, થોણું લો, ડીશમાં વધારાનું પડી રહે તો એની ચિંતા ન કરશો. નાની અને છીછરી ડીશ લો. આમ કરવાથી જમવાની કુલ માત્રા તમારા શરીરમાં ઓછી જરો.

(૨) કંઈ પણ ખાવાની ઈંચ્છા થઈ જાય ત્યારે ઊંડા ઊંડા શાસ લો. કંઈ મનગમતી પ્રવૃત્તિ કરો. અને ન છૂટકે ખાવું જ પડે તો ઓછી કેલરીવાળો ખોરાક પસંદ કરો.

(૩) રસોઈમાં અને ખોરાકમાં ચરબીવાળા પદાર્થોનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.

(૪) ખોરાકમાં રેસાવાળા પદાર્થોની માત્રા વધારો.

(૫) પોતાનું કામ જાતે કરો, ચાલો, કસરત કરો, આરામ શક્ય હોય એટલો ઓછો કરો.



## ગલ્લા : ભારતનાં વિશિષ્ટ રોગ ઉછેર કેન્દ્રો

ભારત અતિ પ્રાચીન દેશ છે. આ દેશની વિશિષ્ટ સંસ્કૃતિ છે : ઉચ્ચભાવના, વિશાળ ફદ્ય, ત્યાગ, બલિદાન એ એના ગુણો છે. મંદિર, આશ્રમ, પાણીની પરબો, મુસાફરખાનાં, ચખૂતરા, પાંજરાપોળ એ એની નિશાનીઓ હતી.

પણ હવે સમય બદલાઈ ગયો છે. સમય સાથે દેશ પણ બદલાઈ ગયો છે. એમ દેશની નિશાનીઓ પણ બદલાઈ ગઈ છે. આધુનિક ભારતની નિશાની છે ગલ્લા.

નાના કે મોટા કોઈપણ શહેરના દરેક રોડ ઉપર તમને ગલ્લા દેખાશે. દરેક પોળ કે સોસાયટીના નાકે પણ અચૂક હોવાના. રેસ્ટોરન્ટ, હોટલ કે પેટ્રોલ પંપનો તો અવિભાજ્ય ભાગ છે. હાઈવેની શોભા પણ ગલ્લા જ વધારે છે. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટની કલ્યના ગલ્લા વગર શક્ય નથી. ભારતનું ભાગ્યે જ કોઈ ગામનું ગલ્લા વગરનું હશે. જે ગામડાંમાં બસ જતી નથી, પાકો રસ્તો નથી, લાઈટ નથી. અરે પીવા માટે પાણી પણ નથી ત્યાં નથી, પણ ગલ્લા ચોક્કસ હોવાના. ગાડ જંગલોની વચ્ચે આવેલાં નાનકડાં ગામડાં હોય કે રણ વચ્ચેનાં થોડાંક ઝૂપડાં હોય કે પછી પર્વત ઉપરનાં છૂટાંછવાયાં ઘર હોય ત્યાં પણ ગલ્લો હોવાનો જ. સમુદ્ર વચ્ચે ચાલતી સ્ટીમરોમાં પણ તમને તમાકુ ચોક્કસ મળે.

સ્થળ, જગ્યા, આર્થિક સ્થિતિ અને શોખ પ્રમાણે ગલ્લાનાં સ્વરૂપો જુદાં જુદાં હોય છે. આલીશાન ગલ્લા ઉપર ટેપ, રેડિયો, ટી.વી. જેવી આધુનિક જુદાં હોય છે. આમાન્ય ગલ્લામાં આમાનું કદાચ કંઈ પણ ન હોય. સગવડો હોય છે જ્યારે સામાન્ય ગલ્લામાં આમાનું કદાચ કંઈ પણ ન હોય.

શહેરના ગલ્લામાં જુદી જુદી અનેક વસ્તુઓ મળતી હોય છે. પણ છતાં કોઈપણ ગલ્લામાં તમાકુ પ્રમાણમાં ઓછી વસ્તુઓ મળતી હોય છે. પણ છતાં કોઈપણ ગલ્લામાં તમાકુ પ્રમાણમાં ઓછી વસ્તુઓ મળતી હોય છે. પણ છતાં કોઈપણ ગલ્લામાં તમાકુ એટલે ગલ્લા. તો ચોક્કસ મળે જ. આમ ગલ્લા એટલે તમાકુ અને તમાકુ એટલે ગલ્લા.

આ દેશમાં એવા ઘણા લોકો છે જે સવારે તૈયાર થઈને તરત જ જાય. મોટા ભાગના ઘણા એવા પણ છે કે જે સવારે તૈયાર થઈને જતા જ જાય. મોટા નોકરીધંધે જતાં અને આવતાં બન્ને વખતે ગલ્લે રોકાઈને જતા હોય છે.

જમીને રાત્રે ફરવા જવાના સ્થળ તરીકે ગલ્લા સર્વ સ્વીકાર્ય વસ્તુ છે. રજાના દિવસે અને તહેવારોના દિવસે ગલ્લા ઉપરની હાજરી વધી જાય છે. કિકેટમેચ, ચુંટણી, સરધસ, જાહેરસભા કે મેળાઓ વખતે ગલ્લાઓ સોને

કળાએ ખીલી ઉઠે છે. ગીત સંગીત, અને ટીવી દૂર દૂરથી લોકોને આકાશિત કરે છે. આમ એક નાનકું મંડળ ગલ્લાની આજુબાજુ વહેલી સવારથી માંડી સાંજ સુધી જામેલું રહે છે.

તોફાનો હોય કે કરફચુ હોય ત્યારે શહેરના બધા જ ધંધા બંધ થઈ જાય છે. લોકો ઘેર આવીને આરામ કરે છે ત્યારે પણ ગલ્લાઓ તો અચૂક ચાલતા જ હોય છે. આમ ગલ્લા બારે માસ વગર રજાએ વહેલી સવારથી મોડી રાત સુધી ખુલ્લા રહે છે.

ગલ્લાના થોડાક ફાયદા પણ છે; જેમાં તમારે એ વિસ્તારની કોઈપણ માહિતી જોઈતી હોય તો ગલ્લા ઉપરથી ચોક્કસ મળી જાય. કોઈપણ સરનામાં ઉપરથી રસ્તો પૂછવા માટે સૌથી સારી જગ્યા ગલ્લો છે. કોઈપણ છોકરા-છોકરીનું ચારિત્ર, ધરની આર્થિક અને સામાજિક સ્થિતિ એમાં છેલ્લામાં છેલ્લા ફરફાર તમને ગલ્લા ઉપરથી જાણવા મળે. સમૂહમાં જતાં આવતાં પહેલાં મોટા ભાગના લોકો ગલ્લે મળવાનું પસંદ કરતા હોય છે. પછી ભલે તે ફરવા જતા હોય, મિટિંગમાં જતા હોય, સ્કૂલે જતા હોય, કોલેજ જતા હોય કે લોકાચાર જતા હોય પણ મળે તો ગલ્લા આગળ જ. ધંધા લોકો મિટિંગ પણ ગલ્લા ઉપર જ રાખતા હોય છે. મોટાભાગના ગલ્લાઓ એ વ્યસનીઓના અજા જ હોય છે. ત્યાં બધા જ પ્રકારના અસામાજિક ધંધાઓ ધીરેધીરે વિકાસ પામતા હોય છે.

ગણાં મારવાં, ઠઠામશકરી કરવી, છોકરીઓની છેડતી કરવી એ તો લગભગ બધા જ ગલ્લાની આજુબાજુ અવારનંવાર બનતું જ હોય છે.

સમાજમાં આડા સંબંધાં, દારુ, જુગાર, અફીઝા, ચરસ, ગાંઝો, ડ્રગ, ચોરી, લુંટફાટ બળાતકાર, ખૂન જેવા અનેક પ્રકારના ગેરકાયદેસર અને સમાજવિરોધી કામોની ટ્રેનિંગ ગલ્લાની આજુબાજુથી જ મળે છે અને ત્યાં જ એમને મદદ કરનાર, તૈયાર કરનાર અને ઉપયોગ કરનાર લોકો મળી આવે છે.

મારી દસ્તિએ તો ગલ્લો એવો લઘુઉદ્યોગ છે જેને શરૂ કરવા માટે જગ્યા ખરીદવાની જરૂર પડતી નથી. કોઈપણ જાહેર સ્થળે એને સહેલાઈથી શરૂ કરી શકાય છે. તેને શરૂ કરવા માટે બહુ મોટા ખર્ચની જરૂર નથી. તમારી તાકાત પ્રમાણે એને શરૂ કરી શકો. એના માટે અભ્યાસની પણ જરૂર નથી. જેટલો ઓછો અભ્યાસ એટલું વધુ સારું. એ જ પ્રમાણે કોઈ વિશિષ્ટ પ્રકારની આવડત કે ટ્રેનિંગની જરૂર પડતી નથી. કેશન પ્રમાણેનો પહેરવેશ અને બોલવાની છટા આટલું હોય એટલે ચાલે. અરે ! ન હોય તો પણ ચાલે.

આ રોગ ઉછેર કેન્દ્રો અનેક રીતે ખરાબ છે જ પણ એ સર્વમાં સૌથી ખરાબ વસ્તુ ત્યાં વેચાતી તમાકુ છે. (તમાકુના ગેરકાયદા માટે જુઓ આગળના પ્રકરણ.)

## \* ગલ્લા બંધ થાય તો...

ગલ્લા બંધ થાય તો આ દેશને અનેક મોટા ફાયદાઓ થાય જેણા કલ્યના ડોક્ટરો, પોલીસ અને ખરાબ થઈ ગયેલાં બાળકોના માબાપ સિવાય કોઈને નહીં આવે. છતાં મહત્વના ફાયદા નીચે મુજબ છે :

૧. સમયનો પુષ્ટું બચાવ થાય.
૨. છોકરીઓની છેડતી બંધ થાય.
૩. ચોરી, લુટફાટ, મારામારી ખૂબ જ ઓછી થાય.

૪. દારુ, અફીશ, ગાંઝો, ચરસ, બીડી, સિગારેટ, તમાકુ જેવાં વ્યસનોમાં બહુ જડપથી ઘટાડો થાય.

૫. રોગની માત્રા ખૂબ જ ઘટી જાય.

બી.પી., હદ્દ્યરોગ, લક્વો, કેન્સર, ખાંસી, કફ, શાસના રોગો, પગનું ગેન્ડ્રીન થઈ જવું, આંખો ખરાબ થાય, અપચો, પાચનશક્તિ મંદ થઈ જવી. થાકી જવું, પગ દુઃખવા, વિચારશક્તિમાં ઘટાડો, ગુસ્સો આવવો, નિરાશ થઈ જવું જેવા અનેક રોગો બંધ થઈ જાય.

કદાચ ભારતમાં જે ડોક્ટરોની અને ડૉસ્પિટલોની તંગી છે એ કાપુમ માટે દૂર થઈ જાય.

૬. શારીરિક અશક્તિને કારણે ધંધા અને નોકરીમાં ગેરહાજરી ઓછી થઈ જીય અને નોકરીધંધામાંથી વહેલી નિવૃત્તિ લેતા લોકો અટકી જાય.

૭. આર્થિક અને સામાજિક પ્રશ્નોમાં થતો ફાયદો ગણ્યતરી ન કરી શકીએ એટલો મોટો છે.

## \* તમે શું કરશો ?

આ બધી વાતો સાથે બધા જ સહમત થાય છે પણ કંઈ કરવાનું આવે ત્યારે મોટાભાગનાને કંઈ જ સુણતું નથી. આ રહ્યા કેટલાક સરળ રસ્તાઓ.

૧. તમે ગલ્લે ન જશો.
૨. તમારાં બાળકોને ગલ્લે ન જવા દેશો.
૩. બીજા કોઈપણ લોકો ગલ્લે જતા હોય તો તેમને રોકો.
૪. તમારા વિસ્તારમાં નવા ગલ્લા થતા અટકાવો.
૫. અત્યારે જે લોકો ગલ્લા ચલાવે છે એમને વધુ સારા ધંધા કે નોકરી

બતાવી ગલ્લો બંધ કરાવો.

૬. જો ગલ્લો બંધ કરવો શક્ય ન હોય તો એનું સ્વરૂપ એવું કરો કે ગલ્લાવાળાને ફાયદો થાય અને સમાજને નુકસાન ન થાય.

તમે તમારી બુદ્ધિ ચલાવશો તો તમને અનેક રસ્તાઓ જડી આવશે.  
કેવી રીતે કરશો ?

તમને થશે કે તમે વાત કરશો તો ગલ્લાવાળા વિરોધ કરશો. તો તમારી વાત ખોટી છે. એમને પણ એમનાથી થતા આડકતરા નુકસાનથી દુઃખ થાય છે. એમને આ બધું કરવું ગમતું નથી. પણ ના છૂટકે પોતાના પેટ માટે, પોતાના કુટુંબ માટે એમને ન ગમતો વ્યવસાય સ્વીકારે છે.

જો તમે એમની સાથે વાત કરશો તો એ જરૂર ખુશ થશો. એમને કંઈક એવો રસ્તો બતાવો જેમાં એમનો જીવનનિવાહ ચાલે અને સમાજનું ખોટું પણ ન થાય. મને એવા ઘણા ગલ્લાવાળા ધ્યાનમાં છે જેમનું એમ કહેવું છે કે આનાથી ઓછી આવક મળે છે તો પણ અમે ખુશ છીએ. અમને કોઈ સારો રસ્તો બતાવો.

એમને તો બદલાવું જ છે. તો તમે રાહ શું જોઈ રહ્યા છો ? આજે જ તમારું કામ શરૂ કરો. તમે કરેલા કામનાં પરિણામો અમને જગ્ણાવો. શુભેચ્છા...



# આપ લેટ, દ્વારા કે શ્રદ્ધાંજલિ આપવા માગો છો ?

- તો એવી ભેટ આપો જે :

- |   |  |
|---|--|
| <ul style="list-style-type: none"> <li>* મોંધી ન હેય.</li> <li>* વાપરણારણે જીયદો થાય.</li> <li>* સર્વોચ્ચ પ્રેમ વ્યક્ત થાય.</li> <li>* વર્ષો સુધી સતત વપરાય.</li> <li>* સમય જતાં જૂની ન લાગે.</li> <li>* બધા જ પ્રસંગે કામ લાગે.           <ul style="list-style-type: none"> <li>- દિવાળી, નાતાલ વગેરે તહેવારો</li> <li>- જન્મ, જન્મતિથિ, લગ્ન, લગ્નતિથિ</li> <li>- મૃત્યુ, મૃત્યુતિથિ, શ્રદ્ધાંજલિ</li> </ul> </li> <li>* સમાજસેવા પણ થાય.</li> </ul> | <ul style="list-style-type: none"> <li>* સૌને પસંદ પડે.           <ul style="list-style-type: none"> <li>- નાનાં કે મોટાં</li> <li>- વધુ કે ઓછું ભણેલા</li> </ul> </li> <li>* બધા જ લોકોના કામમાં આવે           <ul style="list-style-type: none"> <li>- ઘર, કુટુંબ</li> <li>- પડોશી, મિત્રો</li> <li>- સહકર્મયારીઓ</li> </ul> </li> <li>* તમને કંઈક કર્યાનો સંતોષ થાય.</li> <li>* “જીવનદીન” જેવી શ્રેષ્ઠ ભેટ હેય</li> </ul> |
|---|--|

- તો આપ પસંદ કરો :

## કેન્સર વિજય

- \* “કેન્સર એટલે કેન્સર” એ માન્યતા ફૂર કરે કેન્સર વિજય માટેના સ્વસ્તાઓ બતાવતું અદ્ભુત પુસ્તક.
- \* ગુજરતી સાહિત્યમાં કેન્સર ઉપર વાસ્તવદર્શી અને છતાં સર્વે ઉપયોગમાં લઈ શકે એવા સચોટ ઉપાયો બતાવતું પહેલું જ પુસ્તક.
- \* અનેક મેડિકલ એસોસિયેશનો, કલબો, સામાજિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીમાં આપેલાં ભાખણો અને અંગાત અનુભવોનો નિયોડ.
- \* મેડિકલ ઇન્ક્લિબેશન ટેકનોલોજીમાં પાયાનું કામ કર્ણાર ગુજરતના ખ્યાતનામ કેન્સરના સર્જન ડૉ. પી. બી. પટેલના વર્ષોના પરિશ્રમનું ફળ.

- વિશેષતાઓ :

- \* કોઈપણ વ્યક્તિ સમજુ શકે તેવી સરળ રજૂઆત
- \* કેન્સર થવાનાં કારણો
- \* વહેલા નિદાનના સ્વસ્તા.
- \* વિવિધ પ્રકારની સાખ્યાચે

- \* કેન્સર ઉપર વિજય મેળવવાના સરળ ઉપાય.
- \* ઓછા ખરો કેન્સર ઉપર વિજય મેળવવાના ઉપાયો.
- \* કેન્સરના દર્દીના જીવન, પૈસા અને કુટુંબના આયોજનના સ્ત્રતા.
- \* કેન્સર પછી સુખ, સમૃદ્ધિ, આનંદ અને આયુષ્ય વધારવાના સ્ત્રતા.
- \* વિચારો, માન્યતાઓ અને સ્વભાવનો કેન્સર સાથેનો સંબંધ
- \* સામાજિક માન્યતાઓ, ધર્મનો અને આયુર્વેદનો કેન્સર સાથેનો સંબંધ.
- \* કેન્સર થતું અટકાવવાના ઉપાય
- \* હલતાં અને ચાલતાં તમે અનેકને કેન્સર થતું અટકાવી શકો એવાં ઉપયોગી સૂચનો.
- \* ધૂખપાન / તમાકુનું વ્યસન ફૂર કરવાના સરળ ઉપાય
- \* સહેલાઈથી આસેગ્ય વધારવાના સ્ત્રતા
- \* રેગ્પ્રાટિકાર્ક શક્તિ વધારવાના સ્ત્રતા.
- \* જીવનની દરેક વિષમ પરિસ્થિતિમાં સુખ, શાંતિ અને આનંદ મેળવવાના સ્ત્રતા
- \* જીવન જીવવાની પર્યાતિ, વિચારો અને આચરણામાં કાન્ટિકાચે ફેલ્ક્ઝારે લાવે તેવું ઉપયોગી પુસ્તક.
- \* અનેક સાહિત્યકારો, પ્રોફેસરો, ડોક્ટરો, કેન્સર નિષણાતો, એન્જિનિયરો, વકીલો અને સમાજસેવકોની ખૂબ જ પ્રશંસા પામેલું પુસ્તક.

### **વ્યસનનુકિલના સરળ ઉપાયો**

- \* બીડી, સિગારેટ, તમાકુ, છીકણી, ડ્રગ, ઘર વગેરે વ્યસનનોથી થતા નુકસાન પર સંપૂર્ણ માર્ગદર્શન
- \* તમારં બાળકો ચોરીધૂપીથી વ્યસન કરે છે કે નહિં તે જાણવાના અદ્ભુત સ્ત્રતાઓ
- \* તમાર પ્રિયપાત્ર (ભાઈ, પિતા, મિત્ર, પુત્ર કે પતિ)ને દુઃખ લગાડવા વગર, ગઘડો કર્યા વગર, એમને ખબર પણ ન પડે એ ચીતે વ્યસનનુકિલ કરવાના વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્ત્રતાઓ
- \* કોઈની મદ્દ વગર સ્વયં વ્યસનનુકિલ થવાના સુલભ સ્ત્રતાઓ
- \* વ્યસનનુકિલ પછીના ગાળાની તકલીઝેને કાબૂમાં રખવાના કીમિયાઓ
- \* ફરીથી વ્યસન શરૂ ન થાય એના માટે માર્ગદર્શન.
- \* છેલ્લા ૧૦ વર્ષના વ્યસનનુકિલ અભિયાનમાં જે કીમિયાઓએ અનેક અંદ્રા વ્યસનીયોને વ્યસનનુકિલ બનાવ્યા છે એવા વાસ્તવિક જીવનની કઠોર સત્યોની એરા ઉપર સફળ થયેલ કીમિયાઓનો લંડાર.
- \* જે વાંચીને ગુજરાતમાં અનેક જગ્યાએ વ્યસનનુકિલ કેન્દ્રો શરૂ થયાં છે, જે દરેક કેન્દ્ર સફળ કામકાજ કરી રહ્યું છે.

- \* જેને વાંચીને અનેક લોકોએ પોતાના અંગાત સર્કલમાં, વેપાએઓને કે મિત્રોને બેટ આપવા પ્રેરણ્યા છે.
  - \* લાયન્સ કલબ ઓફ શાહીબાગ, સી. જમનાઇસની કું., ગાયત્રી પરિવાર, વિજય બેન્ક જેવી અનેક ખાનગી અને જાહેર સંસ્થાઓનો તન, મન અને ધનથી સંસ્કાર મળી રહ્યો છે.
  - \* તમારા ઘરમાં ડોકટરોને ન સમજાતી અને વાર્ષાર થતી બીમારીનું કારણ વ્યસનો છે. ખાસ કરીને, નાનાં બાળકો અને પણી કેવી રીતે માંદં પડી જાય છે અને દીલધડક ચિતાર
  - \* તમારા અંગાત સ્વાર્થ માટે, સમાજ સેવા માટે, બીજાને જીવનદાન જેવું મોટું દિન આપવા માટે તમે આજે જ આ અભિયાનમાં જોડાઈ જાઓ. તમારી આમને ખૂબ જ જરૂર છે.
- લોકોનો સતત પ્રેમ અને પ્રશંસા મેળવો.  
 ચિંન્હુવી અને અમૃત્ય બેટ આપો.  
 કેન્સર સામેના મહિયુઝીમાં આપનું યોગદાન આપો.  
 જીવનદાન આપવા માટે પૈસાનો સંદેશિપયોગ કરો.  
 આજે જ નિર્ણય લો, સાચો નિર્ણય લો.  
 એવો નિર્ણય લો, જેથી અનેક કુદુર્ભોને નવજીવન મળો.
- \* હોસ્પિટલો, કલબો, જાહેર સંસ્થાઓ, લિમિટેડ કંપનીઓ, બેંકો, સમાજસેવકો, પુષ્ટકવિકેતાઓ, બુક સ્ટોરો અને ગોફટ સ્ટોરોએ પણ પોતાના ઓર્ડર નીચેના સરનામે નોંધાવવા.

મળો અથવા લખો :

**ડૉ. પી. બી. પટેલ**

શિવશ્રદ્ધા સર્જિકલ હોસ્પિટલ,  
 મોહુલ સિનેમા સામે, અસાર્વા,  
 અમદાવાદ - ૩૮૦ ૦૧૬.  
 ફોન : (હોસ્પિટલ) ૩૭ ૬૪ ૬૦,  
                   37 64 60  
                   (ઘર) ૭૮૬ ૫૮ ૬૬

## લોમકનો પરિચય

નોંધ કરતાં કંઈક વધુ અને વિશિષ્ટ કર્ત્વાની ભાવનાથી કોમ્પ્યુટરાઈગડ મેડિકલ લાઇફસ્ટ્રી અને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ જોડે On line link ઊભી કરી, કોઈપણ રોગ વિશે વિશ્વાની સૌથી અધતન માહિતી પૂરી પાડવાનું હશે કરે છે.

કેન્સર, ભાગ્યે જ થતા રોગો, કોમ્પ્લિકેટેડ પ્રોથ્રેસ, નિદાન ન થતું હૈય તેવા રોગો અને ચાર્ચવારથી ફાયદો ન થતો હૈય એવા રોગોના દર્દીઓને વિશ્વાની સૌથી અધતન માહિતીથી મદ્દ કર્ત્વાનું કામ પણ તેઓ છેલ્લા ઘણા વધોથી કરે છે.

૧૯૮૪ના ચોમાસામાં સુસ્તમાં ખેગા ફાટી નીકળ્યો. આ રોગ વિષે પ્રત્યક્ષ જ્ઞાન ન હતું. તેથી ભયનું વાતાવરણ ચાર્ચાજુ ફેલાઈ ગયું. આવા સંજોગોમાં સાચી, આધારભૂત, ઉપયોગી અને વિશ્વાની છેલ્લામાં છેલ્લી માહિતી આપવાનું કામ લેખકે પણ કરેલું છે.

મેડિકલ ઓસોસિએશનોમાં 'Secret of success in Diagnosis,' 'Art of Managing patient', 'Cancer Vijay', 'Computer and Doctors', 'Secret of Success in Medico Legal Cases' જેવાં એમનાં લેક્ચરો ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. એવી રીતે લાયન્સ કલબ, રોટરી કલબ, સામાજિક સંસ્થાઓ, શાળા, કોલેજો, ચુનિવર્સિટીઓ અને મહિલા સંસ્થાઓમાં 'ધૂમ્રપાન અને તમાકુ છોડવાના સરળ ઉપાયો', 'કેન્સર વિજય', 'સ્તરન અને ગર્ભાશાયનાં કેન્સર' જેવા વિષયો ઉપર સતત જાહેર ભાષણો આપતા રહે છે તેમજ સમાચારસ્પત્રો, મેગાਜિનો, ટીવી અને પેફ્ફ્લેટો દ્વારા આરોગ્ય સુધારવાના ખ્યાલો લોકોને આપે છે.

'કેન્સર એટલે કેન્સલ' એ માન્યતા ફૂર કરી, કેન્સર ઉપર વિજય મેળવવા માટેના રૂસ્તા બતાવતું અદ્ભુત પુસ્તક 'કેન્સર વિજય'ના તેઓ લેખક છે જેમાં વાસ્તવદર્શી છતાં દેખે વ્યક્તિ લઈ શકે તેવા સચોટ ઉપાયો દર્શાવ્યા છે. આ પુસ્તક તથીબી જગતમાં અને સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયું છે. એની અનેક લોકોએ ખૂબ પ્રસંગા કરી છે.

શાંત, ઓછાબોલા, સતત પ્રવૃત્તિશીલ, અભ્યાસુ છે અને કંઈક વિશિષ્ટ કર્ત્વાની ભાવના સતત તેમનામાં દેખાઈ આવે છે.



ડૉ. પી. બી. પટેલ